

ॐ

ભર્તારક શ્રી જ્ઞાનભૂષણ વિરચિત

બદ્વાજાન કશેલાણી

પ્રકાશક

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંડિર ટ્રસ્ટ
સોનગઢ-૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)



શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦

ભગવાન શ્રી કુંદકુંદ-કહીનાનકેનશાસ્ત્રમાળા પુષ્પ-૧૭૮

ॐ

નમઃ શુદ્ધચિદ્રૂપાય ।

ભાષારક શ્રી જ્ઞાનભૂષણ વિરાયિત

અચલજ્ઞાનિતરં ત્રિપુરી

He 001  મેદાનંદ.

: અનુવાદક :

ભ. શ્રી પ્રજ્વલાલ ગિરધરલાલ શાહ



: પ્રકાશક :

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,

સોનગઢ-૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)

પ્રથમ આવૃત્તિ	પ્રત ૨૦૦૦	વિ સં. ૨૦૪૬	ઈ.સ. ૧૯૯૯
દ્વિતીય આવૃત્તિ	પ્રત ૨૦૦૦	વિ સં. ૨૦૬૫	ઈ.સ. ૨૦૦૮


તત્ત્વજ્ઞાનતરંગિણી (ગુજરાતી)ના
૪ સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તાર્ય ષ્ણુ
શ્રી દાદર દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, મુંબઈ
(પૂજય ગુલાએવશ્રીની ૧૨૦મી જન્મજયંતીની
સુવર્ણપુરીમાં ઉજવણીની ખુશાલીમાં)

આ શાસ્ત્રની પડતર કિંમત રૂ. ૨૪=૫૦ થાય છે. અનેક મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત રૂ. ૨૦=૦૦ થાય છે. તેમાંથી ૫૦% શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં આવતા આ શાસ્ત્રની કિંમત રૂ. ૧૦=૦૦ રાખવામાં આવી છે.

કિંમત રૂ. ૧૦=૦૦

કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ
સોનગઢ ૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)
PH (02846) 244081

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦



પરમ પૂજય અધ્યાત્મમૂર્તિ સદગુરુદેવ શ્રી કાન્ચુસ્વામી

પ્રકાશકીય નિવેદન

જન્મમરણમય દુઃખપ્રચુર યતુગતિ-પરિભ્રમણના અંતનો ઉપાય એકમાત્ર જિનેન્દ્રપ્રણીત વીતરાગ ધર્મ છે. વીતરાગ ધર્મનું મૂળ, સ્વ-પરના અને સ્વભાવ-વિભાવના ભેદજાન દ્વારા પ્રગટ થતું, સ્વાનુભૂતિપ્રધાન નિર્મણ સમ્યગદર્શન છે. તે પ્રાપ્ત કરવા માટે વિપરીત-અભિનિવેશવિહીન-તત્ત્વજ્ઞાનહેતુક—જીવ આદિ નવ તત્ત્વોના યથાર્થ જ્ઞાનવડે ભેદજાનના અભ્યાસ દ્વારા—નિજ-શુદ્ધાત્મજ્ઞાન અત્યંત આવશ્યક છે. સ્વાનુભવસ્યંહી તે પવિત્ર જ્ઞાનના આશ્રયભૂત શુદ્ધાત્મતત્ત્વનું અદ્ભુત સ્વરૂપ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તેમનાં શ્રી સમયસાર આદિ અનેક પરમાગમોમાં દર્શાવ્યું છે. ઉત્તરવર્તી અનેક ગ્રંથકારોએ પણ, ભગવાન કુંદકુંદાચાર્યદેવનું અનુસરણ કરીને તેનું—આત્મહિત માટે મૂળ પ્રયોજનભૂત શુદ્ધાત્મકદ્વારા—નિરૂપણ પોતપોતાના ગ્રંથોમાં કર્યું છે. ભડ્ઝારક શ્રી જ્ઞાનભૂષણજીએ પણ આ ‘તત્ત્વજ્ઞાન-તરંગિણી’ નામના ગ્રંથમાં આત્મકદ્વારા વર્ણન ‘શુદ્ધચિદ્દૂપ’ શબ્દથી ઘણું સુંદર કર્યું છે કે જેનો રૂચિપૂર્વક સ્વાધ્યાય કરતાં, ‘શુદ્ધચિદ્દૂપ’ના અનુપમ મહિમાથી ભરપૂર એક મધુઉરા સંગીતનો અનુભવ થાય છે.

આ યુગમાં મુમુક્ષુજ્ગતને ભવાંતકારી સમ્યગદર્શન અને સ્વાનુભૂતિનું તથા તે બંનેના આલંબનભૂત નિજશુદ્ધાત્મતત્ત્વનું—ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકપરમભાવનું—અચિંત્ય મહત્ત્વ સમજવામાં આવ્યું હોય તો તે બધો પ્રતાપ—બધો ઉપકાર—પરમતારણહાર પરમકૃપાળું પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો છે; તેમના જ પુનિત પ્રભાવથી મુમુક્ષુ સમાજમાં સમ્યગદર્શનના વિષયભૂત ‘શુદ્ધચિદ્દૂપ’ના અભ્યાસની ગ્રવૃત્તિ થઈ છે.

‘નિજશુદ્ધચિદ્દૂપ’ની રૂચિના પોષણ અર્થે, અધ્યાત્મયુગ પ્રવર્તક પરમપૂજ્ય ગુરુદેવશ્રીની પવિત્ર સાધનાભૂમિ સોનગઢમાં પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રીની મંગલવર્ષિણી છાયામાં પ્રવર્તમાન દેવગુરુભક્તિભીની અનેક ગતિવિધિના અંગભૂત સત્ત્વાહિત્યપ્રકાશનવિભાગ દ્વારા, ‘પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી—જન્મશતાબ્દી’ વર્ષના મંગલ અવસરે, આ ‘તત્ત્વજ્ઞાન-

[૪]

તરંગિણી'નો ગુજરાતી ભાષાનુવાદ સંસ્થા દ્વારા પ્રથમ વાર પ્રકાશિત કરતાં અતિ હર્ષ થાય છે.

આ ગદ્યાનુવાદ, 'શ્રીમદ્ રાજચંદ્ આશ્રમ—આગાસ' દ્વારા પ્રકાશિત તત્ત્વજ્ઞાન-તરંગિણીના આધારે વઠવાણનિવાસી બ્ર. શ્રી પ્રજલાલભાઈ ગિરધરલાલ શાહે કરી આપ્યો છે; તથા આ સંસ્કરણમાં તત્ત્વજ્ઞાન-તરંગિણીનો સ્વ. શ્રી રાવજીભાઈ છગનભાઈ દેસાઈ રચિત ગુજરાતી પદ્ધાનુવાદ પણ આપવામાં આવ્યો છે. તેથી ગદ્યાનુવાદ અને પદ્ધાનુવાદ કરનાર તે બંને મહાનુભાવોનો તથા ઉક્ત પ્રકાશક સંસ્થાનો અત્રે આભાર માનીએ છીએ.

આ પુસ્તકના પ્રકાશનની યોજના તથા પૂર્ફસંશોધનકાર્ય શ્રી પવનકુમારજી જૈને, તથા સુંદર મુદ્રણકાર્ય 'કહાન મુદ્રણાલય'ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને કરી આપ્યું છે; તેથી તે બંનેનો પણ આભાર માનીએ છીએ.

ટ્રસ્ટના આ અભિનવ પ્રકાશન દ્વારા મુમુક્ષુસમાજ અવશ્ય લાભાન્વિત થાય એ જ આજના પ્રકાશન-અવસરે મંગળ ભાવના.

વિ.સં. ૨૦૪૬, માગશાર વદ ૮,
(શ્રી કુંદકુંદ-આચાર્યપદદિન)
‘કહાનગુરુ-જન્મશતાબ્દી’ વર્ષ

સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)



પ્રકાશકીય નિવેદન

(દ્વિતીય આવૃત્તિ)


આ ગુજરાતી “તત્ત્વજ્ઞાન તરંગિણી” ગ્રંથની પ્રથમ આવૃત્તિ ખપી જવાથી તેની દ્વિતીય આવૃત્તિ ફરી છપાવવામાં આવેલ છે. આગળની આવૃત્તિમાં જે મુદ્રણ અશુદ્ધિઓ હતી તે સુધારીને આ આવૃત્તિ મુદ્રિત કરવામાં આવી છે.

મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને કાળજીપૂર્વક સારું કરી આપ્યું છે તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે.

આ ગ્રંથના પઠન-પાઈનથી મુમુક્ષુ જીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રામ કરી આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના

વિ.સं. ૨૦૯૫, વૈશાખ સુદ ૨,
પૂજ્ય ગુરુદેવશ્રીનો
૧૨૦મો જન્મોત્સવ
તા. ૨૬-૪-૨૦૦૮

સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)



વિષયાનુક્રમણિકા

૧.	શુદ્ધ ચિદ્રૂપનાં લક્ષણા	૧
૨.	શુદ્હ ચિદ્રૂપના ધ્યાનમાં ઉત્સાહ પ્રદાન	૧૦
૩.	શુદ્હ ચિદ્રૂપની પ્રાપ્તિના ઉપાય	૨૨
૪.	શુદ્હ ચિદ્રૂપના માર્ગની સુગમતા	૩૨
૫.	શુદ્હ ચિદ્રૂપની પ્રાપ્તિ કદી પૂર્વે કોઈ વાર થઈ નથી	૪૧
૬.	શુદ્હ ચિદ્રૂપનાં સ્મરણમાં નિશ્ચળતાનો બોધ	૫૦
૭.	શુદ્હ ચિદ્રૂપના સ્મરણમાં નયોના અવલંબનનું વર્ણન	૫૮
૮.	શુદ્હ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે ભેદજ્ઞાનની આવશ્યકતા	૬૬
૯.	શુદ્હ ચિદ્રૂપના ધ્યાનને માટે મોહત્યાગની આવશ્યકતા	૭૪
૧૦.	શુદ્હ ચિદ્રૂપનાં ધ્યાનાર્થે અહંકાર મમકારના ત્યાગનો ઉપદેશ	૮૩
૧૧.	શુદ્હ ચિદ્રૂપના ઉપાસકોની વિરલતાનું વર્ણન	૮૮
૧૨.	શુદ્હ ચિદ્રૂપની પ્રાપ્તિનું અસાધારણ કારણ રત્નત્રય	૯૭
૧૩.	શુદ્હ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે વિશુદ્ધિની ઉપયોગિતા	૧૦૫
૧૪.	અન્ય કાર્યો કરવા છતાં પણ શુદ્હ ચિદ્રૂપના સ્મરણનો ઉપદેશ	૧૧૩
૧૫.	શુદ્હ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે પર દ્રવ્યોનાં ત્યાગનો ઉપદેશ	૧૨૨
૧૬.	શુદ્હ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે નિર્જન સ્થાનની આવશ્યકતા	૧૩૦
૧૭.	શુદ્હ ચિદ્રૂપમાં પ્રેમ વધે તે માટે વાસ્તવિક સુખનું પ્રતિપાદન	૧૩૭
૧૮.	શુદ્હ ચિદ્રૂપની પ્રાપ્તિનો કુમ	૧૪૫



ॐ

પરમાત્મને નમઃ

ભડ્ધારક શ્રી જ્ઞાનભૂષણ વિરચિત

તત્ત્વજ્ઞાન તરંગિએ

અધ્યાય ૧ લો

[શુદ્ધ ચિદ્રૂપનાં લક્ષણ]

પ્રણાય શુદ્ધચિદ્રૂપં સાનન્દं જગદુત્તમં ।
તલ્લક્ષણાદિકં વચ્મિ તદર્થી તસ્ય લબ્ધયે ॥૧॥

(હંગિત)

આનંદનું જે ધામ સર્વોત્તમ જગતમાં જે સદા,
તે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચિદ્રૂપ વંદું ભક્તિથી મુદા;
તે સ્વરૂપ પ્રાપ્તિ કારણે તેનો જ અર્થી સર્વદા,
લક્ષણ વગેરે ભાણું તેનાં, પામું ચિદ્રૂપ સંપદા. ૧

અર્થ :—આનંદથી પરિપૂર્ણ, જગતમાં સર્વોત્તમ, શુદ્ધ
ચૈતન્યસ્વરૂપને પ્રણામ કરીને તેનો અભિલાષી હું તેની પ્રાપ્તિ માટે તે
શુદ્ધ ચિદ્રૂપનાં લક્ષણ આદિને કહું છું. ૧.

પશ્યત્યવैતિ વિશ્વં યુગપત્રોકર્મકર્મણામળુભિः ।

અખિલૈરૂક્તો યોઽસૌ વિજ્ઞેયઃ શુદ્ધચિદ્રૂપઃ ॥૨॥

યુગપદ જુવે જાણે જગત, તે શુદ્ધ ચિદ્રૂપ જાણાજો;
સૌ કર્મ ને નોકર્મ પરમાણુથી મુક્ત પ્રમાણાજો. ૨.

આર્થ: —જે સમસ્ત વિશ્વને એકસાથે દેખે છે, જાણે છે, નોકર્મ અને કર્મનાં સમસ્ત પરમાણુઓથી મુક્ત છે, તેને શુદ્ધ ચિદ્રૂપ જાણવો. ૨.

અર્થાત् યथાસ્થિતાન् સર્વાન् સમં જાનાતિ પશ્યતિ ।

નિરાકુલો ગુણી યોડસૌ શુદ્ધચિદ્રૂપ ઉચ્ચ્યતે ॥૩॥

સર્વ પદાર્થ ચથાર્થ યુગપ્રદ જે સદા જાણે જુવે,
તે શુદ્ધ ચિદ્રૂપ સ્વગુણ નિર્ભર સુખ નિરાકુળ અનુભવે. ૩.

આર્થ: —જે, યથાસ્થિત સર્વ પદાર્થોને એક સાથે જાણે છે અને દેખે છે, આકુળતા રહિત છે, ગુણવાન છે, તેને શુદ્ધ ચિદ્રૂપ કહે છે. ૩.

સ્પર્શરસગંધવર્ણોः શબ્દૈર્મુક્તો નિરંજનઃ સ્વાત્મા ।

તેન ચ ખૈરગાહોડસાવનુભાવનાગૃહીતવ્યઃ ॥૪॥

સ્વાત્મા નિરંજન સ્પર્શ રસ રૂપ ગંધ શબ્દ વિઠીન એ,
તેથી ન ઈન્દ્રિય ગ્રાહ્ય પણ અનુભાવનાએ ગ્રાહ્ય એ. ૪.

આર્થ: —પોતાનો આત્મા સ્પર્શ, રસ, ગંધ, રૂપથી, શબ્દથી રહિત છે, નિરંજન છે અને તેથી ઈન્દ્રિયો વડે ગ્રહાવા યોગ્ય નથી, તે અનુભાવનાથી (આત્મભાવનાથી) ગ્રહણ થવા યોગ્ય છે.

સસાનાં ધાતૂનાં પિંડો દેહો વિચેતનો હેયઃ ।

તન્મધ્યસ્થોડવैતીક્ષતેડખિલં ચો હિ સોહં ચિત્ત ॥૫॥

તન તો અચેતન સાત ધાતુપિંડ તજવા ચોગ્ય તે,
તે મધ્ય રહી જાણે જુવે જે તે હું ચિદ્રૂપ મુજ એ. ૫.

આર્થ: —દેહ તે સાત ધાતુઓનો સમૂહ છે, અચેતન છે, હેય છે, તેની મધ્યમાં રહેલો જે સર્વને જાણે છે, દેખે છે તે હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું. ૫.

આજન્મ યદનુભૂતં તત્સર્વ યઃ સ્મરન् વિજાનાતિ।
કરરેખાવત् પશ્યતિ સોऽહં બદ્ધોऽપિ કર્મણાઽત્યંતં ॥૬॥

શ્રુતમાગમાત્ ત્રિલોકત્રિકાલં ચેતનેતરં વસ્તુ ।
યઃ પશ્યતિ જાનાતિ ચ સોऽહં ચિદ્બૂપલક્ષણો નાન્યઃ ॥૭॥

અનુભવ્યું જે જે જન્મથી તે તે સકલ જાણે સ્મરે,
કરરેખાવત् દેખે હું તે અતિ કર્મબદ્ધ છતાં ખરે; ૬.

વસ્તુ ત્રિલોક ત્રિકાળવર્તી ચિદ્ અચિદ્ સુણી શાસ્ત્રથી,
જાણે જુવે જે તે હું ચિદૂપ, મુજ લક્ષણ પર નથી. ૭.

અર્થ :—જે જન્મથી માંડીને અનુભવેલું સર્વ યાદ કરીને જાણે
છે, હાથની રેખા પેઠે દેખે છે, તે હું કર્મથી અત્યંત બંધાયેલો છું.
આગમમાંથી સાંભળેલ, ત્રણ કાળ અને ત્રણ લોકવર્તી ચેતન અને જડ
પદાર્થાને જે દેખે છે અને જાણે છે તે ચિદૂપ લક્ષણોવાળો હું છું, અન્ય
હું નથી. ૬-૭.

શુદ્ધચિદૂપ ઇત્યુક્ત જ્ઞેયઃ પંચાર્હદાદયઃ ॥૮॥

અન્યેઽપિ તાદૂશાઃ શુદ્ધ શબ્દસ્ય બહુભેદતઃ ॥૯॥

અરિહંત આદિ પંચ જાણો, શુદ્ધ ચિદૂપ જ્યાં કહો,
તેવા બીજા પણ જાણાવા, બહુ ભેદ શુદ્ધ તણા લઈઓ. ૮.

અર્થ :—શુદ્ધ ચિદૂપ એમ કહેતાં પાંચ અરિહંતાદિ જાણવા. શુદ્ધ
શબ્દનાં અનેક ભેદ હોવાથી અન્ય પણ તેમના જેવા જાણવા. ૮.

નો દૂક્ નો ધીર્ન વૃત્તં ન તપ ઇહ યતો નૈવ સૌખ્યં ન શક્તિ-
નર્દોષો નો ગુણીતો ન પરમપુરુષઃ શુદ્ધચિદૂપતત્ત્વ ।
નોપાદેયોષ્યહેયો ન ન પરરહિતો ધ્યેયરૂપો ન પૂજ્યો
નાન્યોકૃષ્ટશ્ચ તસ્માત્ પ્રતિસમયમહં તત્ત્વરૂપં સ્મરામિ ॥૯॥

એ શુદ્ધ ચિદ્રૂપ એ જ સમ્યગ્ જ્ઞાન દર્શન ચરણ છે,
તપ સૌખ્ય શક્તિ પરમ પુરુષ સ્વગુણથી પરિપૂર્ણ છે;
નહિ ત્યાજ્ય પણ સુગ્રાહા, પર વિષ ધ્યેયરૂપ પ્રપૂજ્ય એ,
ઉત્કૃષ્ટ ઐનાથી અવર ના પ્રતિ સમય સ્મરણ સ્વરૂપ એ. ૬.

આર્થ :—અહીં શુદ્ધ ચિદ્રૂપ સિવાય બીજું દર્શન નથી, જ્ઞાન નથી,
ચારિત્ર નથી, તપ નથી, સુખ નથી, શક્તિ નથી, અદોષ નથી, ઐનાથી
બીજો ગુણી નથી, પરમ પુરુષ નથી, ઉપાદેય નથી, અહેય છે, પરથી
રહિત નથી, ધ્યેયરૂપ નથી, પૂજ્ય નથી અને બીજું ઉત્તમ નથી. તેથી દરેક
સમયે હું તે સ્વરૂપને સંભારું છું. ૮.

જેયો દૃશ્યોऽપि ચિદ્રૂપો જ્ઞાતા દૃષ્ટા સ્વભાવતः ।

ન તથાઽન્યાનિ દ્રવ્યાણિ તસ્માદ् દ્રવ્યોત્તમોऽस્તિ સः ॥૧૦॥

એ ઝોય દર્શય છતાં સ્વભાવે સ્વપરને જાણો જુવે,
જડ અન્ય દ્રવ્ય ન તુલ્ય તેની, તેથી દ્રવ્યોત્તમ હુવે. ૧૦.

આર્થ :—ચૈતન્યસ્વરૂપ આત્મા જેમ જોય અને દર્શય હોવા છતાં
સ્વભાવથી જ્ઞાતા અને દર્શા છે. તેવી રીતે અન્ય દ્રવ્યો નથી, માટે તે
(આત્મા) દ્રવ્યોમાં ઉત્તમ છે. ૧૦.

સ્મृતેः પર્યાણામવનિજલભૂતામિદ્રિયાર્थાગસાં ચ

ત્રિકાલાનાં સ્વાન્યોદિતવચનતતેઃ શબ્દશાસ્ત્રાદિકાનાં ।

સુતીર્થાનામસ્ત્રપ્રમુખકૃતરૂજાં ક્ષમારૂહાણાં ગુણાનાં

વિનિશ્ચેયઃ સ્વાત્મા સુવિમલમતિભિર્દૃષ્ટબોધસ્વરૂપઃ ॥૧૧॥

પર્યાય બહુવિદ્ય, જલધિગિરિને, ઇન્દ્રિયાર્થ પ્રમુખને,

પ્રણ કાળને, નિજ પર વચનને, શાંદ શાસ્ત્રાદિકને;

સુતીર્થ, શાસ્ત્રપ્રછાર દુઃખ, તરુ, દોષ ગુણને જે સ્મરે,

તે જ્ઞાનદંગ રૂપ સ્વાત્મનો નિશ્ચય યથાર્થ સુધી કરે. ૧૧.

આર્થ :—પર્યાયોની, પર્વતો અને સમુદ્રોની, ઈન્દ્રિયના વિષયો

અધ્યાય-૧]

[૫]

અને પાપની, ત્રણે કાળની, પોતે અને બીજાઓએ બોલેલાં વચનોની, વ્યાકરણાદિ શાસ્કોની, સુતીર્થાની, અથ્વ વગેરેથી કરાયેલા ઘાની, રોગની, વૃક્ષોની અને ગુણોની જેને સ્મૃતિ રહે છે. એવા જ્ઞાનદર્શન સ્વરૂપ પોતાના આત્માનો નિર્મણ મતિવાળાઓએ (ભેદજ્ઞાનીઓએ) વિવેકથી નિશ્ચય કરવો જોઈએ. ૧૧.

જસ્તા દૂક ચિદિતિ જેયા સા રૂપં યસ્ય વર્તતે ।
સ તથોક્તોऽન્યદ્રવ્યેણ મુક્તત્વાત् શુદ્ધ ઇત્યસૌ ॥૧૨॥
કશ્યતે સ્વર્ણવત् તજ્જૈઃ સોહં નાન્યોસ્મિ નિશ્ચયાત् ।
શુદ્ધચિદ્રૂપોऽહમિતિ ષદ્ગ્વર્ણાર્થો નિરુચ્યતે ॥૧૩॥ યુગ્મ ॥

(ઝૂલાણા)

ચિદ કહેતાં કહો જ્ઞાન દર્શન આહો !
રૂપ તે જેનું ચિદ્રૂપ જાણો;
મુક્ત પર દ્રવ્યથી શુદ્ધ કંચન સમો,
શુદ્ધ ચિદ્રૂપ પ્રાડો વખાણ્યો;
તે હું નિશ્ચય થકી, અન્ય કદી પણ નહીં,
શુદ્ધ ચિદ્રૂપ એ સ્વરૂપ માણ;
'શુદ્ધ ચિદ્રૂપ હું' અક્ષરો પદ કહ્યા,
અર્થ નિરુક્તિ તે તો વિચારં. ૧૨-૧૩.

અર્થ :—ચિદ એટલે જ્ઞાન અને દર્શન જાણો. એવું રૂપ જેનું છે, તેને ચિદ્રૂપ કહેવાય છે. તે અન્ય દ્રવ્યથી મુક્ત હોવાથી, તેના જાણનારો તેને સુવર્ણાની જેમ શુદ્ધ કહે છે. તે હું છું, નિશ્ચયથી અન્ય હું નથી. 'શુદ્ધ ચિદ્રૂપ હું' એ છ અક્ષરનો અર્થ કહેવામાં આવે છે. ૧૨-૧૩.

દૂષૈજ્ઞતિઃ શ્રુતૈર્વા વિહિતપરિચિતૈર્નિર્દિતિઃ સંસ્તુતૈશ,
નીતિઃ સંસ્કાર કોટિં કથમપિ વિકૃતિં નાશનં સંભવં વૈ ।
સ્થૂલિઃ સૂક્ષ્માર્જીવૈરસુનિકરયુતિઃ ખાપ્રિયૈઃ ખાપ્રિયૈસ્તૈ-
રન્યૈર્દ્રવ્યૈર્ન સાધ્યં કિમપિ મમ ચિદાનંદરૂપસ્ય નિત્યં ॥૧૪॥

દષ્ટ શ્રુત જ્ઞાત અનુભૂત નિંદિત રડા,
 હોય સંસ્કૃત, વિઝૃત પદાર્થો,
 હો ભલે નષ્ટ ઉત્પન્ન સ્થૂલ સૂક્ષ્મ કે,
 ચેતનાયુક્ત કે ૪૮ કદા જો;
 હો ભલે પ્રિય અપ્રિય ઈન્દ્રિયને,
 અન્ય એ, શ્રેય મારું શું સારે ?
 હું ચિદાનંદરૂપ આત્મ શાશ્વત અહો!
 કામ શું અન્ય દ્રવ્યોનું મારે ? ૧૪.

આર્થ :—જોયેલા, જાણેલા, સાંભળેલા, અનુભવેલા, નિંધ કે સુય, સંસ્કાર પામેલા કે વિકૃત થયેલા, નાશ પામેલા કે ઉત્પન્ન થયેલા, સ્થૂળ કે સૂક્ષ્મ, ૪૮ કે ચેતન, ઈન્દ્રિયોને પ્રિય કે અપ્રિય એવા તે અન્ય દ્રવ્યોથી ચિદાનંદરૂપ એવાં મને સદાય કાંઈ પણ પ્રયોજન નથી. ૧૪.

વિક્રિયાભિરશોષાભિરંગકર્મપ્રસૂતિભિः ।
 મુક્તો યોऽસौ ચિદાનન્દો યુક્તોऽનંતરૂગાદિભિः ॥૧૫॥
 અસૌ અનેકરૂપોऽપિ સ્વભાવાદેકરૂપભાગ् ।
 અગમ્યો મોહિનાં શીଘ્રગમ્યો નિર્મોહિનાં વિદાં ॥૧૬॥

અંગ કે કર્મકૃત સર્વ ૪૮ વિઝૃતિ,
 તેથી જે મુક્ત તે સૌખ્યધામી;
 યુક્ત જ્ઞાનાદિ નિજ ગુણ અનંતે સદા,
 તે ચિદાનંદ ચૈતન્યરવામી;
 સ્વગુણગણથી અનેકસ્વરૂપી છતાં,
 એકરૂપી સદા નિજ સ્વભાવે;
 ગમ્ય નહિ મોહિને, શીଘ્ર નિર્મોહી હા !
 તત્ત્વજ્ઞાની અનુભૂતિ પાવે. ૧૫-૧૬.

આર્થ :—જે શરીર અને કર્મથી થતી સમસ્ત વિક્રિયાઓથી રહિત છે, તે ચિદાનંદસ્વરૂપ અનંત દર્શનાદિ વડે સહિત છે. ૧૫.

તે અનેક રૂપવાળો હોવા છતાં પણ સ્વભાવથી એકરૂપવાળો છે.
તે મોહી જીવોને જ્ઞાય તેવો નથી અને નિર્માહી જ્ઞાનીઓને તરત જ
જ્ઞાવા—અનુભવવા યોગ્ય છે. ૧૬.

ચિદ્રૂપોऽયમનાદ્યંતः સ્થિત્યતૃપ્તિવ્યયાત્મકઃ ।

કર્મણાઽસ્તિ યુતોऽશુદ્ધઃ શુદ્ધઃ કર્મવિમોચનાત् ॥૧૭॥

આદિ કે અંત વિષ નિત્ય ચિદ્રૂપ એ,

સ્થિતિ ઉત્પત્તિ વ્યાય પ્રણ સ્વરૂપી;

કર્મથી યુક્ત તે શુદ્ધ નાહિ, શુદ્ધ જો,

કર્મથી મુક્ત સહજાત્મરૂપી. ૧૭.

અર્થ :—આ ચિદ્રૂપ આદિ અને અંત રહિત છે, સ્થિતિ, ઉત્પત્તિ
અને નાશવાળો છે, કર્મથી યુક્ત અશુદ્ધ છે, કર્મ છૂટી જવાથી (તે) શુદ્ધ
છે. ૧૭.

શૂન્યાશૂન્યસ્થૂલસૂક્ષ્મોસ્તિનાસ્તિનિત્યાઽનિત્યાઽમૂર્તિમૂર્તિત્વમુખ્યૈः ।

ધર્મેર્યુક્તોऽપ્યન્યદ્રવ્યૈર્વિમુક્તઃ ચિદ્રૂપોય માનસે મે સદાસ્તુ ॥૧૮॥

શૂન્ય, નાહિ શૂન્ય, સ્થૂલ સૂક્ષ્મ, અરૂપી રૂપી,

અસ્તિ નાસ્તિ, ક્ષણિક સર્વદા જો;

મુખ્ય નિજ ધર્મયુત, મુક્ત પરધર્મથી,

શુદ્ધ ચિદ્રૂપ મુજ મન વિરાજો. ૧૮.

અર્થ :—શૂન્ય, અશૂન્ય, સ્થૂલ, સૂક્ષ્મ, અસ્તિ, નાસ્તિ, નિત્ય,
અનિત્ય, અમૂર્ત, મૂર્ત આદિ ધર્માથી યુક્ત છે છતાં પણ જે અન્ય દ્રવ્યોથી
વિમુક્ત છે; એ ચિદ્રૂપ મારા મનમાં સદા રહે-બિરાજો. ૧૮.

જેય દૃશ્યં ન ગય્ય મમ જગતિ કિમપ્યસ્તિ કાર્ય ન વાચ્ય

ધ્યેય શ્રવ્ય ન લભ્ય ન ચ વિશદમતે: શ્રેયમાદેયમન્યત् ।

શ્રીમત્પર્વત્જવાણીજલનિધિમથનાત् શુદ્ધચિદ્રૂપરલં

યસ્માલ્લબ્ધં મયાહો કથમપિ વિધિનાઽપ્રાત્પૂર્વિયં ચ ॥૧૯॥


શુદ્ધમતિ હું, મને જોય નહિ, દંશ્ય નહિ,
ગમ્ય નહિ, કાર્ય નહિ, વાચ્ય નાંદી;
દ્યોય નહિ, શ્રવ્ય નહિ, લભ્ય નહિ, શ્રેય નહિ,
નહિ ઉપાદેય કંઈ જગત માંદી;
કેમ કે ભાગ્યથી મેં અપૂરવ આહો,
શુદ્ધ ચિદ્રૂપ પ્રિય રત્ન લાદ્યું;
શ્રીમદ્ સર્વદાની વાણી આણવ મયી
યત્નથી રત્ન લહી સર્વ સાદ્યું. ૧૮.

આર્થ :—નિર્મણ બુદ્ધિવાળા એવા મને (આ) જગતમાં કંઈ પણ
બીજું જોવા જેવું, જાણવા જેવું, સમજવા જેવું, કરવા જેવું, વાણીથી
કહેવા જેવું, ધ્યાન કરવા જેવું, સાંભળવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય,
હિતરૂપ, ગ્રહણ કરવા જેવું છે નહિ, કારણ કે શ્રી સર્વજ્ઞદેવની વાણીરૂપ
સમુક્રના મંથનથી ખરેખર, કોઈ પણ રીતે ભાગ્યથી પૂર્વે નહિ મેળવેલું
એવું અને પ્રિય, શુદ્ધચૈતન્યસ્વરૂપ રત્ન મને મળી ગયું છે. ૧૮.

શુદ્ધચિદ્રૂપરૂપોહમિતિ મમ દધે મંકુ ચિદ્રૂપરૂપ
ચિદ્રૂપેણૈવ નિત્યં સકલમલમિદા તેનચિદ્રૂપકાય।
ચિદ્રૂપાદ્ ભૂરિસૌખ્યાત્ જગતિ વરતરાત્તરસ્ય ચિદ્રૂપકસ્ય
માહાત્મ્યં વैતિ નાન્યો વિમલગુણગણે જાતુ ચિદ્રૂપકેડ્જાત્ ॥૨૦॥

કર્મ દૂરકરણ એ શુદ્ધ ચિદ્રૂપ વડે,
શુદ્ધ ચિદ્રૂપ હું સ્વરૂપ સારં,
શુદ્ધ ચિદ્રૂપ જગત્શ્રેષ્ઠ સુખધામથી,
શુદ્ધ ચિદ્રૂપને ધિતા ધારં;
વિમલ ગુણના નિધિ શુદ્ધ ચિદ્રૂપમાં,
જ્ઞાન જેનું નથી અજ્ઞા એવા,
શુદ્ધ ચિદ્રૂપનું મહાત્મ્ય જાણો નહીં,
તો ઉરે ધારવા શક્ય કેવા? ૨૦

આર્થ :—‘શુદ્ધ ચૈતન્યસ્વરૂપ હું છું’ એમ મારા ચિદ્રૂપને, તે સર્વ કર્મને ટાળનાર ચિદ્રૂપ વડે જ, ચિદ્રૂપને માટે, જગતમાં વધારે ચાડિયાતા એવા અત્યંત સુખમય ચિદ્રૂપમાંથી નિત્ય ધારણ કરું છું, તે નિર્મળ ગુણના સમૂહરૂપ એવા ચિદ્રૂપમાં અજ્ઞાની હોવાથી અન્ય જીવ કદી પણ તે ચિદ્રૂપનું માહાત્મ્ય જાણતો નથી. ૨૦.



હેઠળ રેખાંનાં.

આધ્યાય ૨ જો

[શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં ઉત્સાહ પ્રદાન]

મૃત્પિંડેન વિના ઘટો ન ન પઠસ્તંતૂન् વિના જાયતે
ધાતુનૈર્વ વિના દલં ન શકટ: કાષ્ટ વિના કુત્રચિત્ત।
સત્ત્વચ્યેષ્પિ સાધનેષુ ચ યથા ધાન્યં ન બીજં બિના
શુદ્ધાત્મસ્મરણં વિના કિલ મુનેર્મોક્ષસ્તથા નૈવ ચ॥૧॥

(હશિગીત)

સામાન્ય કારણ બહુ છતાં કારણ અસાધારણ વિના,
નહિ કાર્યસિદ્ધિ સંભવે, નહિ ધાન્ય સંભવ બીજ વિના,
ઘટ માટી વિણા, પટ તંતુ વિણા, ના શકટ કાષ વિના હુએ,
સહજાત્મ સ્મરણ વિણ મુમુક્ષુને ન મુક્તિ સંભવે. ૧

અર્થ :—જેવી રીતે અન્ય સાધનો હોવા છતાં પણ માટીના પિંડા
વિના ઘડો ઉત્પન્ન થતો નથી, તંતુ વિના વખ્ય બનતું નથી, દળ (ધાતુના
પડ) વિના ધાતુ ઉત્પન્ન થતી નથી, કચાંય કાષ વગર ગાડું થતું નથી
અને બીજ વિના ધાન્ય ઉપજતું નથી; તેમ શુદ્ધાત્મસ્વરૂપના સ્મરણ વિના
મુનિને ખરેખર મોક્ષ થતો જ નથી. ૧.

બીજં મોક્ષતરોર્ભવાર્ણવતરી દુઃખાટવીપાવકો
દુર્ગ કર્મભિયાં વિકલ્પરજસાં વાત્યાગસાં રોધનં।
શસ્ત્રં મોહજયે નૃણામશુભતાપર્યાયરોગૌષધં
ચિદ્રૂપસ્મરણં સમસ્તિ ચ તપોવિદ્યાગુણાનાં ગૃહં॥૨॥

ચિદ્રૂપ સ્મરણ છે સર્વ વિદ્યા તપ અને ગુણગણનિધિ,
એ મુક્તિ તરુનું બીજ, દુઃખવન દણન, નાવ ભવોદધિ;

છે કર્મભીતને દુર્ગા, વાયુ વિકલ્પ રજ ઉડાડવા,
એ દોષ રોકે, મોહ જુતે, અગાદ અશુભ નિવારવા. ૨

આર્થ :—ચિદ્રૂપનું સ્મરણ મનુષ્યોને મોક્ષરૂપી વૃક્ષનું બીજ,
સંસારરૂપ સમુદ્રમાં નૌકા, દુઃખરૂપી વનને બાળનાર અનિન, કર્મથી ભય
પામેલાઓને (આશ્રય સ્થાન સમાન) કિલ્લો, વિકલ્પરૂપ ધૂળને ઉડાડી
મૂકવા પાવન, પાપોને રોકનાર, મોહનો જ્ય કરવામાં શક્તિ, નરક, તિર્યંચ
આદિ અશુભ પર્યાયરૂપ રોગને ટાળનારું ઔષધ અને તપ, વિદ્યા તથા
અનેક ગુણોનું ધર સમીયીન રીતે છે. ૨.

કૃતૃદ્રુગ્વાતશીતાતપજલવચસः શસ્ત્રરાજાદિભીભ્યો
ભાર્યાપુત્રાસ્ત્રિનૈ: સ્વાનલનિગંડગવાદ્યશ્વરરૈકંટકેભ્ય:
સંયોગાયોગદંશિપ્રપતનરજસો માનભંગાદિકેભ્યો
જાતં દુઃખં ન વિદ્મમ: કવ ચ પટતિ નૃણાંશુદ્ધચિદ્રૂપભાજાં ॥૩॥

ભૂખ, તરસ, રોગ, કઠોર વાણી, વાત ઠંડી, ઉષાતા,
જલ, શસ્ત્ર, નૃપ ભય, નારી, અંગાજ, અનિન, આરિ, ધન દીનતા;
ધન, બેડી, કંટક, ડાંસ મરછર, માનભંગ વિયોગનાં,
જાણું ન, દુઃખ સૌ જાય કર્યાં છા ! શુદ્ધ ચિદ્રૂપ ભક્તાનાં. ૩

આર્થ :—શુદ્ધ ચિદ્રૂપને ભજનાર મુખ્યોના કુધા, તૃષા, રોગ, ઠંડી,
ગરભી, વા પાણી અને કઠોર વાણી, રાજાદિના ભય, શસ્ત્રના ભય, સ્ત્રી,
પુત્ર, શત્રુ, નિર્ધનતા, અનિન, બેડી, ગાય, અશ્વાદિ, ધન કંટક, સંયોગ-
વિયોગ, ડાંસ, પતન, ધૂળ, માનભંગાદિથી ઉપજતું દુઃખ કર્યાં જતું રહે
છે તે અમે જાણતા નથી. ૩.

સ કોપિ પરમાનન્દશુદ્ધપદ્ધ્યાનતો ભવેત् ।
તદંશોપિ ન જાયેત ત્રિજગત્સ્વામિનામપિ ॥૪॥

અદ્ભુત પરમાનંદ એવો, શુદ્ધ ચિદ્રૂપ દ્યાનથી,
પ્રગટે અહા! ના અંશ તેનો, પ્રણ જગત સામ્રાજ્યથી. ૪.

આર્થ :—ચિદ્રૂપના ધ્યાનથી એવો કોઈ પરમાનંદ (પ્રગટ) થાય છે કે તેનો અંશ પણ ત્રણ જગતના સ્વાભીઓને ય ઉપજતો નથી. ૪.

સૌખ્યં મોહજયોऽશુભાસ્ત્રવહતિર્નાશોऽતિદુષ્કર્મણા—
મત્યંતં ચ વિશુદ્ધતા નર ભવેદારાધના તાત્ત્વિકી।
રત્નાનં ત્રિતયં નૃજન્મસફળં સંસારભીનાશનં
ચિદ્રૂપોહમિતિસ્મૃતેશ્ચ સમતા સદ્ભ્યો યશઃકીર્તનં ॥૫॥

‘ચિદ્રૂપ હું’ એ સ્મરણથી સમતા વધે યશવિસ્તૃતિ, સુખ પ્રાપ્તિ મોહવિજ્ય અને દુષ્કર્મ આસ્ત્રવની ક્ષતિ; અત્યંત અંતરશુદ્ધ ને તાત્ત્વિક આરાધન બને, પ્રણ રત્ન પ્રાપ્તિ, સફળ નર ભવ, ભવતણો ભય સૌ હણે. ૫

આર્થ :—‘હું ચૈતન્યસ્વરૂપ હું’ એમ સ્મરણ કરવાથી મનુષ્યને સુખ, મોહનો જ્ય, અશુભ આસ્ત્રવનો નાશ, દુષ્કર્મોનો નાશ અને અત્યંત વિશુદ્ધિ, તત્ત્વની આરાધના, સમ્યગ્દર્શન-શાન-ચારિત્ર એ ત્રણ રત્નોની પ્રાપ્તિ, મનુષ્યજન્મની સફળતા, સંસારના ભયનો નાશ, સમતા તથા સજજનો દ્વારા યશોગાન પ્રાપ્ત થાય છે. ૫.

વૃત્ત શીલં શ્રુતં ચાખિલખજયતપોદૃષ્ટસદ્ભાવનાશ્ચ
ધર્મો મૂલોત્તરાખ્યા વરગુણનિકરા આગસાં મોચનં ચ।
ગાદ્યાંતઃ સર્વસંગત્યજનમપિ વિશુદ્ધાંતરગં તદાની—
મૂર્મીણાં ચોપસર્ગસ્ય સહનમભવચ્છુદ્ધચિત્સંસ્થિતસ્ય ॥૬॥

જે શુદ્ધ ચિદ્રૂપ સ્થિત તે પ્રત શીલ શ્રુત તપ ગુણધરા, ઇન્દ્રિયવિજ્ય સદ્ગર્મ દર્શન ભાવના અધક્ષય કરા; સૌ બાણ અંતર સંગ ત્વાગી, અંતરંગ વિશુદ્ધિથી, ઉપસર્ગ ઊર્મિ સહન કરતા ધીર નિજબળ વૃદ્ધિથી. ૬.

આર્થ :—શુદ્ધ ચૈતન્યમાં સ્થિતિ કરનાર જીવને તે સમયે ચારિત્ર, શીલ, શાન, સમસ્ત ઈન્દ્રિયોનો જ્ય, તપ, દર્શન, ભાવના, ધર્મ, મૂળ

અને ઉત્તર ઉત્તમ ગુણોનો સમૂહ, પાપનું છૂટવું, બાધ્ય અને અભ્યંતર સર્વ સંગનો ત્યાગ, અંતરની વિશુદ્ધિ અને ઉપસર્ગના તરંગો સહન કરવાની શક્તિ (પ્રગટ) થાય છે. ૬.

તીર્થેષૂલ્કષ્ટતીર્થ શ્રુતિજલધિભવં રલમાદેયમુચ્ચૈ:
સૌખ્યાનાં વા નિધાનં શિવપદગમને વાહનં શીଘ્રગામિ।
વાત્યાં કર્મોધરરણો ભવવનદહને પાવકં વિદ્વિ શુદ્ધ—
ચિદ્ભૂપોહં વિચારાદિતિ વરમતિમન્નક્ષરાણાં હિ ષટકં ॥૭॥

‘હું શુદ્ધ ચિદ્ભૂપ’ વર્ણ ષટ, હે ! બુદ્ધિમાન વિચારજો,
ઉત્કૃષ્ટ તીરથ, રત્ન ઉત્તમ, શ્રુતસમુદ્ભનું ધારજો;
એ સર્વ-સૌખ્ય-નિધાન વાહન શિવગમનનું શીધ હા !
સૌ કર્મરજને પવન સમ, ભવ-વન-દહન અર્થિન મહા. ૭

આર્થિ :—હે ઉત્તમ ભતિમાન ! ‘હું શુદ્ધ ચિદ્ભૂપ છું’ એ છ અક્ષરોના વિચારથી તું જાણ કે તે જ તીર્થોમાં ઉત્કૃષ્ટ તીર્થ છે, શ્રુત સાગરમાંથી નીકળેલું ઉત્તમ ગ્રહવા યોગ્ય રત્ન છે, સૌખ્યોનું નિધાન છે, મોક્ષપદમાં લઈ જનાર ત્વરિત ગતિવાળું વાહન છે, કર્મસમૂહરૂપ ધૂળને ઉડાડી મૂકવા માટે વાયુનો વંટોળ છે, સંસારવનને બાળવા માટે અર્જિન છે. ૭.

કવ યાંતિ કાર્યાણિ શુભાશુભાનિ કવ યાંતિ સંગાશ્વિદચિત્સ્વરૂપા : |
કવ યાંતિ રાગાદ્ય એવ શુદ્ધ ચિદ્ભૂપકોહંસ્મરણે ન વિદ્ધા : ||૮||

ચેતન અચેતન સંગ સૌ, કાર્યો શુભાશુભ જાય કર્યાં ?
ન જણાય ચિદ્ભૂપસ્મરણથી રાગાદિ ભાગી જાય કર્યાં ? ૮

આર્થિ :—‘હું ચિદ્ભૂપ છું’ એમ સ્મરણ કરતાં શુભ અને અશુભ કર્મો, ચેતન અને અચેતન સંગો (પરિશ્રહો), અને રાગાદિ કર્યાં જતા રહે છે, તે અમે જાણતા નથી. ૮.

મેરુ: કલ્પતરુ: સુવર્ણમમૃતં ચિંતામણિ: કેવલં
સાથ્ય તીર્થકરો યથા સુરગવી ચક્રી સુરેન્દ્રો મહાન्।
ભૂભૃત્ભૂરુહધાતુપેયમણિધીવૃત્તાસ્તગોમાનવા—
મર્યોચ્ચેવ તથા ચ ચિંતનમિહ ધ્યાનેષુ શુદ્ધાત્મનઃ ॥૬॥

તરુ, ધાતુ, પેય, ગિરિ, અમર, નર, ચરણ, મણિ ગૌ, જ્ઞાનમાં;
સુરતરુ, કનક, અમૃત, મેરુ, શક, ચક્રી, સામ્યતા;
ચિંતામણિ, સુરધેનુ, કેવલ, આપ્તમાં તીર્થકરો,
ઉત્કૃષ્ટ જ્યમ, ત્યમ ધ્યાનમાં શુદ્ધાત્મચિંતન આદરો. ૬

આર્થ: —જેમ પર્વતોમાં મેરુ જ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ જ, ધાતુઓમાં સુવર્ણ જ, પીવા યોગ્ય પદાર્થોમાં અમૃત જ, રત્નોમાં ચિંતામણિરત્ન જ, જ્ઞાનોમાં કેવળજ્ઞાન જ, ચારિત્રોમાં સમતાભાવ, આપ્તોમાં તીર્થકર જ, ગાયોમાં કામધેનુ જ, મનુષ્યોમાં ચક્રવર્તી જ અને દેવોમાં ઈન્દ્ર જ ઉત્તમ છે. તેવી રીતે આ લોકમાં ધ્યાનોમાં શુદ્ધ આત્માનું ચિંતન ઉત્તમ છે. ૮.

નિધાનાનાં પ્રાપ્તિન ચ સુરકુરુહાં કામધેનો: સુધા-
યાશ્ચિતારલાનામસુરસુરનરાકાશગેરેં દિરાણાં।
ખભોગાનાં ભોગાવનિભવનભુવાં ચાહમિદ્રાદિલક્ષ્યા
ન સંતોષં કુર્યાદિહ જગતિ યથા શુદ્ધચિદ્રૂપલબ્ધિ: ॥૧૦॥

જે કલ્પદુમ કે કામધેનુ નિધાનપ્રાપ્તિ કે સુધા,
ચિંતામણિ સુર અસુર નર વિદ્યાધરેશ સુખો બધાં;
ઔદ્ધર્ય અહમિન્દ્રાદિનાં, સૌ ભોગ ભોગભૂમિ તણા,
સંતોષ આપે શુદ્ધચિદ્રૂપલબ્ધિ જેવો અન્ય ના. ૧૦.

આર્થ: —આ જગતમાં શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિથી જેવો સંતોષ થાય છે તેવો સંતોષ ધનના ભંડારો, કલ્પવૃક્ષ, કામધેનુ, અમૃત, ચિંતામણિ રત્ન, સુર-અસુર વિદ્યાધરોના ઈન્દ્રોની લક્ષ્મી, ભોગભૂમિમાં પ્રાપ્ત થતા અને સ્વર્ગભૂમિમાં પ્રાપ્ત થતા ભોગો તથા અહમિન્દ્રાદિની લક્ષ્મીની પ્રાપ્તિથી પણ સંતોષ થતો નથી. ૧૦.

ના દુર્વણો વિકર્ણો ગતનયનયુગો વામન: કુબ્જકો વા
છિન્નદ્રાણ: કુશબ્દો વિકલકસ્યુતો વાગ્વિહીનોऽપિ પંગુ: ।
ખંજો નિ:સ્વોऽનધીતશ્રુત ઇહ બધિર: કુષ્ટરોગાદિયુક્ત:
શ્લાધ્ય: ચિદ્રૂપચિંતાપર: ઇતરજનો નૈવ સુજ્ઞાનવદ્ધિ: ॥૧૧॥

નર હોય કાળો, કર્ણાઈન, કદ્રૂપ, નકટો, કુલ્ય વા,
કુશાંદ, વામન, પંગુ, ઠંડો, અંધ, મૂંગો, ખંજ વા;
નિર્ધન, અભણ, બહેરો, ભલે હો કોટ, વ્યાધિગ્રસ્ત વા,
ચિદ્રૂપચિંતન લીન તો તે શ્લાધ્ય પ્રાણો અન્ય ના. ૧૧

આર્થ:—આ લોકમાં કાળો, કાન વગરનો, આંધળો, ઠીંગણો,
ખૂંધો, નકટો, કર્કશ વાણીવાળો, હુંઠો, મૂંગો, લંગડો, પાંગળો, નિર્ધન,
અભણ, બહેરો કે કોટાદિ રોગવાળો મનુષ્ય પણ જો ચિદ્રૂપના ચિંતનમાં
તત્પર હોય તો સમ્યગ્જ્ઞાનીઓ વડે તે પ્રશંસા પામે છે, બીજો કોઈ
મનુષ્ય પ્રશંસાપાત્ર થતો નથી. ૧૧.

રેણૂનાં કર્મણ: સંખ્યા પ્રાણિનો વેત્તિ કેવલી ।

ન વેત્તિ ક્વાન્યાંત્યેતે શુદ્ધચિદ્રૂપચિંતને ॥૧૨॥

(ઝૂલણા)

જીવ કર્મો ધણાં ક્ષણા ક્ષણે સંગ્રહે,
સર્વ સર્વજ્ઞાને જ્ઞાયે;
શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ ક્ષણ ક્ષણ કર્યે,
સ્મરણથી કર્મ તો કયાંય જાયે. ૧૨.

આર્થ:—જીવના કર્મના પરમાણુઓની સંખ્યા કેવળજ્ઞાની જાણે
છે. એ કર્મ શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરતાં, કચાં જતાં રહે છે, એ
હું જાણતો નથી. ૧૨.

તં ચિદ્રૂપં નિજાત્માનં સ્મર શુદ્ધ પ્રતિક્ષણં ।

યસ્ય સ્મરણમાત્રેણ સદ્ગ: કર્મક્ષયો ભવેત् ॥૧૩॥

શુદ્ધ ચિદ્રૂપ તે આત્મ નિજ ચિંતવો,
સ્મરણ ક્ષણ ક્ષણ કરો શાંત ભાવે;
તે સ્વરૂપના સ્મરણ માત્રથી સદ્ય સૌ,
કર્મ ક્ષય થાય, શિવ સૌખ્ય આવે. ૧૩

અર્થ :—જેના સ્મરણ માત્રથી કર્મનો ક્ષય સત્ત્વરે થાય, તે શુદ્ધ ચિદ્રૂપને-પોતાના આત્મસ્વરૂપને તું પ્રતિક્ષણ યાદ કર. ૧૩

ઉત્તમં સ્મરણં શુદ્ધચિદ્રૂપોऽહમિતિસ્મृતેः ।
કદાપિ કવાપિ કસ્યાપિ શ્રુતં દૃષ્ટં ન કેનચિત् ॥૧૪॥
શુદ્ધચિદ્રૂપસદૃશં ધ્યેયં નૈવ કદાચન ।
ઉત્તમં કવાપિ કસ્યાપિ ભૂતમસ્તિ ભવિષ્યતિ ॥૧૫॥
'શુદ્ધ ચિદ્રૂપ હું' સ્મરણ એ વીણા બીજું,
સ્મરણ ઉત્તમ સદા ક્યાંય છે ના;
એ વિના શ્રેષ્ઠ બીજું સ્મરણ ના દીનું,
કે કદા કર્ણ સુષ્ણું કોઈએ ના;
શુદ્ધ ચિદ્રૂપ સમ ધ્યેય ઉત્તમ નહીં,
કોઈને ક્યાંય બીજું કદાપિ;
ભૂત ભાવી અને વર્તમાને અહા !
એ જ સર્વોપરી છે સદાપ. ૧૪-૧૫.

અર્થ :—'હું શુદ્ધ ચિદ્રૂપ હું' એ સ્મરણ કરતા બીજું ઉત્તમ સ્મરણ કરીયે કોઈએ, ક્યાંય, કોઈની પાસેથી જોયું નથી. સાંભળ્યું નથી. શુદ્ધ ચિદ્રૂપના જેવું ઉત્તમ ધ્યેય કરી ક્યાંય પણ કોઈને પણ નથી, થયું નથી અને થશે નહિં. ૧૪-૧૫.

યે યાતા યાંતિ યાસ્યંતિ યોગિનઃ શિવસંપદઃ ।
સમાસાધ્યૈવ ચિદ્રૂપં શુદ્ધમાનંદમન્દિરં ॥૧૬॥
શિવ સંપત્તિ કે યોગિયો પામીઆ,
પામતા, પામશે, તે પ્રિકાળે;

શુદ્ધ ચિદ્રૂપ આનંદમંદિરને,
માત્ર આરાધી સમ્યક્પ્રકારે. ૧૬.

આર્થ :—જે યોગીઓ મોક્ષરૂપી સંપત્તિ પામ્યા છે, પામે છે અને
પામશે, તે આનંદના ધામ એવા શુદ્ધચિદ્રૂપનું યથાર્થ આરાધન કરીને જ
પામ્યા છે, પામે છે અને પામશે. ૧૬

દ્વાદશાંગ તતો બાહ્ય શ્રુતં જિનવરોદિતં ।
ઉપાદેયતયા શુદ્ધચિદ્રૂપસ્તત્ર ભાષિતઃ ॥૧૭

જિનવરે અંગ દ્વાદશ, બહિરંગ જે,
શાસ્ત્ર વિસ્તાર સધળો પ્રકાશયો;
શુદ્ધ ચિદ્રૂપ સહજાત્મપદ સુખનિધિ,
ત્યાં ઉપાદેય સર્વત્ર ભાષ્યો. ૧૭

આર્થ :—જિનવરોએ કહેલું શ્રુતજ્ઞાન બારઅંગરૂપ અને અંગભાષ્ય
જે છે તેમાં ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) એક શુદ્ધ ચિદ્રૂપને કહ્યો
છે. ૧૭.

શુદ્ધચિદ્રૂપસદ્ધ્યાનાદું ગુણાઃ સર્વે ભવંતિ ચ ।
દોષાઃ સર્વે વિનશ્યંતિ શિવસૌખ્યં ચ સંભવેત् ॥૧૮॥

શુદ્ધ ચિદ્રૂપનું દ્યાન સમ્યક્ કર્યો,
સર્વ સદ્ગુણ પ્રગાટે સ્વભાવે;
દોષનો સમૂહ સૌ નાશ પામે અહા!
મોક્ષનાં સૌખ્ય અત્યંત પાવે. ૧૮

આર્થ :—શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનથી સર્વ ગુણો પ્રગટ થાય છે,
સર્વ દોષો નાશ પામે છે અને મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે. ૧૮.

ચિદ્રૂપેણ ચ ઘાતિકર્મહનનાચુદ્ધેન ધામના સ્થિતં
યસ્માદત્ર હિ વીતરાગવપુષો નામાપિ નુત્યાપિ ચ ।

તદ્ભિંબસ્ય તદોકસો ઝાગિતિ તત્કારાયકસ્યાપિ ચ
સર્વ ગચ્છતિ પાપમેતિ સુકૃતં તત્ત્ત્વં કિં નો ભવેત् ॥૧૬॥

વીતરાગી વિભુતું સ્મરે નામ જ્યાં,
મૂર્તિ, મંદિર, સ્તુતિને કરે જો;
પાપ સૌ દૂર ટળે, પુણ્ય ઉત્તમ મળે,
શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનથી ત્યાં બધાં,
ધ્યાતિયાં કર્મનો નાશ થાયે;
જ્ઞાન દર્શન અનંતા સુખે યુક્ત જે,
શુદ્ધ સ્વરૂપે સ્થિતિ ત્યાં પમાયે. ૧૯

અર્થ :—શુદ્ધ ચિદ્રૂપના ધ્યાન વડે ધ્યાતિકર્મનો નાશ થતાં શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ થાય છે. કારણ કે અહીં વીતરાગ ભગવાનના નામ વડે પણ, સ્તુતિ-પ્રશાસ્ત્રમાં વડે, તે વીતરાગબિંબના, તે વીતરાગમંદિરના, તેના કરાવનારનાં પણ સર્વ પાપ સત્ત્વરે દૂર થઈ જાય છે, સર્વ પુણ્ય આવે છે, તો તેનું ધ્યાન કરનારને કયું ફળ ન થાય? ૧૮.

કોડસૌ ગુણોસ્તિ ભુવને ન ભવેત્તદા યો
દોષોઽથવા ક ઇહ યસ્ત્વરિતં ન ગચ્છેત्।
તેણાં વિચાર્ય કથયંતુ બુધાશ્ચ શુદ્ધ-
ચિદ્રૂપકોઽહમિતિ યે યમિનઃ સ્મરંતિ ॥૨૦॥

‘શુદ્ધ ચિદ્રૂપ હું’ સંયમી જે સ્મરે,
સુગુણ એવો શું લોકે ન પામે?
દોષ એવો શું સત્ત્વર ટળે જે નહીં,
બુધ જનો! કહો વિચારી, ન નામે. ૨૦

અર્થ :—હે વિજ્ઞાનો! વિચારીને કહો કે જે સંયમીઓ, ‘શુદ્ધ ચિદ્રૂપ હું છું’ એવું સ્મરણ કરે છે, તેમને લોકમાં ત્યારે એવો કયો ગુણ

છે કે જે ન પ્રગટે અથવા અહીં ક્યો દોષ છે કે જે તરત જ ન ટળી જાય? ૨૦.

તિષ્ઠુંત્વેકત્ર સર્વે વરગુણનિકરા: સૌખ્યદાનેઽતિતૃસા:
સંભૂયાત્યંતરમ્યા ઘરવિધિજનિતા જ્ઞાનજાયાં તુલાયાં।
પાશ્રેવન્યસ્મિન् વિશુદ્ધા હૃદ્યવિશતુ વરા કેવલા ચેતિ શુદ્ધ-
ચિદ્ભૂપોહસ્મૃતિભો કથમપિ વિધિના તુલ્યતાં તે ન યાંતિ ॥૨૧॥

પુણ્યવશ પ્રાપ્ત અતિ રમ્ય સુખદાયિ સૌ,
શ્રેષ્ઠ ગુણસમૂહ એકત્ર મૂકો;
જ્ઞાનરૂપ માજુના એક પલ્લે બધા,
અન્ય પલ્લે સ્મરણ માત્ર રાખો;
'શુદ્ધ ચિદ્ભૂપ હું' સ્મરણ કેવલ અહા!
શુદ્ધ અત્યંત ઉત્તમ વખાણો;
કોઈ રીતે કદી તેની તોલે નહિ,
સમૂહ એ ગુણતણો જરીય જાણો. ૨૧.

અર્થ :—અત્યંત રમ્ય, સદ્ગ્રામ્યે મળેલા, સુખ આપવામાં અત્યંત સમર્થ એવા સર્વ ઉત્તમ ગુણોના સમૂહો, જ્ઞાનજનિત ત્રાજવામાં એક બાજુ એકઠા થઈને રહો, અને બીજી બાજુએ વિશુદ્ધ ઉત્તમ માત્ર હું શુદ્ધ ચિદ્ભૂપ છું એ સ્મરણ મૂકો; હે જનો! તે કોઈપણ રીતે સરખા-સમાન થતા નથી. ૨૧

તીર્થતાં ભૂ: પદૈ: સ્પૃષ્ટા નામા યોऽઘચ્યઃ ક્ષયং।
સુરોધો યાતિ દાસત્વं શુદ્ધચિદ્ભક્તચેતસાં ॥૨૨॥
શુદ્ધ ચિદ્ભૂપમાં ચિત્ત અનુરક્તા તે,
સંતપદ સ્પૃષ્ટભૂમિ તીર્થ થાયે;
દેવગાણ દાસ તેના બનીને રહે,
નામ તેનું સર્વો પાપ જાયે. ૨૨.

આર્થ:—શુદ્ધ ચૈતન્યમાં જેમનું ચિત્ત લીન છે એવા સંતોના ચરણ વડે સ્પર્શયેલી ભૂમિ, તીર્થપણું પામે છે. તેમના નામથી પાપનો સમૂહ નાશ પામે છે અને દેવોનો સમૂહ તેમનું દાસત્વ પામે છે. ૨૨.

શુદ્ધસ્ય ચિત્તસ્રૂપસ્ય શુદ્ધોન્યોઽન્યસ્ય ચિત્તનાત् ।
લોહં લોહાદ् ભવેત્યાત્રં સૌર્વર્ણ ચ સુવર્ણતઃ ॥૨૩॥

લોહથી લોહમય પાત્ર સધળાં બને,
કનકના પાત્ર સૌ કનકરૂપે;
શુદ્ધ ચિદ્ગિંતને શુદ્ધ પદ સંપદે,
અન્ય ગિંતન કરે અન્યરૂપે. ૨૩.

આર્થ:—જેમ લોહમાંથી લોહમય પાત્ર બને અને સુવર્ણમાંથી સુવર્ણમય પાત્ર બને, તેમ શુદ્ધ ચિત્તસ્વરૂપના ચિત્તનથી શુદ્ધ થાય અને અશુદ્ધના ચિત્તનથી આત્મા અશુદ્ધ થાય છે. ૨૪.


મગના યે શુદ્ધચિદૂપે જ્ઞાનિનો જ્ઞાનિનોપિ યે ।
પ્રમાદિન: સ્મર્તૌ તસ્ય તેપિ મગના વિધેર્વશાત् ॥૨૪॥
શુદ્ધ ચિદૂપને જાણનારા મહા, જેમણાનંદ.
જાનીઓ મગન ચિદૂપમાણી;
કર્મવશ સ્મરણમાં જો પ્રમાદી છતાં,
જાની તો ગણો મગન ત્યાણી. ૨૪.

આર્થ:—જે જ્ઞાનીઓ છે તે શુદ્ધ ચિદૂપમાં મગન છે, જે જ્ઞાનીઓ છે છતાં શુદ્ધ ચિદૂપના સ્મરણમાં કર્મવશે પ્રમાદી છે, તે પણ મગન છે. ૨૪.

સપ્તધાતુમયં દેહં મલમૂત્રાદિભાજનં ।
પૂજ્યં કુરુ પરેષાં હિ શુદ્ધચિદૂપચિત્તનાત् ॥૨૫॥
સાત ધાતુમયી દેહ અશુચિભયો,
મૂક્ર મલ અશુચિ ભાજન છતાં યે;

શુદ્ધ ચિદ્રૂપ ચિંતન વડે પુનિત તે,
સર્વને પૂજ્ય કરવો સદા ચે. ૨૫.

આર્થી :—સાત ધાતુમય, મળમૂત્રાદિના સ્થાનરૂપ શરીર પણ
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મચિંતનથી બીજાઓને તે પૂજ્ય છે, એમ નિશ્ચય
કરો. ૨૫.



અધ્યાય શ્રીજી

[શુદ્ધ ચિદૂપની પ્રાપ્તિના ઉપાય]

જિનેશસ્ય સ્નાનાત् સ્તુતિયજનજપાનર્મંદિરાર્ચાવિધાના-
ચતુર્ધા દાનાદ્વાધ્યયનખજયતો ધ્યાનતઃ સંયમાચ્ચ ।
વ્રતાચ્છીલાતીર્થાર્દિકગમનવિધે: ક્ષાંતિમુખ્યપ્રધર્માત्
ક્રમાચ્છિદૂપાસિર્ભવતિ જગતિ યે વાંછકાસ્તસ્ય તેષાં ॥૧॥

(વસંતતિલકા)

ભાવે જિનેન્દ્ર જ્ય સ્નાન્ર સ્તુતિ પૂજાને,
મંદિર-અર્યન-વિધાન સુપાત્ર દાને;
શારાણિ, અધ્યયન, સંયમ, શીલ, ધ્યાને,
અત્યંત આદર કરે ભવિ તીર્થસ્થાને;
ઇન્દ્રિયનો વિજ્યાને પ્રત-વર્તનાથી,
ક્ષાંતિ પ્રમુખ દશ ધર્મ સુસાધનાથી;
ચિદૂપ પ્રાપ્તિ જગતમાં જીવ વાંછતા જે,
સેવી ઉપાય કુમથી પદ પામતા તે. ૧.

અર્થ :—જિનેન્દ્ર ભગવાનનો અભિષેક કરવાથી, સ્તુતિ, પૂજા,
જ્ય કરવાથી, મંદિર-પૂજાના વિધાનથી, ચાર પ્રકારના દાનથી અથવા
શાશ્વત-અભ્યાસ અને ઈન્દ્રિયના જ્યથી, ધ્યાનથી અને સંયમથી, વ્રતથી,
શીલથી, તીર્થગમન આદિ વિધિથી, ક્ષમા આદિ ઉત્તમ ધર્મોથી કરીને
ચિદૂપની પ્રાપ્તિ, જગતમાં જેઓ તેના વાંછક છે; તેમને થાય છે. ૧.

દેવં શ્રુતં ગુરું તીર્થ ભદ્રં ચ તદાકૃતિં ।
શુદ્ધચિદૂપસદ્ધ્યાનહેતુત્વાદ ભજતે સુધીઃ ॥૨॥

સદેવ શાસ્ત્ર મુનિ તીર્થ ગુરુ સુજ્ઞાની,
કે મૂર્તિ તે તણી વિષે બહુમાન આપી,
શુદ્ધાત્મ-દ્યાન સદૃપાય બધા વિચારી,
સેવે સદાય અતિ નિર્મલ બુદ્ધિ ધારી. ૨.

આર્થ :—સમ્યજ્ઞાની દેવ-શાસ્ત્ર-ગુરુ, તીર્થરૂપ ભગવંતને તથા
તેમની પ્રતિમાને શુદ્ધ આત્મસ્વરૂપના સદૃધ્યાનના કારણો હોવાથી, ભજે
ઇ. ૨.

અનિષ્ટાન् ખહ્દામર્થાનિષ્ટાનપિ ભજેત્યજેત् ।
શુદ્ધચિદ્રૂપસદ્ધ્યાને સુધીહેતૂનહેતુકાન् ॥૩॥

અર્થો અનિષ્ટ મન ઇન્દ્રિયને છતાં જો,
ચિદ્રૂપ-દ્યાન-સદૃપાય, બુધો ભજે તો;
જે હોય ઇષ્ટ મન ઇન્દ્રિયને છતાં જો,
થાયે અહેતુ ચિદ્રૂપના વિષે, તજે તો. ૩.

આર્થ :—ઇન્દ્રિય અને મનને અપ્રિય પદાર્�ો હોય પણ જો તે
શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાનમાં હેતુ થતા હોય, તો સમ્યગુદાષ્ટ જીવ તેને
ભજે અને (ઇન્દ્રિય-મનને) પ્રિય લાગતાં પદાર્થો પણ (શુદ્ધ ચિદ્રૂપના
ધ્યાનમાં) વિઘ્નરૂપ હોય, તો તેને વિના વિલંબે છોડી દે. ૩.

મુંચેત્સમાશ્રયેચ્છુદ્ધચિદ્રૂપસ્મરणે હિતં ।
હિતં સુધીઃ પ્રયત્ને દ્રવ્યાદિકચતુષ્ટયં ॥૪॥

ચિદ્રૂપના સ્મરણમાં હિતકારી ધારે,
જે દ્રવ્ય, ક્ષેત્ર, વળી કાળ સુભાવ ચારે;
તેને પ્રયત્ન કરી પ્રાજ્ઞનો સુસેવે,
તેમાં અહિતકર શીઘ્ર તજે, ન સેવે. ૪.

આર્થ :—પ્રાજ્ઞન શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં અહિતકારી દ્રવ્ય,

ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારને બળપૂર્વક તજી દે અને હિતરૂપ દ્રવ્યાદિ ચારને પ્રયત્નપૂર્વક અવલંબે. ૪.

સંગ વિમુચ્ય વિજને વર્સંતિ ગિરિગહ્રે ।
શુદ્ધચિદ્રૂપસંપ્રાસ્તૈ જ્ઞાનિનોઽન્યત્ર નિઃસ્પૃહાઃ ॥૫॥

જ્ઞાનીજનો પર વિષે, અતિ નિઃસ્પૃહી જે,
પ્રાપ્તિ સદા વિમલ ચિદ્રૂપની ચાહી તે;
સૌ સંગ આસ્ત્રવ મહા ગાણીને તજે એ,
એકાંતવાસ ગિરિગહ્રને ભજે એ. ૫.

આર્થ :—જ્ઞાનીજનો પરભાવોમાં નિસ્પૃહ થઈને શુદ્ધ ચિદ્રૂપની સંપ્રાપ્તિ માટે, સંગનો ત્યાગ કરીને, એકાંત ગિરિગુફામાં વસે છે. ૫.

સ્વલ્પકાર્યકૃતૌ ચિંતા મહાવજ્ઞાયતે ધ્રુવં ।
મુનીનાં શુદ્ધચિદ્રૂપધ્યાનપર્વત ભંજને ॥૬॥

શુદ્ધચિદ્રૂપસદ્ગ્યાનભાનુરત્યંતનિર્મલઃ ।
જનસંગતિસંજાતવિકલ્પાદ્વસ્તિરોભવેત् ॥૭॥

ચિંતા જરાય પર કાર્યની વજ ભારે,
ચિદ્રૂપ ધ્યાન ગિરિ એ મુનિનો વિદારે;
ચિદ્રૂપ ધ્યાન રવિ નિર્મળ તે છવાયે,
વિકલ્પ મેઘ જનસંગતિજન્ય આવ્યે. ૬-૭.

આર્થ :—મુનિઓને શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનરૂપ પર્વત તોડવાને માટે અલ્ય કાર્ય અંગે કરેલી ચિંતા નિશ્ચયથી મહાન વજ જેવી બને છે. ૬.

મનુષ્યોના સંગથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપ વાદળો વડે, અત્યંત નિર્મળ, શુદ્ધ આત્મધ્યાનરૂપ સૂર્ય ઢંકાઈ જાય છે. ૭.

અભવ્યે શુદ્ધચિદ્રૂપધ્યાનસ્ય નોદ્રવો ભવેત् ।
વંધ્યાયાં કિલ પુત્રસ્ય વિષાણસ્ય ખરે યથા ॥૮॥

દૂરભવ્યસ્ય નો શુદ્ધચિદ્બૂપધ્યાનસંરુचિ:
યથાજીર્ણવિકારસ્ય ન ભવેદન્નસંરુચિ: ॥૬॥

શુદ્ધાત્મનું અભવિને નહિ દ્યાન હોવે,
વંદ્યા યથા સુત નહીં, ખર શૃંગ પાવે;
શુદ્ધાત્મ-દ્યાન રૂચિ ના દૂરભવ્ય પામે,
થાયે અજીર્ણ રૂચિ અન્નની ત્યાં વિરામે. ૮-૯.

અર્થ :—જેમ વંદ્યા સ્ત્રીમાં પુત્રની તથા ગધેડામાં શિંગડાની ખરેખર ઉત્પત્તિ થતી નથી, તેમ અભવ્ય જીવમાં શુદ્ધ ચિદ્બૂપના ધ્યાનની ઉત્પત્તિ થતી નથી. ૮.

જેવી રીતે અજીર્ણના રોગીને ભોજન લેવાની સાચી રૂચિ થતી નથી, તેવી રીતે દૂરભવ્યમાં (જેનો મોક્ષ નિકટ નથી તેવા જીવમાં) શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં યથાર્થ રૂચિ થતી નથી. ૯.

ભેદજ્ઞાનં વિના શુદ્ધચિદ્બૂપજ્ઞાનસંભવ: ।
ભવેન્નૈવ યથા પુત્રસંભૂતિર્જનકં વિના ॥૧૦॥
કર્માગાખિલસંગે, નિર્મમતામાતરં વિના ।
શુદ્ધચિદ્બૂપસદ્ધ્યાનપુત્રસૂતર્ન જાયતે ॥૧૧॥

સંતાન સંભવ નહીં જ્યામ વિણ તાત,
ના ભેદજ્ઞાન વિણ શુદ્ધ સ્વરૂપ ઝાત;
સૌ સંગ-કર્મ-તન-નિર્મમતા જનેતા,
શુદ્ધાત્મધ્યાન-સુત-સંભવ તે વિના ના. ૧૦-૧૧

અર્થ :—જેમ પિતા વિના પુત્રનો જન્મ થાય જ નહિ, તેમ ભેદજ્ઞાન વિના શુદ્ધ ચિદ્બૂપના જ્ઞાનનો સંભવ થાય જ નહિ. ૧૦.

કર્મ, શરીર અને સમસ્ત સંગમાં, નિર્મમતારૂપ માતા વિના શુદ્ધ ચિદ્બૂપના સદ્ધ્યાનરૂપ પુત્રનો જન્મ થતો નથી. ૧૧.

તત્ત્વસ્ય ગતચિંતા નિર્જનતાઽસત્ત્ર ભવ્યતા ।
ભેદજ્ઞાનં પરસ્મિન્નિર્મમતા ધ્યાનહેતવઃ ॥૧૨॥

ચિંતા અભાવ વળી નિર્જનવાસ ભાવે,
આસંજનભત્વાપણું, ભેદ વિબોધ પાવે;
દેહાદિ સર્વ પરમાંથી મમત્વ જાયે,
એ ધ્યાન હેતુ નરરત્ન વિષે સુહાયે. ૧૨.

અર્થ :—તેથી ચિંતાનો અભાવ, એકાંતવાસ, સમીપ
મુક્તિગ્રામીપણું, ભેદ-વિજ્ઞાન, પરમાં નિર્મમતા, તેના ધ્યાનના હેતુઓ
છે. ૧૨.

નૃસ્ત્રીતિર્યગ્સુરાણાં સ્થિતિગતિવચ્ચનં નૃત્યગાનં શુચાદિ
ક્રીડાક્રોધાદિ મૌનં ભયહસનજરારોદનસ્વાપશૂકાઃ ।
વ્યાપારાકારરોગં નુતિનતિકદનં દીનતાદુઃખશંકા:
શૃંગારાદીનું પ્રપશ્યન્ત્રમિહ ભવે નાટકં મન્યતે જ્ઞઃ ॥૧૩॥

(શાર્દૂલવિકીડિત)

સંસારે નર નારી દેવ પશુનાં, સ્થિતિ ગતિ ગાનને,
વાણી નૃત્ય કીડા પીડા રૂદ્ધનને કોધાદિને મૌનને;
આકૃતિ સ્તુતિ સૌ પ્રવૃત્તિ ભીતિને વ્યાધિ જરા દુઃખને,
જોતા નાટક માનિ જ્ઞાની સમ તે શૃંગાર કે શોકને. ૧૩.

અર્થ :—આ સંસારમાં મનુષ્ય, સ્ત્રી, પશુ અને દેવોની સ્થિતિ,
ગતિ, વચ્ચનને, નૃત્યને, ગીતને, શોક આદિને, કીડાને, કોધને, મૌનને,
ભય, હાસ્ય, જરા, રૂદ્ધન, નિદ્રા તથા જુગુખ્સાને, વ્યાપાર, આકૃતિ,
રોગને, સ્તુતિ, પ્રણામ, પીડાને, દીનતા, દુઃખ, શંકાને, ભોજનને,
શૃંગારાદિને વાસ્તવિક રૂપે જોતાં જ્ઞાની નાટક માને છે. ૧૩.

ચક્રીંદ્રયો: સદસિ સંસ્થિતયો: કૃપા સ્યા-
તદ્વાર્યયોરતિગુણાન્વિતયોર્ધ્વણા ચ ।

સર્વોત્તમેદ્રિયસુખસ્મરणે ઽતિકષ્ટ
યસ્યોદ્ધ્વચેતસિ સ તત્ત્વવિદાં વરિષ્ઠઃ ॥૧૪॥

યકી ઈજ્ઞસભા વિરાજિત અહા ! દેખી દયા આવતી,
રાણી કે શાયિ સુંદરાંગી રતિશી, જોતાં ઘૃણા જાગતી;
સર્વોદ્ધૃષ્ટ સુખો સ્મર્યે વિષયનાં આપે સ્મૃતિ દુઃખની,
શિરે એ પ્રગાટ્યો વિવેક નર તે તત્ત્વજ્ઞ શિરોમણિ. ૧૪.

આર્થ :—જેમના ઉચ્ચ ચિત્તમાં, સભામાં વિરાજિત ચક્રવર્તી કે
ઈજ્ઞની ઉપર દયા આવે, રતિ સમાનરૂપ અને અતિશય ગુણયુક્ત તેમની
સ્ત્રીઓ, ચક્રવર્તીની પટરાણી તથા ઈજ્ઞાણીની ઉપર આણગમો
આવે તથા સર્વોત્તમ ઈન્દ્રિય સુખના સ્મરણથી અત્યંત કષ્ટ થાય, તે
તત્ત્વજ્ઞાનીઓમાં સર્વોત્તમ છે. ૧૪.

રમ્ય વલ્કલપર્ણમંદિરકરીરં કાંજિકં રામઠં
લોહં ગ્રાવનિષાદકુશ્ચુતમટેદ્ યાવત્ત્ર યાત્યંબરં ।
સૌધં કલ્પતરું સુધાં ચ તુહિનં સ્વર્ણ મળિં પંચમં
જૈનીવાચમહો તથેદ્રિયભવં સૌખ્યં નિજાત્મોદ્ભવં ॥૧૫॥

(હરિગીત)

દિવ્ય વસ્ત્રો મહેલ સુરતસુ કે સુધા કંચન મણિ,
જિનેજ્ઞવાણી આત્મસુખને જ્યાં સુધી પામ્યા નથી;
ત્યાં સુધી વલ્કલ પર્ણકુટી કરીર કાંજુ લોહને,
પથ્થર કુશ્ચુતિ વિષયસુખ અતિ રમ્ય લાગે લોકને. ૧૫.

આર્થ :—જેમ, જ્યાં સુધી જીવને દિવ્ય વસ્ત્ર, મહેલ, કલ્પતરુ,
અમૃત, કપૂર, સુવર્ણ, મણિરત્ન, કોયલનો સ્વર અને જિનેજ્ઞની
દિવ્યવાણી પ્રાપ્ત થતી નથી; ત્યાં સુધી આશ્ર્યની વાત છે કે તે વલ્કલને
(ઝડણી છાલના વસ્ત્રો), ધાસપર્ણની ઝુંપડી, કેરડા, રાખ, હિંગ, લોહું,
પથ્થર, હાથીનો કર્કશ સ્વર અને કુશાસ્ત્રને રમ્ય માનીને તેને માટે ભટકે

છે, તેવી રીતે જ્યાં સુધી જીવને નિજ આત્મિક સુખની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી જીવ ઈન્દ્રિયજ્ઞનિત સુખ તરફ ભટકે છે. ૧૫.

કેચિદ् રાજાદિવાર્તા વિષયરતિકલાકીર્તિપ્રાસિચિતાં
સંતાનોદ્ભૂત્યુપાયં પશુનગવિગવાં પાલવં ચાન્યસેવાં ।
સ્વાપક્રીડૌષધાદીન् સુરનરમનસાં રંજન દેહપોષં
કુર્વતોઽસ્યંતિ કાલં જગતિ ચ વિરલા: સ્વસ્વરૂપોપલબ્ધિં ॥૧૬॥

રાજાદિની વિકથા વિષે ઈન્દ્રિયરતિ કીર્તિ કલા,
ધન તનય છચ્છા, અન્ય સેવા, પશુ વૃક્ષ પક્ષીની લલા;
ઔષધ શયન કીડા શરીર-પોષણ મનુષ સુર રંજને,
સૌ વ્યર્થ કાલ વીતાવતા, વિરલા જ ચિદ્રૂપ ચિંતને. ૧૬.

અર્થ :—જગતમાં કેટલાક જીવો રાજાદિની વાર્તા, વિષયભોગ, શ્રીરતિ, કલા, કીર્તિ અને ધનપ્રાપ્તિની ચિંતા, સંતાનની ઉત્પત્તિના ઉપાય, પશુ, વૃક્ષ, પક્ષી, ગાય, બળદના પાલન અને અન્યની સેવા, નિદ્રા, કીડા, ઔષધ આદિ સુર અને નરોના મનને રંજન, દેહનું પોષણ કરતાં થકાં કાળને ગુમાવી દે છે અને અતિ અલ્ય જીવો સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં કાળ વીતાવે છે. ૧૬.

વાચાંગેન હૃદા શુદ્ધચિદ્રૂપોહમિતિ બ્રુવે ।
સર્વદાનુભવામીહ સ્મરામીતિ ત્રિધા ભજે ॥૧૭॥
શુદ્ધચિદ્રૂપસદ્ધ્યાનહેતુભૂતાં ક્રિયાં ભજેત् ।
સુધીઃ કાંચિચ્ચ પૂર્વ તદ્ધ્યાને સિદ્ધે તુ તાં ત્યજેત् ॥૧૮॥

(માલિની)

તન મન વચને હું, શુદ્ધ ચિદ્રૂપ સેવું,
અનુભવું સમરું ગાઉં ભક્તિથી નિત્ય દ્યાવું;
સહજ સ્વરૂપદ્યાને કાર્યકારી કિયા જે,
વિમલ-મતિ ભજે સૌ દ્યાન સિદ્ધે તજે તે. ૧૭-૧૮

આર્થ :—અહીં, વાણીથી, શરીરથી, ચિત્તથી શુદ્ધ ચિદ્રૂપ હું છું એમ ઉચ્ચાર, અનુભવું, સ્મરણ કરું; એમ ત્રણ પ્રકારે હમેશાં ભજું. ૧૭.

સમ્યગ્જ્ઞાની શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનમાં કારણભૂત કોઈ પણ કિયાને પ્રથમ ભજે, પરંતુ તે ધ્યાનની સિદ્ધિ થતાં કિયાને તજી દે. ૧૮.

અંગસ્યાવયવૈરંગમંગુલ્યાદ્યઃ પરામૃષેત् ।

મત્યાદ્યઃ શુદ્ધચિદ્રૂપાવયવૈસ્ત તથા સ્મરેત् ॥૧૬॥

જેયે દૃશ્યે યથા સ્વે સ્વે ચિત્ત જ્ઞાતરિ દૃષ્ટરિ ।

દ્વાચ્ચેન્ના તથા વિંદેત્યરં જ્ઞાનં ચ દર્શનં ॥૨૦॥

જ્યમ શરીર-અવયવ અંગુલિ આદિથી તન લક્ષ્યાય છે,
ચિદ-અંગ મત્યાદિ સુજ્ઞાને સ્વરૂપ સ્મૃતિ પમાય છે;
પર ફોય-દશ્યે જન દિયે મન તેમ જો સ્વરૂપે દીએ,
જ્ઞાતા તથા દખા વિષે તો જ્ઞાન દર્શન વર લીએ. ૧૮-૨૦

આર્થ :—શરીરના આંગળી આદિ અવયવો વડે શરીરનું અનુમાન થાય છે અને પછી સ્પર્શાય છે, તેમ શુદ્ધ ચિદ્રૂપના અવયવો મતિજ્ઞાન આદિ વડે તે શુદ્ધ ચિદ્રૂપને સ્મરવું, ધ્યાવું જોઈએ. ૧૮.

જેમ મનુષ્ય પોતાના જ્ઞેય અને દેશ્યમાં ચિત્તને જોડે છે તેમ જો તે જ્ઞાતાદેષા એવા સ્વમાં ચિત્ત જોડે, તો તે ઉત્કૃષ્ટ જ્ઞાન અને દર્શનની પ્રાપ્તિ કરે છે. ૨૦.

ઉપાયભૂતમેવાત્ર શુદ્ધચિદ્રૂપલબ્ધયે ।

યત્ કિંચિત્તત્ પ્રિયં મેઽસ્તિ તર્દર્થિત્વાન્ન ચાપરં ॥૨૧॥

ચિદ્રૂપઃ કેવલઃ શુદ્ધ આનંદાત્મેત્યહં સ્મરે ।

મુક્ત્યૈ સર્વજ્ઞોપદેશઃ શ્લોકાર્દેન નિરૂપિતઃ ॥૨૨॥

હું શુદ્ધ ચિદ્રૂપ અર્થી, સદુપાયો બધા તે તે ચાહું,
છે તે જ પ્રિય મુજને ઘણા, તેથી અવર કદી ના ચાહું;

ચિદ્રૂપ કેવલ શુદ્ધ હું આનંદધામ સદા સ્મરણ,
શ્લોકાર્થી સર્વજ્ઞ ભાષિત બોધ મોક્ષાર્થ ધરણ. ૨૧-૨૨

આર્થી :—શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે અહીં જે કંઈ પણ કારણરૂપ હોય તે મને—હું તેનો જ અભિવાધી હોવાથી—પ્રિય છે અને અન્ય પ્રિય નથી.

હું ચૈતન્યસ્વરૂપ, એકલો, નિર્મળ, આનંદસ્વરૂપ છું, એમ સ્મરણ કરું છું. અર્ધ શ્લોકમાં આ મુક્તિ માટેનો સર્વજ્ઞનો ઉપદેશ કહેલો છે. ૨૧-૨૨.

बहिःक्षितः पुरः शुद्धचिद्रूपाख्यानकं वृथा ।

अंधस्य नर्तनं गानं बधिरस्य यथा भुवि ॥२३॥

अंतक्षितः पुरः शुद्धचिद्रूपाख्यानकं हितं ।

बुभुक्षिते पिपासार्तेऽन्नं जलं योजितं यथा ॥२४॥

જ્યમ અંધ આગળ નૃત્ય કે ગીત બધિર આગળ વ્યર્થ છે,
ત્યમ શુદ્ધ ચિદ્રૂપનું કથન બહિરાત્મ આગળ વ્યર્થ છે;
ભૂખ્યા કને જ્યમ અન્ન કે તરસ્યા કને જળ હિત કરે,
ત્યમ અંતરાત્મા સમીપ ચિદ્રૂપ-કથન હિતકર છે ખરે. ૨૩-૨૪

આર્થી :—જેમ લોકમાં આંધળાની આગળ નાચ અને બહેરાની આગળ ગાન નકામા છે, તેમ અજ્ઞાની પાસે શુદ્ધ આત્મસ્વરૂપનું વ્યાખ્યાન નિરર્થક છે. ૨૫.

જેમ ભૂખ્યા પાસે મૂકેલું અન્ન, તરસથી પીડાતા પાસે જળ,
હિતરૂપ થાય છે; તેવી રીતે અંતરાત્માની પાસે શુદ્ધ ચિદ્રૂપનું વ્યાખ્યાન સર્ફળ થાય છે. ૨૪.


ઉપાયા બહવः સંતિ શુદ્ધचિદ્રૂપલબ્ધયે ।

તદ્ધ્યાનેન સમો નાભૂદુપાયો ન ભવિષ્યતિ ॥૨૫॥

(અનુષ્ઠાન)

શુદ્ધ ચિદ્રૂપ પ્રાપ્તિના ઉપાયો બહુ સર્વદા,
ઇતાં તદ્દ્યાન જેવો ના થયો છે ના થશે કદા. ૨૫

અર્થ :—શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે ઘણા ઉપાયો છે. (ખણ)
તેનો ધ્યાન જેવો (બીજો કોઈ) ઉપાય થયો નથી, (છે નહિ) અને થશે
નહિ. ૨૫.



અધ્યાય ૪ થો

[શુદ્ધ ચિદ્રૂપના માર્ગની સુગમતા]

ન કલેશો ન ધનવ્યયો ન ગમન દેશાંતરે પ્રાર્થના
કેષાંચિન્ન બલક્ષયો ન ન ભય પીડા પરસ્યાપિ ન।
સાવદ્રયં ન ન રોગ જન્મપતન નૈવાન્યસેવા ન હિ
ચિદ્રૂપસ્મરણે ફલં બહુ કથં તત્ત્વાદ્રિયંતે બુધાઃ ॥૧॥

(વસંતતિલકા)

ચિદ્રૂપના સ્મરણમાં ફળ છે ધારોલં,
ના દુઃખ દ્વાદ્યાય વ્યાધિ વિદેશ કેણ;
જન્માદિ ભીતિ પરસેવ પ્રયાચના ના,
ના પાપ તાપ બુધ ! આદર કાં ધરો ના ? ૧.

અર્થ :—ચિદ્રૂપના સ્મરણમાં કલેશ નથી, ધન ખરચવું પડતું નથી, પરદેશમાં જવું પડતું નથી, કોઈની પાસે યાચના કરવી પડતી નથી, બળનો ક્ષય થતો નથી, ભય થતો નથી શત્રુ તરફથી પીડા થતી નથી, પાપ લાગતું નથી, રોગ, જન્મ કે મરણ થતાં નથી, બીજાઓની સેવા પણ કરવી પડતી જ નથી. (અને) ફળ ધાર્યું છે (તો) હે વિદ્જજ્ઞનો ! તમે તેમાં કેમ આદર ઉત્સાહ ધરતા નથી ? ૧.

તુર્ગમા ભોગભૂ: સ્વર્ગભૂમિર્વિદ્યાધરાવનિઃ ।
નાગલોકધરા ચાતિસુગમા શુદ્ધચિદ્રા ॥૨॥

હે ! પ્રાપ્તિ ભોગભૂમિની, સુરલોક કેરી,
વિધાધરો તણી ભૂમિ, ભૂમિ નાગ કેરી.
છે એ નહીં સુગમ તો, જરી જો વિચારો,
ચિદ્રૂપ પ્રાપ્તિ સુગમ તેથી સ્વકાર્ય સારો. ૨

આર્થ :—ભોગભૂમિ, સ્વર્ગલોક, વિદ્યાધરોની ભૂમિ, નાગલોકની પૃથ્વી પ્રાપ્ત થવી મુશ્કેલ છે. શુદ્ધ ચૈતન્યરૂપ ભૂમિ (દશા) અત્યંત સુગમ છે. ૨.

તત્ત્વાધને સુખં જ્ઞાનं મોચનं જાયતે સમં।
નિરાકુલત્વમભયં સુગમા તેમ હેતુના ॥૩॥

તે આત્મ સાધન કર્યે સુખ જ્ઞાન થાયે,
તે સાથ મુક્તિ અહિંયાં જ અનુભવાયે;
આકુલતા રહિત એ સહજાત્મ પ્રાપ્તિ,
તેથી ગણી સુગમ તે, રહી જ્યાં ન ભીતિ. ૩.

આર્થ :—તેના સાધનમાં સુખ, જ્ઞાન, કર્મથી મુક્તિ, નિરાકુળતા, નિર્ભયતા એક સાથે ઉત્પન્ન થાય છે, તે કારણથી શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ સુગમ છે. ૩.

અન્નાશમાગુરુનાગફેનસદૂશં સ્પર્શેન તસ્યાંશત:
કૌમારાપ્રકસીસવારિસદૂશં સ્વાદેન સર્વ વરં।
ગંધેનૈવ ઘૃતાદિ વસ્ત્રસદૂશં દૃષ્ટ્યા ચ શબ્દેન ચ
કર્કયાદિ ચ માનસેન ચ યથા શાસ્ત્રાદિ નિશ્ચીયતે ॥૪॥

સ્મृત્યા દૃષ્ટનગાબ્ધિભૂરુહપુરીતિર્યંનરાણાં તથા
સિદ્ધાંતોકતસુરાચલહૃદનદીદ્વીપાદિલોકસ્થિતે: ।
ખાર્થાનાં કૃતપૂર્વકાર્યવિતતે: કાલત્રયાણામપિ
સ્વાત્મા કેવલચિન્મયોऽશકલનાત् સર્વોઽસ્ય નિશ્ચીયતે ॥૫॥ યુગ્માં।

પાખાણ આદિ પરખો જ્યમ અંશ સ્પર્શે,
આભ્રાદિ સારી ગણીએ જ્યમ સ્વાદ અંશે.
વસ્ત્રાદિ દાખિથી, ઘૃતાદિ જ્ઞાનાય ગંધે,
શાસ્ત્રાદિ નિશ્ચય મને, ગીત દંટ શબ્દે. ૪.

પૂર્વે દીકેલ ત્યમ વારિધિ વૃક્ષને જે,
કે ગ્રામ માનવ પશુ સધળાં સમરે છે;
શાસ્ત્રોથી સાંભળી નદી હૃદ મેળ સર્વે,
દીપાદિ લોકસ્થિતિ જે સ્મૃતિમાં ઘરે છે;
ઇન્દ્રિયના વિષય કાર્ય કરેલ પૂર્વે,
જેને બ્રિકાળ ઉરમાં વળી ચાદ આવે;
અંશે અનુભવી સ્મૃતિ થકી તે કળાયે,
સંપૂર્ણ ચિન્મય નિજાત્મ પ્રતીત થાયે. ૫.

આર્થી :—જેમ અન્ન, પથર, અગ્ર, અઝીશ અને તેવા બીજા પદાર્થોને તે દરેકના આંશિક સ્પર્શથી તે દરેક સંપૂર્ણપણે ઓળખાય છે. કેરી, કસીસ, જળ જેવા પદાર્થોને દરેકના સ્વાધથી (ચાખવાથી) સંપૂર્ણપણે ઓળખી શકાય છે. ધી વગેરે પદાર્થોને ગંધ વડે જ, વાઙ્મ જેવા પદાર્થોને દદિ વડે (જોવાથી) અને જાલર, ધંટ, ગીત આદિને શબ્દ સાંભળવાથી ઓળખી શકાય છે તથા શાસ્ત્રાદિનો મન વડે નિશ્ચય થાય છે, વળી પૂર્વે જોયેલા પર્વત, સમુદ્ર, વૃક્ષ, નગર, પશુ અને મનુષ્યોની સિદ્ધાંત (શાસ્ત્ર)માં કહેલા મેળ, સરોવર, નદી, દીપ આદિ લોકસ્થિતિની, ઇન્દ્રિયોના વિષયોની, પૂર્વે કરેલા કાર્યોની પરંપરાની ત્રણે કાળ સંબંધી ઓળખાણ (નિશ્ચય) થઈ શકે છે; તેવી જ રીતે શુદ્ધ ચિદૂપની સ્મૃતિ વડે, અંશે અનુભવથી તેનું સંપૂર્ણપણું જે પોતાનો આત્મા-કેવળ જ્ઞાનમય છે, તેનો નિશ્ચય કરાય છે. ૪-૫.

દ્રવ્યं ક્ષેત્રં ચ કાલં ચ ભાવમિચ્છેત્ સુધીઃ શુભં।
શુદ્ધચિદૂપસંપ્રાસિ હેતુભૂતં નિરંતરં ॥૬॥

ન દ્રવ્યેન ન કાલેન ન ક્ષેત્રેણ પ્રયોજનં।
કેનચિત્ત્રૈવ ભાવેન લલ્બે શુદ્ધચિદાત્મકે ॥૭॥
તો દ્રવ્યક્ષેત્ર શુભ કાળ સ્વભાવ સર્વે,
ચિદૂપ પ્રાપ્તિ સદૃપાય સદાય સેવે;

તે બુદ્ધિમાન સહજાત્મસવરૂપ પામ્યે,
દ્રવ્યાદિનું પછી નહિ કંઈ કામ નામે. ૬-૭.

આર્થ :—સમ્યગ્જ્ઞાની શુદ્ધ આત્મદશાની અખંડ પ્રાપ્તિના કારણરૂપ શુભ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નિરંતર ઈચ્છે. ૬

શુદ્ધ ચૈતન્ય આત્મદશા પામ્યા પછી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી (કંઈ) પ્રયોજન નથી ૪. ૭.

પરમાત્મા પરંબ્રહ્મ ચિદાત્મા સર્વદૃક્ શિવः ।
નામાનીમાન્યહો શુદ્ધચિદૂપસ્યૈવ કેવલં ॥૮॥

(જૂલાણા)

સર્વ દ્રષ્ટા પરબ્રહ્મ પરમાત્મા,
તે ચિદાત્મા પ્રભુ શિવ કહાયે;
શુદ્ધ ચિદૂપ કેવલ અહા ! જાણીએ,
નામ તેનાં જ સૌ એ ગણાયે. ૮.

આર્થ :—પરમાત્મા, પરંબ્રહ્મ, ચિદાત્મા, સર્વદ્રષ્ટા, કલ્યાણસવરૂપ, આ (બધા) નામો ખરેખર ઈક્ત શુદ્ધ ચિદૂપનાં જ છે. ૮.

મધ્યે શ્રુતાબ્ધે: પરમાત્મનામ—રત્નવર્જં વીક્ષ્ય મયા ગૃહીતં ।
સર્વોત્તમત્વાદિદમેવ શુદ્ધચિદૂપનામાતિમહાર્થરલં ॥૯॥

નામ પરમાત્મનાં, સમૂહ રત્નો તણો,
શાસ્ત્ર રત્નાકરે શોભતો હા !
શુદ્ધ ચિદૂપ ઉતામ મહામૂલ્ય ત્વાં,
ભાળીને મેં ગ્રહું રત્ન તો આ. ૯.

આર્થ :—વીતરાગ પ્રવચનરૂપ સમુદ્રની મધ્યમાં પરમાત્માના નામરૂપ રત્નનો સમૂહ જોઈને જે માત્ર આ શુદ્ધ ચિદૂપ નામનું મહામૂલ્યવાન રત્ન સર્વોત્તમ હોવાથી મેં તેનું ગ્રહણ કર્યું છે. ૯

નાહં કિંચિત્ત્ર મે કિંચિદુઃ શુદ્ધચિદૂપકં વિના ।
તસ્માદન્યત્ર મે ચિંતા વૃથા તત્ર લયં ભજે ॥૧૦॥

શુદ્ધ ચિદૂપ વિણ અન્ય તે હું નહીં,
તે વિના અન્ય કંઈ મારું નાંહી;
તેથી અન્યાગ ચિંતા બધી વ્યર્થ ત્યાં,
થાઉં તલ્લીન ચિદૂપમાંહી. ૧૦.

આર્થ:—શુદ્ધ ચિદૂપ વિના કંઈ પણ હું નથી, કંઈ પણ મારું નથી, તેના સિવાય બીજે મારી ચિંતા નકામી છે; તેથી હું તેમાં લય પામવાનો પ્રયત્ન કરું છું. ૧૦.

અનુભૂય મયા જ્ઞાતં સર્વ જાનાતિ પશ્યતિ ।
અયમાત્મા યદા કર્મપ્રતિસીરા ન વિદ્યતે ॥૧૧॥

કર્મ વાદળ વિષે આત્મરવિ જ્યાં છૂંખ્યો,
જ્ઞાન દર્શન ધૂતિ અત્ય ભાસે;
અનુભવે જાણ્યું મેં, કર્મ પડદો ખસ્યે,
પૂર્ણ તે^{૧૫} જ્ઞાન દર્શન પ્રકાશે. ૧૧.

આર્થ:—જ્યારે કર્મરૂપ પડદો નથી હોતો ત્યારે આ આત્મા સર્વને જાણો છે અને દેખે છે, એમ મેં અનુભવ કરીને જાણ્યું છે. ૧૧.

વિકલ્પજાલજંબાલાન્નિર્ગતોऽયં સદા સુખી ।
આત્મા તત્ર સ્થિતો દુઃখીત્યનુભૂય પ્રતીયતાં ॥૧૨॥
અનુભૂત્યા મયા બુદ્ધમયમાત્મા મહાબલી ।
લોકાલોકં યતઃ સર્વમંતરન્યતિ કેવલ: ॥૧૩॥

કલ્પના જાલ સેવાલમાંથી ચદિ,
આત્મરૂપ આ વિભુ ઉપર આવે;
તો સદા તે સુખી, તે વિના ત્યાં દુઃખી,
અનુભવે સુજ્ઞ સૌ પ્રતીત પાવે.

અનુભવે જાણ્યું મેં આ ચિદાત્મા અહો !
 શું અનુપમ મહા શક્તિધારી !
 લોક ને સૌ અલોકાદિ સર્વરૂપને,
 જાણી નિજમાં શમે, જ્ઞાનભારી ! ૧૨-૧૩.

આર્થ :—વિકલ્પોની જાળરૂપ સેવાળમાંથી બહાર નીકળેલો આ આત્મા સદા સુખી (છે) અને ત્યાં રહેલો દુઃખી છે, એમ અનુભવીને નિશ્ચય કરો.

મેં અનુભવથી જાણ્યું છે કે આ આત્મા મહાન શક્તિશાળી છે, કારણ કે પોતે એકલો જ, સર્વ લોક-અલોકને અંતરમાં (જ્ઞાનમાં) સમાવી દે છે. ૧૨-૧૩.

સ્મृતિમેતિ યતો નાદૌ પશ્ચાદાયાતિ કિંचિન |
 કર્મોદયવિશેષોऽયં જ્ઞાયતે હિ ચિદાત્મનઃ ॥૧૪॥
 વિસ્ફુરેન્માનસે પૂર્વ પશ્ચાન્નાયાતિ ચેતસિ |
 કિંચિદ્વસ્તુ વિશેષોऽયં કર્મણઃ કિં ન બુધ્યતે ॥૧૫॥

પ્રથમ સ્મરતાં સ્મૃતિમાં ન આવે કંઈ,
 જે ધીમેથી પછી યાદ આવે;
 કર્મનો ઉદ્ય ત્યાં આ ચિદાત્મા તણો,
 સ્પષ્ટ તે કોઈ પ્રકારે જણાયે;
 પ્રથમ મનમાં સ્કુરે સ્મરણ કંઈ વસ્તુનું,
 પછીથી સંભારતાં સાંભરે ના;
 એ જ કો કર્મનો બેદ વિદ્જજ્ઞનો,
 કેમ નિશ્ચય કરો અંતરે ના ? ૧૪-૧૫.

આર્થ :—કેમ કે પ્રથમ સ્મરણમાં આવતું નથી, પછીથી કંઈક આવે છે, ખરેખર આ ચિદાત્માનો કર્મોદયનો પ્રકાર જગ્ઞાય છે. ૧૪.

પહેલાં કંઈક વસ્તુ મનમાં યાદ આવે, પાછળથી ચિત્તમાં યાદ આવે નહિ, આ કર્મની વિશેષતા કેમ ઘ્યાલમાં આવતી નથી? ૧૫.

સર્વેષામપि કાર્યાણાં શુદ્ધચિદ્બૂપચિંતનં ।
સુખસાધ્યાં નિજાધીનત્વાદીહામુત્ર સૌખ્યકૃત ॥૧૬॥
પ્રોદ્યન્મોહાદ્ય થયા લક્ષ્યાં કામિન્યાં રમતે ચ હત્ત ।
તથા યદિ સ્વચિદૂપે કિં ન મુક્તિઃ સમીપગા ॥૧૭॥

સર્વ કાર્યો વિષે સાધ્ય સુગમ દીસે,
શુદ્ધચિદૂપ ચિંતન વિચારો.
અવર પરતંત્ર, સ્વાધીન નિજ ધ્યાન તો,
લોક પરલોક સુખકર સ્વીકારો. ૧૬.
મોહ ઉદ્યે મહામત છા ! ચિત્ત આ,
કામિની કનકમાં રક્ત નિત્યે;
તેમ જો ચિત્ત નિજ ચિદ્દસ્વરૂપમાં ઘરો,
કેમ તો મુક્તિના સમીપ વર્તે ! ૧૭.

અર્થ :—બધા કાર્યોમાં શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન આ લોક અને
પરલોકમાં સુખ આપનાર, પોતને આધીન હોવાથી સરળતાથી સધાય તેવું
છે. ૧૬. *આ અનુભૂતિ માટે એવી અનુભૂતિ નથી.*

જેમ મોહથી મત મન કુંચન અને કામિનીમાં રહે છે, તેમ જો
પોતાના શુદ્ધ આત્મામાં રહે, તો શું મોક્ષ સમીપ ન આવે? ૧૭.

વિમુચ્ય શુદ્ધચિદૂપચિંતનં યે પ્રમાદિનઃ ।
અન્યત્ કાર્ય ચ કુર્વતિ તે પિબંતિ સુધાં વિષં ॥૧૮॥
વિષયાનુભવે દુઃખં વ્યાકુલત્વાત્ સતાં ભવેત્ ।
નિરાકુલત્વતઃ શુદ્ધચિદૂપાનુભવે સુખં ॥૧૯॥

શુદ્ધ ચિદૂપ ચિંતન તણું અન્ય જે,
કાર્ય કરવા પ્રમાદી પ્રવર્તે;
તે જનો પાન પીયૂષનું છોડીને,
વિષપાને અહો કેમ વર્તે ?

વિષયસુખ અનુભવે વ્યાકુલિત મન બને,
દુઃખ ત્યાં તેથી તત્પરા માને;
શુદ્ધ ચિદ્રૂપ અનુભવે સુખ મહા !
ત્યાં નિરાકુળતા નિત્ય માણે. ૧૮-૧૯.

આર્થ :—જે પ્રમાણીઓ શુદ્ધ ચિદ્રૂપનું ચિંતન છોડીને અન્ય કાર્ય કરે છે, તેઓ અમૃત છોડીને વિષનું પાન કરે છે. ૧૮.

વિષયોના અનુભવમાં વ્યાકુળતા હોવાથી સંતોને દુઃખ થાય છે,
શુદ્ધ આત્માના અનુભવમાં નિરાકુળતા હોવાથી સુખ થાય છે. ૧૯.

રાગદ્રેષાદિં દુઃખં શુદ્ધચિદ્રૂપચિંતનાત् ।
યાતિ તચ્ચિતનં ન સ્યાદુ યતસ્તદ્ગમનં વિના ॥૨૦॥
આનન્દો જાયતેત્યંતઃ શુદ્ધચિદ્રૂપચિંતને ।
નિરાકુળત્વરૂપો હિ સતાં યત્તન્યોऽસ્ત્યસૌ ॥૨૧॥

રાગદ્રેષાદિથી ઉપજે દુઃખ જે,
શુદ્ધ ચિદ્રૂપ ચિંતનથી જાયે;
કેમ કે તે ગયા વિષ ચિંતન કદી,
શુદ્ધ ચિદ્રૂપનું ના પમાયે;
શુદ્ધ ચિદ્રૂપના ચિંતને સંતને,
કોઈ અત્યંત આનંદ આવે;
તે નિરાકુળતારૂપ આનંદ છે,
એક તન્મયપણે ચિદ-સ્વભાવે. ૨૦-૨૧.

આર્થ :—રાગ-દ્રેષાદિથી ઉત્પન્ન થતું દુઃખ શુદ્ધ-આત્મસ્વરૂપના ચિંતનથી દૂર થઈ જાય છે, કારણ કે તેના દૂર થયા વિના તેનું (ચિદ્રૂપનું) ચિંતન થતું નથી.

ખરેખર સંતોને શુદ્ધ આત્માનું ચિંતન કરતાં નિરાકુળતારૂપ અત્યંત આનંદ પ્રગટે છે, કારણ કે તે ચિદ્રૂપ આનંદમય છે. ૨૧.

તં સ્મરન् લભતે ના તમન્યદન્યચ્ચ કેવલં ।
 યાતિ યર્થ પથા પાંથસ્તદેવ લભતે પુરં ॥૨૨॥
 શુદ્ધચિદ્દૂપસંપ્રાતિરૂપમા મોહતોડગિનાં ।
 તજયોડત્યંત સુગમા ક્રિયાકાંડવિમોચનાત् ॥૨૩॥

જે સ્મરે સ્વરૂપ, તે જ પ્રાપ્તિ કરે,
 અન્ય સ્મરણે જનો અન્ય પામે;
 પથિક જે નગરનો માર્ગ લઈ સંચરે,
 ત્યાં જ પહોંચે, નહીં અન્ય ગ્રામે.
 શુદ્ધ ચિદ્દૂપની પ્રાપ્તિ દુર્ગમ આહા !
 મોહવશ પ્રાણીને સુગમ કચાંથી ?
 મોહના વિજયથી, વિષા ક્રિયાકાંડ પણ,
 પ્રાપ્તિ તેની અતિ સુગમતાથી. ૨૨-૨૩.

અર્થ :—મનુષ્ય તેનું સ્મરણ કરતાં તેને પામે છે અને અન્યનું સ્મરણ કરતાં કેવળ અન્યને પામે છે; જેમ વટેમાર્ગુ જે નગરના માર્ગ જાય છે, તે જ નગરમાં તે પહોંચે છે. ૨૨.

પ્રાણીઓને મોહથી શુદ્ધ આત્મસ્વરૂપની યથાર્થ પ્રાપ્તિ મુશ્કેલ છે અને તેનો (મોહનો) જય કરવાથી (અન્ય) ક્રિયાકાંડ કર્યા વગર પણ (તેની પ્રાપ્તિ) અત્યંત સુગમ છે. ૨૩.



આધ્યાત્મ પ મો

[શુદ્ધ ચિદૂપની પ્રાપ્તિ કદી પૂર્વે કોઈ વાર થઈ નથી]

રત્નાનામૌષધીનાં વસનરસરુજામન્નધાતૃપલાનાં
 સ્ત્રીભાશ્વાનાં નરાણાં જલચરવયસાં ગોમહિષ્યાદિકાનાં ।
 નામોત્પત્ત્યર્થતાર્થાન् વિશદમતિતયા જ્ઞાતવાન् પ્રાયશોડહં
 શુદ્ધચિદૂપમાત્રાં કથમહહ નિજ નૈવ પૂર્વ કદાચિત् ॥૧॥

(જ્રલાણા)

રત્ન ઓપદિ બહુ વસ્ત્ર રસ વ્યાધિઓ,
 અન્ન પથ્થર અને ધાતુઓનાં;
 પુરુષ સ્ત્રી અશ્વ ગાજ પક્ષી જલયર તથા,
 ગાય બેંસાદિ પર વસ્તુઓનાં;
 નામ, ઉત્પત્તિ, કિંમત, પ્રયોજન બધું,
 તીક્ષણ બુદ્ધિ કરી બહુય જાણ્યું;
 કિંતુ નિઃ શુદ્ધ ચિદૂપને મેં અહો !
 પૂર્વ કાલે કદી ના પિણાણ્યું ! ૧.

આર્થ :—રત્નાનાં, ઔષધોનાં, વસ્ત્ર, રસ, રોગનાં, અન્ન, ધાતુ, પથ્થરોનાં, ખી, હાથી ને અશ્વોનાં, મનુષ્યોનાં, જલયર અને નભયર (પક્ષીઓ)નાં, ગાય, બેંસ આદિનાં નામ, ઉત્પત્તિ, મૂલ્ય, પ્રયોજન તીક્ષણ બુદ્ધિ વડે કરી મેં ધણું કરીને જાણ્યા છે. અહો ! ખેદ છે કે કોઈ રીતે માત્ર પોતાના શુદ્ધ ચિદૂપને પૂર્વે કદી પણ જાણ્યું નથી ? ૧.

પૂર્વ મયા કૃતાન્યેવ ચિંતનાન્યપ્રનેકશઃ ।
 ન કદાચિમહામોહાત્ શુદ્ધચિદૂપચિંતનં ॥૨॥

અનંતાનિ કૃતાન્યેવ મરણાનિ મયાપિ ન।
કુત્રચિન્મરणે શુદ્ધચિદૂપોऽહમિતિ સ્મર્તં ॥૩॥

અન્ય પણ બહુ બહુવિદ્ય ચિંતન કર્યા,
પૂર્વમાં આત્મહિત શ્રેણી કાપી;
શુદ્ધ ચિદૂપનું પણ ન ચિંતન કર્યુ,
મેં મહામોહવશ થઈ કદાપિ;
મરણ પણ પૂર્વમાં મેં અનંતાં કર્યા,
સ્વરૂપને ભૂલી પરને હું માની;
એક પણ મરણ કાળે સ્મરણના કર્યુ,
શુદ્ધ ચિદૂપ હું એમ જાણી. ૨-૩.

આર્થિક :—પૂર્વ મેં અનેક વાર ચિંતન પણ કર્યા છે, પરંતુ મહામોહથી શુદ્ધ આત્માનું ચિંતન કદાપિ થયું નથી. ૨.

અનંતવાર મરણ પણ મેં કર્યા છે, પરંતુ કોઈ પણ મરણ વખતે મેં ‘હું શુદ્ધ ચિદૂપ છું’ એમ સ્મરણ કર્યું નથી. ૩.

સુરદુમા નિધાનાનિ ચિંતારલં દ્યુસદ્ગવી।
લબ્ધા ચ ન પરં પૂર્વ શુદ્ધચિદૂપસંપદા ॥૪॥

દ્રવ્યાદિપંચથા પૂર્વ પરાવર્તા અનંતશઃ ।
કૃતાસ્તેષેકશો ન સ્વં સ્વરૂપં લબ્ધવાનહં ॥૫॥

કલ્પતરુ કામધેનુ, નિધાનો વળી,
રન્યચિંતામણિ દિવ્ય વિભૂતિ;
મેં લછી પૂર્વમાં, શુદ્ધ ચિદૂપ રૂપ,
અનુપ સંપત્તિની કદી ન પ્રાપ્તિ;
દ્રવ્ય આદિ પરાવર્તનો પંચ તે,
મેં અનંતાં કર્યા પૂર્વકણો;

તે વિષે એક પણ વાર નિજ સ્વરૂપને,
હું ન પામ્યો ભાગ્યો બ્રાહ્મિત્જાળો. ૪-૫.

આર્થ:—(મને) પૂર્વે કલ્પવૃક્ષ, ધનના ભંડાર, ચિંતામણિ રત્ન, કામધેનુ વગેરે મળ્યા, પરંતુ શુદ્ધચિદ્રૂપ સંપત્તિ મળી નથી. ૪.

(મેં) પૂર્વે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ નામના પાંચ પરાવર્તન (સંસાર ભમણ) અનંતવાર કર્યા છે, તેમાં એકવાર પણ મને મારું સ્વરૂપ મળ્યું નથી. ૫.

ઇન્દ્રાદીનાં પદં લબ્ધં પૂર્વ વિદ્યાધરેશિનાં।
અનંતશોહમિદ્રસ્ય સ્વસ્વરૂપં ન કેવલં ॥૬॥

મધ્યે ચતુર્ગતીનાં ચ બહુશો રિપવો જિતાઃ ।
પૂર્વ ન મોહપ્રત્યર્થી સ્વસ્વરૂપોપલબ્ધયે ॥૭॥

મેં અનંતી અહો ! વાર વળી પૂર્વમાં,
ઈન્દ્ર, વિદ્યાધર સ્વામી ધાર્યો;
તેમ અહમિન્દ્રનાં પદ મહા ભોગાવ્યાં,
માત્ર સ્વસ્વરૂપને કદી ન પામ્યો,
ચાર ગતિ ભ્રમણમાં બહુ બહુ શાશ્વતો,
બહુ બહુ વાર જીત્યા તથાપિ;
શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિમાં વિદ્યનરૂપ,
મોહ શાશ્વત ન જીત્યો કદાપિ. ૬-૭.

આર્થ:—(મને) પૂર્વે ઈન્દ્રાદિનાં, અનંતવાર વિદ્યાધરોના અધિપતિનાં (અને) અહમિન્દ્રનું પદ પણ મળ્યું (છે) માત્ર સ્વસ્વરૂપ મળ્યું નથી. પૂર્વે ચારગતિમાં (મેં) અનેકવાર શત્રુઓને જીત્યા (પણ) સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે (બાધારૂપ એવા) મોહ શત્રુને જીત્યો નથી. ૬-૭

મયા નિઃશેષશાસ્ત્રાણિ વ્યાકૃતાનિ શ્રુતાનિ ચ ।
તેભ્યો ન શુદ્ધચિદ્રૂપં સ્વીકૃતં તીવ્રપોહિના ॥૮॥

વૃદ્ધસેવા કૃતા વિદ્વન્મહતાં સદસિ સ્થિતઃ ।
ન લબ્ધં શુદ્ધચિદ્રૂપં તત્ત્રાપિ ભ્રમતો નિજં ॥૯॥

સર્વ શાસ્ત્રો ભણ્યો, શ્રવણ અતિ અતિ કર્યુઃ;
બોધ પણ અન્યાને ખૂબ દીઘો;
તીવ્ર મોહે છતાં તે મહીંથી નહીં,
શુદ્ધ ચિદ્રૂપ નિજ ગ્રહણ કીધો.
વૃદ્ધસેવા કરી, સાધુસંગે ફર્યો,
જાની પાસે સભામધ્ય બેઠો;
તે છતાં ત્યાંથી પણ શુદ્ધ ચિદ્રૂપને,
ના લહું, ભ્રમ અનાદિ ન નાઠો. ૮-૯.

અર્થ :—મેં સંસારમાં સર્વ શાસ્ત્રો સાંભળ્યા અને તેમના વિષે વ્યાખ્યાન કર્યા, પરંતુ તીવ્ર મોહી એવા મેં તે શાસ્ત્રોમાંથી શુદ્ધ ચિદ્રૂપનું ગ્રહણ કર્યું નહિ. ૮. *મેદાનં ૯.*

(મે) વૃદ્ધોની સેવા કરી, (હું) વિદ્વાન, મહાત્માઓની સભામાં બેઠો, (છતાં) ત્યાં ભમીને પણ મેં પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી નહિ. ૯.

માનુષય બહુશો લબ્ધમાર્યે ખંડે ચ સત્કુલં ।
આદિસંહનનં શુદ્ધચિદ્રૂપં ન કદાચન ॥૧૦॥

શૌચસંયમશીલાનિ દુર્ધરાણિ તપાંસિ ચ ।
શુદ્ધચિદ્રૂપસદ્ધ્યાનમંતરા ધૃતવાનહં ॥૧૧॥

આર્થિંડે બહુ વાર નર ભવ લહો,
જન્મ ઉતામ કુલે પણ હું પામ્યો;

પ્રથમ સંહનન પણ વાર બહુ મેં લખું,
શુદ્ધ ચિદ્રૂપ ના કદીય પામ્યો.
શૌચ સંયમ તથા શીલ તપ આદર્યા,
સર્વ દુર્ઘર વ્રતો પણ ધર્યા મેં;
એક નિજ શુદ્ધ ચિદ્રૂપના ધ્યાન વિષણ,
સર્વ સાધન નિરર્થક કર્યા મેં. ૧૦-૧૧.

અર્થ :—આર્થિકશમાં મનુષ્યપણું, વર્જર્ભભનારાચસંહનન, ઉત્તમ ફળ. એ બધુ મને અનેકવાર મળ્યું છે, પરંતુ શુદ્ધ ચિદ્રૂપ કદી મળ્યું નથી. ૧૦.

શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાન વિનાના શૌચ, શીલ, સંયમ તથા દુર્ઘર તપ મેં ધારણ કર્યા છે. ૧૧.

એકેન્દ્રિયાદિજીવેષુ પર્યાયઃ સકલા ધૃતાઃ ।
અજાનતા સ્વચિદ્રૂપં પરસ્પરાદિજાનતા ॥૧૨॥
જાતં દૃષ્ટં મયા સર્વ સચેતનમચેતનં ।
સ્વકીયં શુદ્ધચિદ્રૂપં ન કદાચિચ્ચ કેવલં ॥૧૩॥

સર્વ એકેન્દ્રિયાદિ વિષે બહુ ભમ્યો,
બહુ ધર્યા સર્વ પર્યાય ત્યાં મેં;
સ્પર્શ રસ આદિ પરના બહુ જાણતાં,
નિજ ચિદ્રૂપ જાણ્યું ન ત્યાં મેં.
અન્ય ચેતન અચેતન પદાર્થો વળી,
સર્વ જાણ્યા દીકા બાહ્યાદિઃ;
માત્ર નિજ શુદ્ધ ચિદ્રૂપને જાણવા,
દેખવા ના ખુલી આત્મદાટિ. ૧૨-૧૩.

અર્થ :—પોતાના આત્મસ્વરૂપને જાણ્યા વિના અને પરના સ્પર્શ,
રસ, રૂપ આદિને જાણતાં મેં એકેન્દ્રિયાદિમાં સર્વ અવસ્થાઓ ધારણ કરી
છે. ૧૨.

મેં બધા ચેતન, અચેતન (પદાર્�ો)ને જોયા અને જાણ્યા; ફક્ત પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને કદી જાણ્યું નથી. ૧૩.

લોકજ્ઞાતિ શ્રુતસુરનૃપતિ શ્રેયસાં ભામિનીનાં
યત્યાદીનાં વ્યવહૃતમખિલાં જ્ઞાતવાન् પ્રાયશોર્ડહં।
ક્ષેત્રાદીનામશકલોજગતો વા સ્વભાવં ચ શુદ્ધ-
ચિદ્ભૂપોર્ડહં ધ્રુવમિતિ ન કદા સંસ્કૃતૌ તીવ્રમોહાત્ ||૧૪||

લોક જ્ઞાતિ તથા શાસ્ત્ર સુર વૃપતાણિ,
નીતિરીતિ જાણી મેં સર્વ પ્રાયે;
સ્ત્રી, મુનિ આદિના અખિલ વ્યવહારને,
તેમ મેં જાણ્યો મુખ્યતાયે;
ક્ષેત્ર નદી આદિ સૌ જગત સંપૂર્ણના,
જાણવા ભાવ હું બહુ ચ શાણો;
તીવ્ર મોહે છતાં ભવ વિષે હા કદી,
શુદ્ધ ચિદ્ભૂપ હું ધ્રુવ ન જાણ્યો. ૧૪.

આર્થ :—સંસારમાં લોક, જ્ઞાતિ, શાસ્ત્ર, દેવ રાજી આદિની સંપત્તિ, શ્રેય (કલ્યાણ), જી અને મુનિઓના સમસ્ત વ્યવહારોનું અથવા દેશ, નગર, નદી, પર્વત આદિના ભાગોનું, જગતમાં સ્વભાવનું મેં ઘણ્યું કરીને જ્ઞાન કર્યું, (મેળવ્યું) પરંતુ તીવ્ર મોહને લીધે ‘હું ચેતનસ્વરૂપ આત્મા છું’ એમ ખરેખર કદી જાણ્યું નહિ. ૧૪.

શીતકાલે નદીતીરે વર્ષાકાલે તરોરથઃ ।
ગ્રીષ્મે નગશિરોદેશે સ્થિતો ન સ્વે ચિદાત્મનિ ॥૧૫॥

વિહિતો વિવિધોપાયૈ: કાયકલેશો મહત્તમઃ ।
સ્વર્ગાદિકાંક્ષયા શુદ્ધં સ્વસ્વરૂપમજાનતા ॥૧૬॥
અધીતાનિ ચ શાસ્ત્રાણિ બહુવારમનેકશઃ ।
મોહતો ન કદા શુદ્ધચિદ્ભૂપપ્રતિપાદકં ॥૧૭॥

(શિખરિણી)

શિયાળામાં લિભો સરિતાતટમાં શીત સહતો,
વળી વર્ષકાળે તરુવરતળે સ્થિતિ ઘરતો;
ઉનાળે અદ્રિના શિખર પર તાપે તપ તાયો,
શિદાત્મામાં કિંતુ નિજ સ્થિતિ કરી હું ન વિરમ્યો. ૧૫.

તણુ કલેશો, ઈચ્છા સુરસુખ, તાયો ઘોર તપ હું,
ન જાણ્યું, શુદ્ધાત્મસ્વરૂપ સુખ તો તે કચમ ચહું ?
ઘણી રીતે શાસ્ત્રો, ફરી ફરી ઘણાં હું ભણી ગયો,
છતાં શાસ્ત્રો બોધે સ્વરૂપ તે મોહે નહિ ગણ્યો. ૧૬-૧૭.

આર્થ :—શિયાળામાં હું નદીના કિનારા ઉપર, વર્ષા ઋતુમાં
વૃક્ષની નીચે, ઉનાળામાં પર્વતના શિખર પ્રદેશમાં રહ્યો; પરંતુ પોતાના
ચૈતન્યસ્વરૂપ આત્મામાં રહ્યો નહિ. ૧૫.

મેં શુદ્ધ સ્વરૂપને ન જાણતાં, સ્વર્ગાદિની ઈચ્છાથી વિવિધ
ઉપાયો દ્વારા મહાન કાયકલેશ કર્યો. ૧૬.

તથા ઘણી વાર અનેક પ્રકારે શાસ્ત્રો ભાણ્યા, પરંતુ મોહવશ થઈને
શુદ્ધ આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર શાસ્ત્ર કદી ભાણ્યો નહિ. ૧૭.

ન ગુરુ: શુદ્ધચિદૂપસ્વરૂપપ્રતિપાદક: ।
લબ્ધો મન્યે કદાચિત વિનાડસૌ લભ્યતે કથં ॥૧૬॥

સચેતને શુભે દ્રવ્યે કૃતા પ્રીતિરચેતને ।
સ્વકીયે શુદ્ધચિદૂપે ન પૂર્વ મોહિના મયા ॥૧૭॥

ગુરુ જ્ઞાની શુદ્ધ સ્વરૂપ નિજ બોધે પ્રવીણ જે,
મળ્યા નો તો કચાંથી સ્વરૂપ નિજ પામું હું વિષા તે ?
કરી પ્રીતિ સારા જીવ અજીવ દ્રવ્યે પર છતાં,
કરી ના મોહે મેં, વિમલ નિજ રૂપે ઠરી જતાં. ૧૮-૧૯.

આર્થ :—મને લાગે છે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનું નિરૂપણ કરનાર સદ્ગુરુ (મને) કદી મળ્યા નથી. તે સદ્ગુરુ વિના આ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ કેમ કરીને થાય? ૧૮.

મનને પ્રિય એવા સચેતન, અચેતન પદાર્�ોમાં મોહી એવા મેં પૂર્વે પ્રીતિ કરી પણ આત્માને પ્રિય એવા શુદ્ધ ચિદ્રૂપમાં પ્રીતિ કરી નહિ. ૧૯.

દુષ્કરાણ્યપિ કાર્યાણિ હા શુભાન્યશુભાનિ ચ ।
બહૂનિ વિહિતાનીહ નैવ શુદ્ધાત્મચિંતનં ॥૨૦॥

પૂર્વ યા વિહિતા ક્રિયા કિલ મહામોહોદયેનાખિલ
મૂઢલ્યેન મયેહ તત્ત્ર મહર્ત્ત્મ પ્રીતિં સમાતન્વતા ।
ચિદ્રૂપાભિરતસ્ય ભાતિ વિષવત् સા મંદમોહસ્ય મે
સર્વસ્મિન્નધૃના નિરીહમનસોऽતોધિગ् વિમોહોદયં ॥૨૧॥

વ્યક્તાવ્યક્તવિકલ્પાનાં વૃદ્ધૈરાપૂરિતો ભૃણં ।
લબ્ધસ્તેનાવકાશો ન શુદ્ધચિદ્રૂપ ચિંતને ॥૨૨॥

ઘણાં એવાં કીધાં શુભ અશુભ કાર્યો કહિન હા !
છતાં શુદ્ધાત્માનું કદી નહિ કર્યું ચિંતન મહા.
ક્રિયા પૂર્વે જે જે સકલ કરી મેં મોહ ઉદ્યે,
રતિ વિસ્તારી ત્યાં અતિશાય મહા મૂઢ મતિયે;
છે ભાસે તે સૌ વિષ સમ મને મોહ વિઘરયે,
સ્વરૂપે લાગ્યો હું નિરીહ પરમાં, મોહ ધિક્ક ઐ.
મને વ્યક્તાવ્યક્ત પ્રતિપદ વિકલ્પે પૂરણે,
મળી ના નિવૃત્તિ નિજ વિમલ ચિદ્રૂપ મનને. ૨૦-૨૧-૨૨.

આર્થ :—અહા! મેં અહીં અનેક શુભ અને અશુભ દુષ્કર કાર્યો કર્યા છે, પણ શુદ્ધ આત્માનું ચિંતન નથી જ કર્યું. ૨૦.

પૂર્વ મહા મોહના ઉદ્યે મૂઢતાથી તેમાં અત્યંત પ્રીતિ કરનાર એવા મેં જે કિયા અહીં ખરેખર કરી છે, તે બધી કિયા મોહ જેનો મંદ થયો છે અને ચિદૂપમાં રતિ થઈ છે એવા મને સર્વમાં નિસ્પૃહબુદ્ધિથી થવાથી હવે ઝેર જેવી લાગે છે, તેથી અત્યંત મોહના ઉદ્યને ધિક્કાર છે. ૨૧.

હું વ્યક્ત અને અવ્યક્ત વિકલ્પોના સમૂહથી અત્યંત ભરેલો છું, તેથી મને શુદ્ધ ચિદૂપના ચિંતવનમાં અવકાશ મળ્યો નથી. ૨૨.



અધ્યાય ૬ હો

[શુદ્ધ ચિદ્રૂપનાં સ્મરણમાં નિશ્ચળતાનો બોધ]

જાનંતિ ગ્રહિલં હતં ગ્રહગણૈર્ગ્રસ્તં પિશાચૈરૂજા
મગં ભૂરિ પરીષહૈર્વિકલતાં નીતં જરાચેષ્ટિતં।
મૃત્યાસન્નતયા ગતં વિકૃતિતાં ચેદ્ ભ્રાંતિમંતં પરે
ચિદ્રૂપોહમિતિ સ્મૃતિપ્રવચનં જાનંતુ મામંગિનઃ ॥૧॥

ચિદ્રૂપ ચિંતન તત્પર મુજને દુર્ભગ ભ્રમિત ભલે જન કહે,
કે ઉન્મતા, પિશાચે પીડિત, વ્યાધિગ્રસ્ત વિપરીત ગ્રહે;
મંદ પ્રબળ પરિષહથી વિકૃત જરા મરણ સન્મુખ ગણે,
ચિદ્રૂપ હું એ સ્મૃતિ વચનરૂપ, રે ! જન જાણો તથ્યપણે. ૧.

આર્થ :—જો અન્ય પ્રાણીઓ મને ગ્રહો વડે ગ્રહાયેલો, હૃષાયેલો,
ભૂત પિશાચ વડે પકડાયેલો, રોગથી પીડિત, અત્યંત પરિષહોથી વિકલ
થયેલો અને વૃદ્ધાવસ્થા પામેલો, મૃત્યુની નજીદીક પહોંચેલો, વિકૃત
અવસ્થા પામેલો, ભ્રાંતિવાળો માને છે તો તમે એમ સમજો કે હું તો
ચૈતન્યસ્વરૂપ છું—એ સ્મરણમાં રાખવા યોગ્ય ઉત્તમ પ્રવચનરૂપ-શુદ્ધ
ચિદ્રૂપ છું. ૧.

ઉન્મતં ભ્રાંતિયુક્તં ગતનયનયુગં દિગ્વિમૂઢં ચ સુસ્તં
નિશ્ચિતં પ્રામમૂર્ચ્છ જલવહનગતં બાલકાવસ્થમેતત્ ।
સ્વસ્યાધીનં કૃતં વા ગ્રહિલગતિગતં વ્યાકુલં મોહધૂર્તૈઃ
સર્વ શુદ્ધાત્મદૂર્ભીરહિતમપિ જગદ્ ભાતિ ભેદજ્ઞચિત્તે ॥૨॥

શુદ્ધ આત્મદર્શન હીન જગ આ ભેદ જ્ઞાનીને ચિત દીસે,
છા ! ઉન્મતા ભ્રમિત નેગહીએ દિગ્મૂઢ ગાઠ સુષુપ્તિ વિષે;

પાગાલ મૂછાંગાત અવિચારી, જલપ્રવાહમાં વહી જતું,
આડા બાલસમ મોહ ઠગોને વશ વ્યાકુલ વિશેષ થતું. ૨.

આર્થ:—શુદ્ધ આત્મદર્શનથી રહિત, આ સર્વ જગત્ પણ
ભેદજ્ઞાનીના ચિત્તમાં ઉન્મત, ભાંતિયુક્ત, બન્ને નેત્રરહિત, દિશા ભૂલેલું,
ગાઢ નિદ્રામાં સૂંઠેલું, અવિચારી, મૂચ્છા પામેલું, જળના પ્રવાહમાં તણાતું,
બાળકના જેવી અજ્ઞાન અવસ્થાવાળું અથવા મોહરૂપી ઠગોથી પીડિત દશા
પામેલું હોય તેવું અને મોહ ઠગો પોતાને આધીન કરેલું, વ્યાકુળ થયેલું
જ્ઞાય છે. ૨.

સ્ત્રીણાં ભર્તા બલાનાં હરય ઇવ ધરા ભૂપતીનાં સ્વવત્ત્સો
ધેનૂનાં ચક્રવાક્યા દિનપતિરતુલશ્વાતકાનાં ઘનાર્ણઃ ।
કાસારાદ્યબ્ધરાણામમૃતમિવ નૃણાં વા નિજૌક: સુરાણાં
વૈદ્યો રોગાતુરાણાં પ્રિય ઇવ હવિ મે શુદ્ધચિદ્રૂપનામા ॥૩॥

શ્રીના ચિત્ત વિષે પ્રિય ભર્તા, બલભદ્રોને પ્રાણ હરિ,
ભૂપને ભૂમિ, વત્સ ધેનુને, ચક્રવાકને તિમિરારિ;
ચાતકને જલધર, દેવોને સ્વર્ગ, જનોને પ્રિય સુધા,
પ્રિય વિમલ ચિદ્રૂપ મુજ ચિત્તે, રોગાતુરને વૈદ્ય ચથા. ૩.

આર્થ:—શ્રીઓના ચિત્તને જેમ પતિ, બળભદ્રોને વાસુદેવ,
રાજાઓને પૃથ્વી, ગાયોને પોતાના વાછરડાં, ચક્રવાકીને સૂર્ય, ચાતકોને
મેધનું પાણી, જળચરોને તળાવ આદિ, મનુષ્યોને અમૃત અથવા દેવોને
સ્વર્ગ, રોગથી પીડાયેલાઓને વૈદ્ય અનુપમ પ્રિય હોય છે; તેમ મારા
હદ્યમાં શુદ્ધચિદ્રૂપ જેનું નામ છે એવો આત્મા અત્યંત પ્રિય છે. ૩.

શાપં વા કલયંતિ વસ્તુહરણં ચૂર્ણ કદ્ધં તાડનં
છેદં ભેદગદાદિહાસ્યદહનં નિદાઽપદાપીડનં ।
પવ્યાન્યબ્ધ્યગપંકકૂપવનભૂક્ષેપાપમાનં ભયં
કેચિચ્છેત् કલયંતુ શુદ્ધપરમબ્રહ્મસ્પૃતાવન્વહં ॥૪॥

પરમ બ્રહ્મ ચિંતન તલ્લીન હું મને કોઈ ભય શાપ દીએ,
વસ્તુહરણ, ચૂરણ, વધ, ટાડન, છેદ, બેદ, બહુ દુઃખ દીએ;
ગિરિ અનિન અનિદ્ય નવ ફૂપે ફેંકે વજો હણે ભલે,
ભલે હાસ્ય નિંદાદિ કરો, પણ અલ્ઘયિત મુજ નહિ મળે. ૪.

અર્થ :— શુદ્ધ પરમાત્માની સ્મૃતિમાં સર્વદા લીન એવા મને જો કોઈ શાપ આપે અથવા વસ્તુઓનું હરણ કરે, ચૂરચૂર કરે, વધ કરે, તાડન કરે, છેટ, ભેટ, ગાઢાદિથી મારે, બાળે, મશકરી કરે, નિંદે, પીડે, વજ મારા ઉપર ફેંકે, અગ્નિમાં, સમુદ્રમાં, પર્વત કે વૃક્ષ ઉપરથી નીચે ફેંકે, કાદવમાં, ફુવામાં, વનમાં કે ભૂમિ ઉપર ફેંકે, અપમાનિત કરે કે ભય ઉપજાવે તો ભલે તેમ કરો. ૪.

सुरनदीधारौधसंपातव-
चंद्राक्खमवत्सदा ल्लोकेस्मिन् व्यवहारकालगतिवद् द्रव्यस्य पर्यायवत् ।
लोकाधस्तलवातसंगमनवत् पदमादिकोद्भूतिवत्
चिद्गुपस्मरणं निरंतरमहो भूयाच्छिवास्यैमम् ॥५॥

ચંદ્ર સૂર્ય ગતિ જેમ નિરંતર, સુર નાઈવહન સદાય યથા,
પલ પલ કાલ ગતિ સમ લોકે, દ્રવ્ય વિષે પર્યાય સદા;
લોક નીએ ઘન આદિ પવનવત્ત જલમાં કમલોત્પત્તિ યથા,
ચિદ્ભૂપસ્મરણ નિરંતર ચિત્રે શિવદાયી મુજ બનો તથા. ૫.

અર્થ :—આ લોકમાં સદાય સૂર્ય ચંદ્રના ભમણની પેઠે, ગંગાનદીના પ્રવાહના વહનની માફક, વ્યવહારકાળની ગતિની પેઠે, દ્રવ્યની પર્યાયની જેમ, લોકની નીચે ધનવાત, તનવાત વગેરે પવનોના નિરંતર ગમનની માફક, (સરોવરોમાં) કમળ આદિની નિરંતર ઉત્પત્તિ થયા કરે છે તેમ અહો, મારા મનમાં પણ નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ થયા કરો કે જેથી મને મોક્ષાપ પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય. ૫.

इति हृत्कमले शुद्धचिद्रूपेऽहं हि तिष्ठतु।
द्रव्यतो भावतस्तावद् यावदंगे स्थितिर्मम ॥६॥

દૃશ્યંતેઽતીવ નિઃસારા: ક્રિયા વાગંગચેતસાં ।

કૃતકૃત્યત્વતઃ શુદ્ધચિદ્રૂપં ભજતા સતા ॥૭॥

દ્રવ્યભાવથી તન કારાગૃહ વિષે સ્થિતિ છે ત્યાં સુધી તો,
‘હું સહજાત્મરવરૂપ’ સ્મરણ એ હૃદયકમલમાં નિત્ય રહે;
તન મન વચ્ચાનાણી સૌ યોષા દીસે અતીવ અસાર આહા !
શુદ્ધ ચિદાત્મરવરૂપને ભજતાં, સાર ગ્રહો, હું કૃતાર્થ મહા. ૬-૭

આર્થ :—જ્યાં સુધી મારી દ્રવ્યથી અને ભાવથી શરીરમાં સ્થિતિ છે, ત્યાં સુધી ‘શુદ્ધ ચિદ્રૂપ હું છું’ એ સ્મરણ મારા હૃદયકમળમાં નિશ્ચયે રહો. ૬.

શુદ્ધ ચિદ્રૂપને ભજતાં થકાં કૃતકૃત્યતા પ્રાપ્ત થવાથી વચ્ચાન, શરીર
અને મનની ક્રિયાઓ અત્યંત અસાર જગ્યાય છે. ૭.

કિંचિત્કદોત્તમં ક્વાપિ ન યતો નિયમાન્ત્રમઃ ।

તસ્માદનંતશઃ શુદ્ધચિદ્રૂપાય પ્રતિક્ષણં ॥૮॥

બાહ્યાંત: સંગમં નૃસુરપતિપદં કર્મબંધાદિભાવં
વિદ્યાવિજ્ઞાનશોભાબલભવખસુખં કીર્તિરૂપપ્રતાપં ।
રાજ્યાગાખ્યાગકાલાસ્વવકુપરિજનં વાગ્મનોયાનધીદ્વા-
તીર્થેશાલં હૃનિત્યં સ્મર પરમચલં શુદ્ધચિદ્રૂપમેકં ॥૯॥

બાહ્યાખ્યાંતર સંગ ક્ષણિક સૌ, શરીર, નરેન્દ્ર, સુરેન્દ્ર પદો,
કર્મભાવ, વિદ્યા, બળ, શોભા, જન્મ, રૂપ, યશ, વિષય સુખો;
રાજ્યપાટ વિજ્ઞાન પ્રતાપો ગિરિ તરુ નામ ધરા સ્વજનો,
આસ્ત્રવ, કાળ, વચ્ચાન મન વાહન બુદ્ધિ નશર સર્વ ગણો.
કાંતિ દીપિત તીર્થપતિપદ પણ નહિ નિત્ય અહો ! જગમાં,
ચિદ્રૂપ શુદ્ધ સદા સર્વોત્તમ અચાલિત તેથી ધરું ઉરમાં;
કિંચિત્ કચાંય કદી નહિ નિશ્ચે ચિદ્રૂપથી જગ પ્રવર અહો !
તેથી અનંત પ્રણામ સદા મુજ તે ચિદ્રૂપને ક્ષણા ક્ષણ હો. ૮-૯.

આર્થ :—જે કારણથી, નિશ્ચયથી, ક્યાંય પણ ક્યારેય, કંઈ પણ (બીજું) ઉત્તમ નથી, તે કારણે, શુદ્ધચિદ્રૂપને ક્ષણે ક્ષણે અનંતવાર નમસ્કાર હો. ૮.

બાધ અને અંતરંગ પરિગ્રહ, શરીર, નરેન્દ્ર અને સુરેન્દ્રનાં પદ, કર્મબંધ આદિ ભાવ, વિદ્યા, વિજ્ઞાન-કળા કૌશલ્યા, શોભા, બળ, જન્મ, ઈન્દ્રિયોનાં સુખ, કીર્તિ, રૂપ, પ્રતાપ, રાજ્ય, પર્વત, નામ, વૃક્ષ, કાળ, આસ્વા, પૃથ્વી, પરિવાર, વાણી, મન, વાહન, બુદ્ધિ, દીપિ, તીર્થકરપણું નિશ્ચયથી અનિત્ય છે, (તેથી) પરમ અચલ એવા એક શુદ્ધચિદ્રૂપનું સ્મરણ કર. ૮.

રાગાદ્યા ન વિધાતવ્યા: સત્યસત્યપિ વસ્તુનિ ।

જ્ઞાત્વા સ્વશુદ્ધચિદ્રૂપં તત્ત્વ તિષ્ઠ નિરાકુલઃ ॥૧૦॥

સર્વ શુભાશુભ વસ્તુ પ્રતિ કદી, ન કરો રાગાદિ ભાવ,
જાણી નિર્મલ નિજ ચિદ્રૂપ ત્યાં, સિથર નિરાકુળ થાય;

નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૦.

આર્થ :—સારા કે ખોટા અથવા વર્તમાન, તેમજ ભૂત-ભવિષ્યના પદાર્થોમાં પણ રાગ-દેષ આદિ કર્તવ્ય નથી. પોતાના શુદ્ધ ચૈતનસ્વરૂપ આત્માને જાણીને ત્યાં નિરાકુળ સુખસ્વરૂપે સિથર થા. ૧૦.

ચિદ્રૂપોऽહં સ મે તસ્માતં પશ્યામિ સુખી તતઃ ।

ભવાક્ષતિહિતં મુક્તિર્નિર્યાસોऽહં જિનાગમે ॥૧૧॥

ચિદ્રૂપ હું તે મારું તેથી તે, જોઉં તો સુખ થાય;

ભવ ક્ષય મુક્તિ શ્રેય પમાય, તે સાર જિનાગમાંય.

નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૧.

આર્થ :—હું ચૈતન્યસ્વરૂપ છું, તે (આત્મા) મારો છે, માટે હું તેને જોઉં છું એટલે સુખી છું. આ ભવનો ક્ષય, આત્મહિત, મોક્ષ છે, એ જિનાગમનું રહસ્ય-સાર છે. ૧૧.

ચિદ્રૂપે કેવલે શુદ્ધે નિત્યાનંદમયે યદા ।

સ્વે તિષ્ઠતિ તદા સ્વસ્થં કથ્યતે પરમાર્થતः ॥૧૨॥

ચિદ્રૂપ કેવલ શુદ્ધસ્વરૂપ એ નિત્યાનંદે પ્રપૂર્ણ,
તે નિજ સ્વરૂપે રે સ્થિર તો નિશ્ચયે, સ્વસ્થ કહ્યો સંપૂર્ણ.
નિર્મલ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૨.

આર્થ :—જ્યારે આત્મા નિત્યાનંદમય કેવળ પોતાના શુદ્ધચિદ્રૂપમાં
સ્થિર થાય છે, ત્યારે પરમાર્થથી સ્વસ્થપણે સમાધિરૂપ કહેવાય છે. ૧૨.

નિશ્ચલ: પરિણામોऽસ્તુ સ્વશુદ્ધચિત્ત મામક: ।

શરીરમોચનં યાવદિવ ભૂમૌ સુરાચલ: ॥૧૩॥

નિર્મલ નિજ ચિદ્રૂપ વિષે રહો, નિશ્ચલ મુજ પરિણામ;
દેહ જતાં પણ એ ન ચાળો કદા, મેરુ ચાલે નહિ નામ.

નિર્મલ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૩.

આર્થ :—જ્યાં સુધી શરીર ધૂટયું નથી, ત્યાં સુધી પૃથ્વી ઉપર
મેરુ પર્વતની જેમ, સ્વ શુદ્ધ આત્મામાં મારા પરિણામ નિશ્ચલ રહો. ૧૩.

સદા પરિણતિમોઽસ્તુ શુદ્ધચિદ્રૂપકેઽચલા ।

અષ્ટમીભૂમિકામદ્યે શુભા સિદ્ધશિલા યથા ॥૧૪॥

નિર્મલ નિજ ચિદ્રૂપ વિષે સદા, મુજ પરિણાતિ હો અકંપ;
જેમ વિરાસે રે આષ્ટમી ભૂમિમાં, સિદ્ધશિલા નિષ્કંપ.

નિર્મલ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૪.

આર્થ :—જેમ આઠમી ભૂમિ (પૃથ્વી)ના અગ્રભાગે મોક્ષસ્થાનમાં
પવિત્ર સિદ્ધશિલા નિશ્ચળ છે, તેમ શુદ્ધ ચિદ્રૂપમાં મારા ભાવ સદા નિશ્ચળ
રહો. ૧૪.

ચલંતિ સન્મુનીન્દ્રાણાં નિર્મલાનિ મનાંસિ ન ।

શુદ્ધચિદ્રૂપસદ્ધ્યાનાત્ સિદ્ધક્ષેત્રાચ્છિવા યથા ॥૧૫॥

નિર્મળ ચિદ્રૂપ ધ્યાન થકી કદી સંત મુનિવર્ય ચિત;
લેશ ચલે ના સિદ્ધિકોપત્રી સિદ્ધો જ્યમ ત્યાં સુસ્થિત.

નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૫.

આર્થ :—જેમ સિદ્ધક્ષેત્રથી સિદ્ધો ચળતા નથી તેમ શુદ્ધ આત્માના ઉત્તમ ધ્યાનથી, મુનીન્દ્રોનાં નિર્મળ મન ચળતાં નથી. ૧૫.

મુનીશ્વરૈસ્તથાભ્યાસો દૃઢઃ સમ્યગ્વિધીયતે।

માનસં શુદ્ધચિદ્રૂપે યથાઽત્યંતं સ્થિરીભવેત् ॥૧૬॥

શુદ્ધ સ્વરૂપે રે નિશ્ચલ ધ્યાનનો, સમ્યગ્ દંડ અભ્યાસ;

સેવો એવો રે જ્ઞાની મુનીશ્વરો, અયત લહે નિજવાસ.

નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૬.

આર્થ :—મુનિવરો સ્વ શુદ્ધ આત્મામાં મનની એકાગ્રતારૂપ એવો દંડ સમ્યક્ અભ્યાસ કરે છે, કે જેથી તે અત્યંત સ્થિર થાય છે. ૧૬.

સુખે દુઃખે મહારોગે ક્ષુધાદીનામુપદ્રવે।

ચતુર્વિધોપસર્ગે ચ કુર્વે ચિદ્રૂપચિત્તનં ॥૧૭॥

સુખ દુઃખ સમયે રે મહાત્યાદિ વિપે, બીષણ ઉપદ્રવ માંય;

ઉપસર્ગાદિ રે આવ્યે ના ચૂકું, ચિદ્રૂપ ચિંતન જરાય.

નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૭.

આર્થ :—સુખમાં, દુઃખમાં, મહારોગમાં, ભૂખ આદિ ઉપદ્રવોમાં અને ચાર પ્રકારના ઉપસર્ગ આવી પડે, ત્યારે શુદ્ધઆત્માનું ચિંતન કરું. ૧૭.

નિશ્ચલં ન કૃતં ચિત્તમનાદૌ ભ્રમતો ભવે।

ચિદ્રૂપે તેન સોઢાનિ મહાદુઃખાન્યહો મયા ॥૧૮॥

નિજ ચિદ્રૂપમાં રે નિશ્ચલ ચિત છા ! ન ધર્યું મેં કોઈવાર;

ભ્રમતાં ભવમાં રે, તેથી અનાદિથી દુઃખ પામ્યો હું આપાર.

નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૮.

આર્થ :—અનાદિથી સંસારમાં ભમતાં મેં ચિદ્ગૂપમાં ચિત્તને નિશ્ચલ કર્યું નહિ, તેથી અહોહો ! આશ્ર્ય છે કે મેં મહાન દુઃખો સહન કર્યાં. ૧૮.

યે યાતા યાંતિ યાસ્યંતિ નિર્વિતિ પુરુષોત્તમા : ।

માનસં નિશ્ચલં કૃત્વઃ સ્વે ચિદ્ગૂપે ન સંશય : ॥૧૬॥

જે નરરળનો રે મુક્તિમાં ગયા, જાયે, જાશે સદાય ;
નિજ ચિદ્ગૂપે રે નિશ્ચલ મન કરી, સૌ નિઃશંક શિવ થાય.

નિર્મલ ચિદ્ગૂપ નિશ્ચલ સેવીએ. ૧૯.

આર્થ :—જે ઉત્તમ પુરુષો મોક્ષે ગયા છે, જાય છે અને જશે તે સર્વે પોતાના ચૈતન્યસ્વરૂપ આત્મામાં મનને એકાગ્ર કરીને (ગયા છે, જાય છે અને જશે) એમાં સંશય નથી. ૧૮.

નિશ્ચલોऽગી યદા શુદ્ધચિદ્ગૂપોऽહમિતિ સ્મृતાિ ।

તદૈવ ભાવમુક્તિઃ સ્યાલ્કમેણ દ્રવ્યમુક્તિભાગ ॥૨૦॥

‘નિર્મલ ચિદ્ગૂપ હું’ જન એમ જ્યાં સ્મરણે નિશ્ચલ થાય;
ભાવમુક્તિ તો ત્યાં જ કમે પછી દ્રવ્યે મુક્તિ વરાય.

નિર્મલ ચિદ્ગૂપ નિશ્ચલ સેવીએ. ૨૦.

આર્થ :—‘હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા છું’ એમ સ્મરણ કરતાં જ્યારે આત્મદ્રવ્ય નિશ્ચળ થાય છે, ત્યારે જ ભાવમોક્ષ થાય છે અને અનુકમે દ્રવ્યમોક્ષને યોગ્ય (પણ) થાય છે. ૨૦.



અધ્યાય ૭ મો

[શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં નયોના અવલંબનનું વર્ણન]

ન યામિ શુદ્ધચિદૂપે લયં યાવદહં દૃઢં ।

ન મુંચામિ ક્ષણં તાવદ્ વ્યવહારાવલંબનં ॥૧॥

નિર્મળ ચિદ્રૂપમાં નિશ્ચલપણે, લય જ્યાં સુધી ન પમાય;
ત્યાં સુધી અવલંબન વ્યવહારનું, ક્ષણ પણ દૂર ન કરાય,

નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧.

આર્થ :—શુદ્ધ ચિદ્રૂપમાં જ્યાં સુધી હું દેછ લય ન પામું, ત્યાં
સુધી વ્યવહારનો આશ્રય ક્ષણ પણ છોડું નહિ. ૧.

અશુદ્ધ કિલ ચિદૂપં લોકે સર્વત્ર દૃશ્યતે ।

વ્યવહારનયં શ્રિત્વા શુદ્ધ બોધદૂષા ક્વચિત् ॥૨૨॥

અસહજ ચિદૂપ લોકવિષે બધે, વ્યવહારે તો જણાય;
નિશ્ચયાનયરૂપ ઝાનાંદાટિ થકી, શુદ્ધ ક્વચિત્ દેખાય.

નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૨.

આર્થ :—વ્યવહારનયના આશ્રયથી જોતાં લોકમાં સર્વત્ર ખરેખર
અશુદ્ધ ચિદૂપ દેખાય છે. નિશ્ચયદેષ્ટિથી જોતાં શુદ્ધ ચિદૂપ ક્યાંક ક્યારેક
જણાય છે.

ચિદૂપે તારતમ્યેન ગુણસ્થાનાચ્ચતુર્થતઃ ।

મિથ્યાત્વાદ્યુદ્યાદ્યુદ્યમલાપાયાદ્ વિશુદ્ધતા ॥૩॥

મિથ્યાત્વાદિ રે પ્રકૃતિરૂપ જ્યાં મલક્ષય આરંભ થાય;
ચિદૂપ શુદ્ધ રે ક્રમથી ચતુર્થ એ, ગુણસ્થાનેથી ગણાય.

નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૩.

આર્થ :—મિથ્યાત્વ આદ્દિના ઉદ્યરૂપ મિથ્યાત્વ મોહનીય વગેરે (અને અનંતાનુભંધી કોધ વગેરે કષાય) મળ દૂર થવાથી યોથા ગુણસ્થાનથી માંડીને તારત્યતાથી ચિદ્રૂપમાં વિશુદ્ધતા આવીને વધે છે. ૩.

મોક્ષસ્વર્ગાર્�િનાં પુંસાં તાત્ત્વિકવ્યવહારિણાં ।

પંથાઃ પૃથક્ પૃથક્ રૂપો નાગરાગારિણામિવ ॥૪॥

જુદા ગામે રે જાતા પથિકના જુદા માર્ગો ભળાય;
મોક્ષાર્થી નિશ્ચય, વ્યવહારને, સ્વર્ગાર્થી તેમ ચહાય.

નિર્મિણ ચિદ્રૂપમાં લય હો સદા. ૪.

આર્થ :—મોક્ષના ઈચ્છુક પુરુષોનો અને સ્વર્ગના ઈચ્છુક પુરુષોનો અનુક્રમે નિશ્ચયના આશ્રયરૂપ તાત્ત્વિક અને વ્યવહારના આશ્રયરૂપ અતાત્ત્વિક જુદા જુદા નગરમાં જનાર પથિકોની જેમ ભિન્ન-ભિન્નરૂપ માર્ગ છે. ૪.

ચિંતાકલેશકષાયશોકબહુલે દેહાદિસાધ્યાત્પરા-
ધીને કર્મનિબન્ધનેડતિવિષમે માર્ગો ભયાશાન્વિતે ।
વ્યામોહે વ્યવહારનામનિ ગતિં હિત્વા ક્રજાત્મનું સદા
શુદ્ધે નિશ્ચયનામનીહ સુખદેડમુત્રાપિ દોષોજ્જિતે ॥૫॥

હે! આત્મનું એ કલેશ કષાયયુત વિષમ અતિ વ્યવહાર;
ચિંતા આશારે શોક ભયે ભર્યો, સ્વાધીન વળી નહિ લગાર.
કર્મ નિબંધન ને વ્યામોહકર, જાણી તજ વ્યવહાર;
દોષ રહિત નિશ્ચય ભજ શુદ્ધ એ લોકદ્વયે સુખકાર.
નિર્મિણ ચિદ્રૂપમાં લય હો સદા. ૫.

આર્થ :—ચિંતા, કલેશ, કોધાદિ કષાય, શોકાદિ અન્યંત જેમાં છે તે દેહાદિથી સાધ્ય હોવાથી પરાધીન, કર્મ નિબંધન રૂપ, ભય અને આશાયુક્ત, મુંઝવણ કરનાર, વ્યવહાર નામના અતિ વિષમ માર્ગમાં

ચાલવાનું છોડીને હે આત્મન! આ લોકમાં અને પરલોકમાં પણ
સુખ આપનાર દોષરહિત, શુદ્ધ નિશ્ચય નામના માર્ગમાં તું સદા ગમન
કર. ૫.

ન ભક્તવૃદ્ધૈર્ ચ શિષ્યવર્ગૈર્ પુસ્તકાદૈર્ ચ દેહમુખૈ: ।
ન કર્મણા કેન મમાસ્તિ કાર્ય વિશુદ્ધચિત્યસ્તુ લય: સદૈવ ॥૬॥

ભક્તજનો પુસ્તક તન આદિનું, શિષ્ય સમૂહનું શું કામ?
ચિદ્રૂપ નિર્મિણમાં લય હો સદા, કર્મ અવરનું ન કામ.
નિર્મિણ ચિદ્રૂપમાં લય હો સદા. ૬.

આર્થ :—માટે ભક્તોના સમૂહથી, શિષ્યવર્ગથી, પુસ્તકાદિથી કે
કોઈ કર્મથી કંઈ કામ નથી, (ફક્ત) વિશુદ્ધ ચૈતન્યમાં સદા મારી
પરિણતિનો લય થાવ. ૬.

ન ચેતસા સ્પર્શમહં કરોમિ સચેતનાચેતનવસ્તુજાતે ।
વિમુચ્ય શુદ્ધ હિ નિજાત્મતત્ત્વં કવચિલ્કદાચિલ્કથમધ્યવશયં ॥૭॥

શુદ્ધ નિજાતમ તત્ત્વ તણી કદી, કોઈ રીતે હું કયાંય;
૭૫ ચેતનરૂપ વસ્તુ સમૂહને, મનથી ન સ્પર્શ અવશ્ય,
નિર્મિણ ચિદ્રૂપમાં લય હો સદા. ૭.

આર્થ :—નિજ શુદ્ધાત્મતત્ત્વને છોડીને સચેતન અને અચેતન એવા
સર્વ પદાર્થ સમૂહમાં ક્યારેય, કદાપિ, કોઈ પણ રીતે હું મનથી અવશ્ય
સ્પર્શ કરું નહિ. ૭

વ્યવહારં સમાલંબ્ય યેડક્ષિ કુર્વતિ નિશ્ચયે ।
શુદ્ધચિદ્રૂપસંપ્રાસિસ્તેપામેવેતરસ્ય ન ॥૮॥

અવલંબીનેરે જે વ્યવહારને, નિશ્ચયમાં દે લક્ષ;
નિર્મિણ ચિદ્રૂપ પ્રાપ્તિ તે લણે, બીજાને નહિ અવશ્ય.
નિર્મિણ ચિદ્રૂપમાં લય હો સદા. ૮.

અધ્યાય-૭]

[૬૧

આર્થ :—જેઓ વ્યવહારને અવલંબીને નિશ્ચયમાં દેણી કરે છે, તેમને જ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ થાય છે, બીજાને થતી નથી. ૮

સંપર્કત્ કર્મણોऽશુદ્ધં મલસ્ય વસનં યથા ।

વ્યવહારેણ ચિદ્રૂપં શુદ્ધં તન્ત્રિશ્યાત્રયાત् ॥૬॥

મલ સંબંધે રે વસ્ત્ર મળીન દીસે, ત્યમ વ્યવહારે અશુદ્ધ;
કર્મ સંબંધે રે ચિદ્રૂપ જોઈએ, નિશ્ચય દણિથી શુદ્ધ.

નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૯.

આર્થ :—જેમ વ્યવહારનયથી મળના સંબંધથી વસ્ત્રને મળિન કહેવાય છે અને નિશ્ચયદણિના આશ્રયથી તે શુદ્ધ થાય છે, તેમ કર્મના સંબંધથી આત્માને વ્યવહારથી અશુદ્ધ કહેવાય છે અને નિશ્ચયનયના આશ્રયથી તે શુદ્ધ થાય છે. ૧૦.

અશુદ્ધં કથ્યતે સ્વર્ણમન્યદ્રવ્યેણ મિશ્રિતં ।

વ્યવહારં સમાશ્રિત્ય શુદ્ધં નિશ્ચયતો યથા ॥૧૦॥

યુક્તં તથાઽન્યદ્રવ્યેણાશુદ્ધં ચિદ્રૂપમુચ્યતે ।

વ્યવહારનયાત્ શુદ્ધં નિશ્ચયાત્ પુનરેવ તત્ ॥૧૧॥

અન્ય દ્રવ્યથી રે યુક્ત સુવર્ણ તે જ્યમ વ્યવહારે અશુદ્ધ;
નિશ્ચયદણિથી અન્ય જણાયના માત્ર કનક તો શુદ્ધ.

નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૦.

અન્ય દ્રવ્યયુત તેમ અશુદ્ધ તે, વ્યવહારે ચિદ્રૂપ;
તે જ ચિદાત્મા નિશ્ચયદણિથી ભાસે શુદ્ધ સ્વરૂપ.

નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૧.

આર્થ :—જેમ અન્ય દ્રવ્ય સાથે મેળવાયેલું સુવર્ણ વ્યવહારનો આશ્રય કરીને અશુદ્ધ કહેવાય છે, નિશ્ચયથી (તે) શુદ્ધ કહેવાય છે. ૧૦.

તેમ અન્ય દ્રવ્યથી યુક્ત ચિદ્રૂપ વ્યવહારનયથી અશુદ્ધ કહેવાય છે અને નિશ્ચયથી તે જ શુદ્ધ કહેવાય છે. ૧૧.

બાહ્યાંતરન્યસંપર્કો યેનાંશેન વિયુજ્યતે ।
તેનાંશેન વિશુદ્ધિ: સ્યાદ् ચિદ્ભૂપસ્ય સુવર્ણવત् ॥૧૨॥

બાહ્ય અભ્યાંતર અન્ય સંબંધ તે જે જે અંશ મુકાય;
તે તે અંશે રે ત્યાં ચિદ્ભૂપની શુદ્ધિ કનકવત્ થાય.
નિર્મળ ચિદ્ભૂપમાં લય હો સદા. ૧૨.

આર્થ :—સોનાની પેઠે આત્માને જેટલે અંશે બાહ્ય અને અંતર અન્ય દ્વયનો સંબંધ છૂટે છે, તેટલા અંશે વિશુદ્ધિ થાય છે. ૧૨.

શુદ્ધચિદ્ભૂપસદ્ધ્યાનપર્વતારોહણં સુધીઃ ।
કુર્વન् કરોતિ સુદૃષ્ટિવ્ર્યવહારાવલંબનં ॥૧૩॥

આરુહ્ય શુદ્ધચિદ્ભૂપ ધ્યાનપર્વતમુત્તમં ।
તિષ્ઠેદ્ય યાવત્યજેત્તાવદ્ય વ્રવહારાવલંબનં ॥૧૪॥

નિર્મળ ચિદ્ભૂપના સદ્ધ્યાનરૂપ, ગિરિ પર ચઠતાં સુસંત;
સમ્યગદસ્તિ રે સદ્વ્યવહારને, અવલંબે મતિમંત.
નિર્મળ ચિદ્ભૂપમાં લય હો સદા. ૧૩.

નિર્મળ ચિદ્ભૂપ ધ્યાનગિરિ વરે, ચઠીને દટ સ્થિર થાય;
ત્યારે આલંબન વ્યવહારનું, સર્વ પ્રકારે મુકાય.
નિર્મળ ચિદ્ભૂપમાં લય હો સદા. ૧૪.

આર્થ :—સમ્યગજ્ઞાની, સમ્યગદસ્તિ શુદ્ધ ચિદ્ભૂપના ઉત્તમ ધ્યાનરૂપ
પર્વત ઉપર ચઠતાં, વ્યવહારનો આશ્રય લે છે. ૧૩.

જ્યારે ઉત્તમ શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનરૂપ પર્વત ઉપર ચઠીને
સ્થિર થાય, ત્યારે તે વ્યવહારનો આશ્રય તજી દે. ૧૪.

શુદ્ધચિદ્ભૂપસદ્ધ્યાનપર્વતાદવરોહણં ।
યદાન્યકૃતયે કુર્યાત્તદા તસ્યાવલંબનં ॥૧૫॥

નિર્મળ ચિદ્રૂપ ધ્યાન ગિરિ થકી ઉત્તરે જો કોઈ કાળ;
કાર્ય પ્રસંગે રે તો વ્યવહાર સદ્ અવલંબે તત્કાળ,
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૫.

આર્થ :—જ્યારે અન્ય પ્રયોજનાર્થે શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાનરૂપ પર્વતથી ઉત્તરવાનું બને, ત્યારે તે વ્યવહારનું અવલંબન કરે. ૧૫.

યાતા યાંતિ ચ યાસ્યંતિ યે ભવ્યા મુક્તિસંપદં।
આલંબ્ય વ્યવહારં તે પૂર્વ પશ્ચાચ્ચનિશ્ચયં ॥૧૬॥

કારણેન વિના કાર્ય ન સ્યાત્તેન વિના નયં।
વ્યવહારં કદોત્પત્તિનિશ્ચયસ્ય ન જાયતે ॥૧૭॥

મુક્તિશ્રીને જે વર્યા મનમોહન મેરે,
વરતા વળી વરનાર રે; મનમોહન મેરે;
પ્રથમ ભજુ વ્યવહાર સત્ત મનમોહન મેરે;
ગ્રહી નિશ્ચય પછી સાર રે, મનમોહન મેરે. ૧૬.

કારણ *જીવિષા* કદી કાર્યની મનમોહન મેરે,
સિદ્ધિ નહિ જેમ થાય રે, મનમોહન મેરે;
સદ્ વ્યવહાર વિના કદી મનમોહન મેરે;
નિશ્ચય નહિ સધાય રે; મનમોહન મેરે. ૧૭.

આર્થ :—જે ભવ્ય જીવો મુક્તિ સંપત્તિને પામ્યા છે, પામે છે અને પામશે તે પ્રથમ સત્ત વ્યવહારને આલંબીને અને પછી નિશ્ચયને અવલંબીને પામ્યા છે. ૧૬.

કારણ વગર કાર્ય થાય નહિ, તેથી સત્ત વ્યવહારનય વિના નિશ્ચયની ઉત્પત્તિ કદી થતી નથી. ૧૭.

જિનાગમે પ્રતીતિઃ સ્યાજ્જિનસ્યાચરણોऽપિ ચ।
નિશ્ચયં વ્યવહારં તત્ત્વયં ભજ યથાવિધિ ॥૧૮॥

નિશ્ચય ને વ્યવહાર નાય મનમોહન મેરે,
યથાવિધિ ભજ ચંગ રે, મનમોહન મેરે;
જિનવચને જિનચરણમાં મનમોહન મેરે,
પ્રતીતિ જેમ અભંગ રે, મનમોહન મેરે. ૧૮.

આર્થ :—ઉપર કહ્યા મુજબ તું નિશ્ચય અને વ્યવહારનથનું વિધિ પ્રમાણે ગ્રહણ કર કે, જેથી જિન પ્રણીત આગમમાં અને (સ્વરૂપરમણતારૂપ) જિનના આચરણમાં પણ શ્રદ્ધા થાય. ૧૮.

વ્યવહારં વિના કેચિન્નણ્ણ કેવલનિશ્ચયાત्।

નિશ્ચયેન વિના કેચિત્ત કેવલવ્યવહારતः ॥૧૬॥

નિશ્ચયમાત્રથી બહુ થચા મનમોહન મેરે,
નાષ્ટ, વિના વ્યવહાર રે; મનમોહન મેરે;
નિશ્ચયવિણ ત્યમ નાષ્ટ બહુ મનમોહન મેરે,
માત્ર ગ્રહી વ્યવહાર રે, મનમોહન મેરે. ૧૯.

આર્થ :—કેટલાક વ્યવહાર વિના માત્ર નિશ્ચયનું ગ્રહણ કરવાથી નાશ પામી ગયા, કેટલાક નિશ્ચય વગર, કેવળ વ્યવહારને ગ્રહવાથી નાશ થઈ ગયા. ૧૯.

દ્વાભ્યાં દૂરભ્યાં વિના ન સ્યાત् સમ્યગ્દ્રવ્યાવલોકનં ।

યથા તથા નયાભ્યાં ચેત્યુક્તં સ્યાદ્વાદવાર્દિભિ: ॥૨૦॥

દ્રવ્ય યથાર્થ જણાય ના મનમોહન મેરે,
બે નયનો વિણ તેમ રે, મનમોહન મેરે;
બંને નાય સુતત્પ ગ્રહે મનમોહન મેરે,
કહે સ્યાદ્વાદી ઓમ રે, મનમોહન મેરે. ૨૦.

આર્થ :—જેમ બે નેત્રો વગર યથાર્થ રીતે પદાર્થનું અવલોકન થાય નહિ, તેમ બે નયો વિના યથાર્થ અવલોકન થાય નહિ, તેમ સ્યાદ્વાદ મતના જાણકારોએ કહ્યું છે. ૨૦.

નિશ્ચયં કવચિદાલંબ્ય વ્યવહારં કવચિન્નયં ।
વિધિના વર્તતે પ્રાણી જિનવાણીવિભૂષિતઃ ॥૨૧॥

નિશ્ચય અવલંબને કવચિત् મનમોહન મેરે,
કવચિત् ભજે વ્યવહાર રે, મનમોહન મેરે;
જિનવાણી ભૂષિત જનો, મનમોહન મેરે,
વર્તે વિધિ ગ્રહી સાર રે, મનમોહન મેરે. ૨૧.

અર્થ :—જિનવાણીથી વિભૂષિત પ્રાણી ક્યારેક નિશ્ચયને
અવલંબીને અને ક્યારેક વ્યવહારને અવલંબીને વર્તે છે. ૨૧.

વ્યવહારાદ્વાહિ: કાર્ય કુર્યાદ્વિધિનિયોજિતં ।
નિશ્ચયં ચાંતરં ધૃત્વા તત્વેદી સુનિશ્ચલં ॥૨૨॥

તત્ત્વજ્ઞાની અંતર વિપે મનમોહન મેરે,
ધરી નિશ્ચય સુસ્થિર રે મનમોહન મેરે;
બાધ કિયા વ્યવહારથી મનમોહન મેરે,
કરતા વિધિ વશ ધીર રે મનમોહન મેરે. ૨૨.

અર્થ :—તત્ત્વજ્ઞાની નિશ્ચયને અંતરમાં અત્યંત નિશ્ચલપણે ધારણ
કરીને પ્રારબ્ધયોગે સંપ્રાપ્ત બાધ કાર્ય બહારથી વ્યવહારને અવલંબીને
કરે. ૨૨.

શુદ્ધચિદૂપસંપ્રાર્થિનયાધીનેતિ પશ્યતાં ।
નયાદિરહિતં શુદ્ધચિદૂપं તદનંતરં ॥૨૩॥

નિર્મલ ચિદૂપ પ્રાપ્તિ તો મનમોહન મેરે,
દેખો નય આધીન રે, મનમોહન મેરે;
પછી શુદ્ધ ચિદૂપ તો મનમોહન મેરે,
વિમલ નયાદિ વિહીન રે મનમોહન મેરે. ૨૩.

અર્થ :—શુદ્ધ ચિદૂપની પ્રાપ્તિ નયોને આધીન છે એમ જુઓ.
ત્યાર પછી આત્મસ્વરૂપ નયાદિ રહિત છે. ૨૩. ***

અધ્યાય ૮ મો

[શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે ભેદજ્ઞાનની આવશ્યકતા]

છેત્રીસૂચિક્રકચપવનૈ: સીમકાળન્યૂષયંત્રૈ–
 સુલ્યા પાથ: કતકફલબદ્ધસપક્ષિસ્વભાવા।
 શાસ્ત્રીજાયુસ્વધિતિસદૃશા ટંકવૈશાહબદ્વા
 પ્રજ્ઞા યસ્યોદ્ભવતિ હિ ભિદે તસ્ય ચિદ્રૂપલબ્ધિઃ ॥૧॥

છીણી સોય પવન કરવત સમ કોલુ અનિન સીસા જેવી,
 હંસ પક્ષી કીર ગ્રહે બિજ્ઞા, જળ કરે કતક નિર્મણ તેવી;
 ઔષધિ, અસિ, પરશુ, છરી, મંથન-દંડ પદાર્થો બિજ્ઞા કરે,
 તેમ સ્વ-પર ભેદ પ્રજ્ઞા નિજ વર્તે તો ચિદ્રૂપલબ્ધિ વરે. ૧.

આર્થ: —જેને જરૂ ચેતનના ભેદ પાડવા માટે છીણી, સોય,
 કરવત, પવન સમાન, સીસું, અનિન, કોલુ (શેરડી પીલવાનો સંચો)ના
 જેવી, પાણી, ફટકડી જેવી, હંસ પક્ષીના સ્વભાવ જેવી, છરી, આયુષ્ય
 આપનાર ઔષધ, પરશુ જેવી, ટંકણા કે રવેયા (દહીનું મંથન કરનાર
 મેરુદંડ) જેવી પ્રજ્ઞા (વિવેકવાળું જ્ઞાન) પ્રગટ થાય છે, તેને નિશ્ચયથી
 ચિદ્રૂપની પ્રાપ્તિ થાય છે. ૧.

સ્વર્ણ પાષાણસૂતાદ્વસનમિવ મલાત્તાપ્રસ્રઘાદિ હેમનો
 વા લોહાદમ્નિરિક્ષો રસ ઇહ જલવત્કર્દમાત્કેકિપક્ષાત् ।
 તામ્રં તૈલં તિલાદે: રજતમિવ કિલોપાયતસ્તાપ્રમુખ્યાત्
 દુઃધાન્તીરં ઘૃતં ચ ક્રિયત ઇવ પૃથક જ્ઞાનિનાત્મા શરીરાત् ॥૨॥

જેમ કનક-પાષાણથી કંચન, વસ્ત્રથી મેલ ઉપાય વડે,
 લોહથી અનિન, ઇક્ષુથી રસ, કે ચાંદી કનકથી બિજ્ઞા પડે;

કીરતથી નીર, કર્ડમથી જળ, ને તલથી તેલ જુદાં નીકળો,
તેમ જ્ઞાની પ્રજાએ, ચિદૂપ, નિજ તનથી વિભિન્ન કરો. ૨.

આર્થ :—આ જગતમાં જેમ સુવર્ણ-પાષાણમાંથી સુવર્ણ, મેલથી
વલ્લ, સુવર્ણમાંથી તાંબુ રૂપું વગેરે અથવા લોહમાંથી અર્જિન, શેરડીમાંથી
રસ, કાદવમાંથી જળ, મોરના પીંછામાંથી ત્રાંબુ, તલ આદિમાંથી તેલ,
તાંબા વગેરે ધાતુમાંથી જેમ ચાંદી, દૂધમાંથી પાણી અને ધી ઉપાય કરીને
પૃથકું કરવામાં આવે છે; તેમ જ્ઞાની વડે આત્માને શરીરથી ભિન્ન
કરવામાં આવે છે.

દેશં રાષ્ટ્રं પુરાદ્યં સ્વજનવનધનં વર્ણપક્ષં સ્વકીય-
જ્ઞાતિં સંબંધિવર્ગં કુલપરિજનકં સોદરં પુત્રજાયે।
દેહં હૃદ્બાનિભાવાન् વિકૃતિગુણવિધીન् કારકાદીનિ ભિત્વા
શુદ્ધં ચિદૂપમેકં સહજગુણનિધિં નિર્વિભાગં સ્મરામિ ॥૩॥

દેશ રાજ્ય પુર વર્ણ પક્ષકે પરિજન વન ધન કુલ સ્વજનો,
પુત્ર ભ્રાત ભાર્યા સંબંધી, સ્વકીય જ્ઞાતિ તન મન વરાનો;
સર્વ વિભાવ કારક પર મુજખી વિકૃત-હેતુ ભિન્ન કરું,
નિર્વિભાગ નિર્મલ નિજ ચિદૂપ એક સહજ ગુણ નિધિ સ્મરણ. ૩.

આર્થ :—દેશને, રાજ્યને, પુરનગર આદિને, સ્વજન, વન,
ધનને, બ્રાહ્મણ આદિ વર્ણના પક્ષને, પોતાની જ્ઞાતિને, સંબંધી વર્ગને, કુળ
પરિવારને, ભાઈને, શ્રી-પુત્રને, શરીરને, મનને, વાણીરૂપ વિભાવોને
વિકાર કરનારા કર્તા, કર્મ, કરણ આદિ કારકોને ભિન્ન કરીને, અખંડ,
એક સ્વાભાવિક ગુણના ધામરૂપ, શુદ્ધ ચિદૂપને હું સમરું છું. ૩.

સ્વાત્મધ્યાનામૃતં સ્વચ્છં વિકલ્પાનપસાર્ય સત् ।

પિવતિ કલેશનાશાય જલં શૈવાલવત્સુધીઃ ॥૪॥

સૌ વિકલ્પ-સેવાલ ખસેડી, નિર્મલ જલવત્ જ્ઞાનીજનો;
સ્વાત્મધ્યાન નિર્મલ અમૃતને, પીવે કલેશ હરવા ભવનો. ૪.

આર્થ :—નિર્મળ ભતિમાન સંત પુરુષ, કલેશનો નાશ કરવા માટે વિકલ્પોને સેવાણ માફક દૂર કરીને, નિર્મળ જણની જેમ સ્વાત્મધ્યાન રૂપ અમૃતનું પાન કરે છે. ૪.

નાત્મધ્યાનાત્પરં સૌખ્યં નાત્મધ્યાનાત् પરં તપઃ ।

નાત્મધ્યાનાત્પરો મોક્ષપથઃ કવાપિ કદાચન ॥૫॥

આત્મધ્યાનની આધિક કદાપિ કોઈ સ્થળો સુખ સત્ય નથી;
તપ પણ તેમ જ મોક્ષમાર્ગ પણ આત્મધ્યાનની શ્રેષ્ઠ નથી. ૫.

આર્થ :—કૃચાંય પણ, કદી પણ, આત્મધ્યાનની ચાડિયાતું બીજું કોઈ સુખ નથી, આત્મધ્યાનની શ્રેષ્ઠ તપ નથી, આત્મધ્યાન સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. ૫.

કેચિત્ત્રાપ્ય યશઃ સુખં વરવધૂં રાયં સુતં સેવકં
સ્વામિત્વं વરવાહનં બલસુહત્પાંડિત્યરૂપાદિકં ।
મન્યંતે સફળં સ્વજન્મમુદિતા મોહાભિભૂતા નરા ।
મન્યેઽહં ચ દુરાપયાત્મવપુષોર્જસ્યા ભિદઃ કેવળં ॥૬॥

સુંદર રમણી સુખ યશ ધન કે પુત્ર મિત્ર ભૂત્યાદિ કદા,
સ્વામિપણું વાહન પંડિતતા, બળ સુંદર રૂપ પ્રાપ્ત યદા;
તો તે પામ્યે મોહવશે જન હર્ષિત નરભવ સફળ ગણે,
આત્મા દેણ જુદા એ દુર્લભ જ્ઞાનની ધન્ય ગણું હું મને. ૬

આર્થ :—કેટલાક મોહને વશ થયેલા જનો યશ, સુખ, સારી ઋણી,
ધન, પુત્ર, સેવક, સ્વામીત્વ, ઉત્તમ વાહન, બળ, મિત્ર, પાંડિત્ય, રૂપાદિ
પ્રાપ્ત કરવાથી હર્ષિત થયેલા ઉત્તમ મનુષ્ય ભવને સફળ (થયો) ગણે
છે અને હું આત્મા અને શરીરના ભેદના દુર્લભ જ્ઞાન વડે કેવળ બધું
ઉપયાર રૂપ માનું છું. ૬.

તાવત્તિષ્ઠંતિ ચિદ્ભૂમौ દુર્ભેદ્યાઃ કર્મપર્વતાઃ ।

ભેદવિજ્ઞાનવજ્રં ન યાવત્પતતિ મૂર્ખનિ ॥૭॥

ત્યાં સુધી ચિદ્રૂપ ભૂમિ ઉપર બહુ કર્મગિરિ દુર્ભેદ દીસે,
જ્યાં સુધી બેદ વિજ્ઞાન વજના એકાએક પડે શીર્ષે. ૭.

અર્થ :—જ્યાં સુધી ભસ્તક ઉપર ભેદવિજ્ઞાનરૂપ વજ પડતું નથી, ત્યાં સુધી કર્મપર્વતો દુર્ભેદપણે ચૈતન્યરૂપ ભૂમિમાં ઊભા રહે છે. ૭.

દુર્લભોऽત્ર જગન્મધ્યે ચિદ્રૂપરુચિકારકઃ ।
તતોऽપિ દુર્લભં શાસ્ત્રં ચિદ્રૂપપ્રતિપાદકં ॥૮॥

તતોऽપિ દુર્લભો લોકે ગુરુસ્તદુપદેશકઃ ।
તતોऽપિ દુર્લભં ભેદજ્ઞાનं ચિંતામણિર્યથા ॥૯॥

દુર્લભ આ જગ મધ્ય અતિશાય ચિદ્રૂપમાં રૂચિ લાવે જે,
તેથી અતિ દુર્લભ સત્ત્વાઓ ચિદ્રૂપ સ્પષ્ટ બતાવે જે;
દુર્લભ પણ તેથી ગુરુ જ્ઞાની, ચિદ્રૂપ નિશાદિન બોધે જે,
સૌથી ચિંતામણિ સમ દુર્લભ ભેદજ્ઞાન ઉર શોધે તે. ૮-૯.

અર્થ :—આ જગતમાં, ચૈતન્યસ્વરૂપી રૂચિ કરનાર-કરાવનાર દુર્લભ છે, ચૈતન્યસ્વરૂપનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રો તેના કરતાં પણ દુર્લભ છે. લોકમાં તેનો ઉપદેશ આપનાર ગુરુ તેથી પણ દુર્લભ છે અને ચિંતામણિ રતની જેમ ભેદજ્ઞાન તેના કરતાં પણ દુર્લભ છે. ૮-૯.

ભેદો વિધીયતે યેન ચેતનાદ્રેહકર્મણો: ।
તજ્ઞાતવિક્રિયાદીનાં ભેદજ્ઞાનં તદુચ્યતે ॥૧૦॥

દેહ કર્મકૃત સર્વ વિકારો તે જડ, ચેતન આપ અહો !
જડ ચેતન એ ભિન્ન કરે તે ભેદજ્ઞાન મુજ ઉર રહો. ૧૦.

અર્થ :—જેનાથી ચૈતન્યસ્વરૂપ આત્માથી શરીરનો, કર્મનો અને તેનાથી થતા સર્વ વિકારોનો ભેદ કરવામાં આવે છે, તેને ભેદજ્ઞાન કહે છે. ૧૦.

સ્વકીયં શુદ્ધચિદૂપં ભેદજ્ઞાનं વિના કદા ।
 તપઃશ્રુતવતાં મધ્યે ન પ્રાપ્ત કેનવિત् કવચિત् ॥૧૧॥
 ક્ષયં નયતિ ભેદજ્ઞશુદ્ધુપપ્રતિઘાતકં ।
 ક્ષણેન કર્મણાં રાશિં તૃણાનાં પાવકો યથા ॥૧૨॥

સ્વકીય શુદ્ધચિદૂપની પ્રાપ્તિ, તપ કે શ્રુત અભ્યાસી જનો,
 કોઈ કચાંય પણ કદી ન લછે વિષા ભેદજ્ઞાન, શ્રમ વ્યર્થ ગણો;
 તૃણારાશિને અભિન દ્ધે તેમ ભેદજ્ઞાની ક્ષણમાં કરતા,
 ચિદૂપઘાતક કર્મસમૂહનો નાશ, સ્વરૂપ મુર્કિત વરતા. ૧૧-૧૨.

અર્થ :—તપ અને શાખજ્ઞાનીઓમાંથી કોઈએ ભેદજ્ઞાન વિના,
 નિજ શુદ્ધ ચિદૂપની કચાંય, કદી પણ પ્રાપ્તિ કરી નથી. ૧૧.

ભેદજ્ઞાની, જેમ અભિન ધાસના સમૂહને (બાળીને નષ્ટ કરે છે)
 તેમ આત્મસ્વરૂપનો ધાત કરનાર કર્મસમૂહનો ક્ષણમાત્રમાં નાશ કરે છે.

અછિન્નધારયા ભેદબોધનં ભાવયેત् સુધીઃ ।
 શુદ્ધચિદૂપસંપ્રાસ્યૈ સર્વશાસ્ત્રવિશારદઃ ॥૧૩॥
 સંવરોન્નિર્જરા સાક્ષાત् જાયતે સ્વાત્મબોધનાત् ।
 તદ્ભેદજ્ઞાનતસ્તસ્માત્તચ્ચ ભાવ્યં મુસુક્ષુણા ॥૧૪॥

સર્વ શાસ્ત્રમાં નિપુણ અહો ! મતિમાન ચછો ચિદૂપ યદા,
 ભાવો ભેદવિજ્ઞાન ભાવના એક અખંડિત મને સદા;
 સ્વાત્મજ્ઞાનથી પ્રગાટે સંવર તેમ નિર્જરા પ્રબળ અહા !
 ભેદજ્ઞાનથી આત્મજ્ઞાન તે ત્યાં જ મુમુક્ષુની સતત સ્પૃહા. ૧૩-૧૪.

અર્થ :—સર્વ શાસ્ત્રોમાં નિપુણ એવા ભેદજ્ઞાનીએ શુદ્ધચિદૂપની
 સમ્પ્રાપ્તિ માટે અખંડિત ધારાએ ભેદજ્ઞાને ભાવવું. ૧૩.

આત્મજ્ઞાનથી સાક્ષાત્ સંવર અને નિર્જરા થાય છે તે આત્મજ્ઞાન
 ભેદજ્ઞાનથી થાય છે, માટે મુમુક્ષુએ તે ભેદજ્ઞાનને ભાવવું. ૧૪.

લબ્ધા વસ્તુપરીક્ષા ચ શિલ્પાદિ સકળા કલા ।
વહ્ની શક્તિવિભૂતિશ્ચ ભેદજ્ઞાતિં કેવલા ॥૧૫॥

વસ્તુ પરીક્ષા રે શિલ્પકળાદિમાં નિપુણ થયો બહુ વાર,
શક્તિ વિભૂતિ રે બહુ લહી; માત્રાના ભેદજ્ઞાતિ કોઈ વાર.

ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૫.

આર્થ :—વસ્તુની પરીક્ષા શિલ્પ આછિ સર્વ કળા તેમ જ બહુ
શક્તિ અને વિભૂતિ (આ જીવને) મળી છે, માત્ર ભેદજ્ઞાન પ્રાપ્ત થયું
નથી. ૧૫.

ચિદ્રૂપચ્છાદકો મોહરેણુરાશિર્ં બુધ્યતે ।
કવ યાતીતિ શરીરાત્મભેદજ્ઞાનપ્રભંજનાત् ॥૧૬॥

આત્મ શરીરના રે ભેદવિજ્ઞાનરૂપ, વાયુ બળે કચાંચ જાય,
મોહરેણુ ચય ચિદ્રૂપ ટાંકતો, તે તો જરી ના જણાય,
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૬.

આર્થ :—શરીર અને આત્માના ભેદજ્ઞાનરૂપ પવનથી,
ચૈતન્યસ્વરૂપ આવરણ કરનાર (ઢાંકનાર) મોહકર્મનાં પરમાણુનો સમૂહ
ક્યાં ઊરી જાય છે, તેની ખબર પડતી નથી. ૧૬.

ભેદજ્ઞાન પ્રદીપોऽસ્તિ શુદ્ધચિદ્રૂપદર્શને ।
અનાદિજમહામોહતામસચ્છેદનેઽપિ ચ ॥૧૭॥

તિમિર અનાદિ રે જે મહામોહનું, છેદે એ બળવાન,
નિર્મિત ચિદ્રૂપ દર્શન હેતુ એ, ભેદજ્ઞાતિ દીપ જાણ.
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૭.

આર્થ :—ભેદજ્ઞાન શુદ્ધચિદ્રૂપના દર્શનમાં અને અનાદિના
મહામોહરૂપ અંધકારને છેદવામાં દીપક છે. ૧૭.

ભેદવિજ્ઞાનનેત્રેણ યોગી સાક્ષાદવેક્ષતે ।
સિદ્ધસ્થાને શરીરે વા ચિદ્રૂપં કર્મણોજ્ઞિતં ॥૧૮॥

ભેદજ્ઞાનરૂપ ચક્ષુ અપૂર્વથી, યોગી જુવે સાક્ષાત्,
સિદ્ધિકોએ રે તેમ શરીરમાં, ચિદ્રૂપ કર્મો રહિત;
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૮.

આર્થ :—ભેદવિજ્ઞાનરૂપ નેત્રથી યોગી સિદ્ધસ્થાનમાં અથવા
શરીરમાં કર્મરહિત શુદ્ધચિદ્રૂપને સાક્ષાત् જુવે છે. ૧૮.

મિલિતાનેકવસ્તુનાં સ્વરૂપં હિ પૃથક્ પૃથક્।

સ્પર્શાદિભર્વિદગ્ધેન નિઃશંકં જ્ઞાયતે યથા ॥૧૬॥

તથૈવ મિલિતાનાં હિ શુદ્ધચિદૈહકર્મણાં।

અનુભૂત્યા કથં સદ્ભિઃ સ્વરૂપં ન પૃથક્ પૃથક્ ॥૨૦॥યુગ્માં।

બેગી મળેલી રે વસ્તુ ધાણી છતાં, ભિન્નરૂપે ઓળખાય,
પ્રવીણ પુરુષને રે સ્પર્શાદિકથી, જેમ તે જુદી ગ્રહાય;
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૯.

તેમ મળેલાં રે કર્મ, શરીર ને નિર્મિણ ચિદ્રૂપ છતાં ચ,
અનુભવથી કેમ ભિન્ન વિભિન્ન તે, સંતોને ન જણાય ?

ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૨૦.

આર્થ :—જેમ ચયતુર પુરુષ બેગી મળેલી અનેક વસ્તુઓનું સ્વરૂપ
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ વડે જુદું જુદું નિશ્ચયથી જાણી લે છે, તેવી
જ રીતે બેગા મળેલાં શુદ્ધ આત્મા અને દેહ, કર્મ આદિનું સ્વરૂપ
સત્પુરુષો અનુભૂતિ દ્વારા ભિન્ન-ભિન્ન કેમ ન જાણી લે? (અવશ્ય જાણે
જ) ૧૯-૨૦.

આત્માનં દેહકર્માણિ ભેદજ્ઞાને સમાગતે ।

મુક્ત્વા યાંત્રિ યથા સર્પ ગરુડે ચંદનદુમં ॥૨૧॥

ગાલડ જુવે ત્વાં રે ચંદન તરુ તજુ, સર્પ સમૂહ જ્યમ પલાય,
ભેદવિજ્ઞાને રે કર્મ શરીર તેમ, આત્માથી દૂર થાય.


ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૨૧.

આર્થ :—જેમ ગરુડ પાસે આવી પહોંચતાં સર્પો ચંદનવૃક્ષને
છોડીને જતાં રહે છે તેમ ભેદજ્ઞાનની પ્રાપ્ત થતાં દેહ, કર્મ આત્માને
છોડીને દૂર થઈ જાય છે. ૨૧.

ભેદજ્ઞાનબલાત् શુદ્ધચિદ્રૂપં પ્રાપ્ત કેવલી।
ભવેદેવાધિદેવોऽપि તીર્થકર્તા જિનેશ્વર: ॥૨૨॥

ભેદ ઝાનનારે બલથી પામીને, કેવલી ચિદ્રૂપ શુદ્ધ,
તીર્થકર જિનેન્દ્ર બને મહા, દેવ દેવોના પ્રસિદ્ધ.
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૨૨.

આર્થ :—ભેદજ્ઞાનના બળથી જીવ શુદ્ધ ચિદ્રૂપને પામીને
કેવળજ્ઞાની, તીર્થકર, જિનેશ્વર અને દેવાધિદેવ પણ થાય છે. ૨૨.



અધ્યાય ૮ મો

[શુદ્ધ ચિદૂપના ધ્યાનને માટે મોહત્યાગની આવશ્યકતા]

અન્યદીયા મદીયાશ્ચ પદાર્થશ્વેતનેતરાઃ ।

એતેઽદર્શિતનં મોહો યતઃ કિંચિત્ત્ર કસ્યચિત् ॥૧॥

૪૫ યેતનરૂપ સર્વ પદાર્થો, એ મારા કે અન્યતણા;
અન્યાં ચિંતન મોહમાત્ર છે, જ્ઞાં કોઈનું કિંચિત્ત્ર ના. ૧.

આર્થ :—આ યેતન તથા જરૂરપદાર્થો મારા તથા અન્યના છે,
આવું ચિંતવન તે મોહ છે, કારણ કે કંઈ પણ કોઈનું ય નથી. ૧.

દત્તો માનોऽપમાનો મે જલ્પિતા કીર્તિરૂજ્વલા ।

અનુજ્વલાપકીર્તિર્વા મોહસ્તેનેતિ ચિંતનં ॥૨॥

માન મળ્યું અપમાન થયું મુજ, ઉજ્જવલ યશ ફેલ્યો આજે,
મુજ અપયશ આણે વિસ્તારો, મોહ ચિંતના એ ગાજે. ૨.

આર્થ :—તેણે મારું માન કે અપમાન કર્યું, મારો ઉજ્જવળ યશ
અથવા મલિન અપયશ ફેલાવ્યો; આ પ્રકારનું ચિંતન કરવું તે મોહ
છે. ૨.

કિં કરોમિ કવ યામીદં કવ લભેય સુખ કૃતઃ ।

કિમાત્રયામિ કિં વચ્મિ મોહચિંતનમીદૃશં ॥૩॥

શું કરું? કયાં જઉ? આ કયાં પામું? સુખ કયાંથી? એ વિકલ્પ ઘણા,
રહુ આશ્રયે કોના કહું શું? એ સૌ ચિંતન મોહતણાં. ૩.

આર્થ :—(હું) શું કરું? કયાં જઉ? કયાંથી આ પામું? (મને)
કયાંથી સુખ મળે? (મળશે) કોનો આશ્રય કરું? (હું) શું બોલું? આવા
પ્રકારનું ચિંતન (પણ) મોહ છે. ૩.

ચેતનાચેતને રાગો દ્વેષો મિથ્યામતિર્મમ ।
મોહરૂપમિદં સર્વચિદ્બૂપોऽહં હિ કેવલઃ ॥૪॥

૪૫ યેતનરૂપ સર્વ અન્યમાં રાગ-દ્રેષ મિથ્યામતિ તે,
એ સૌ મોહરૂપ હું કેવળ ચિદ્બૂપ તેથી સ્મરં આતિ તે. ૪.

આર્થ :—યેતન અને જડ પદાર્થોમાં રાગ અને દ્રેષ (કરવા તે) મારી મિથ્યાબુદ્ધિ છે; આ બધું મોહનું સ્વરૂપ છે, હું કેવળ ચિદ્બૂપ જ છું. ૪.

દેહોऽહં મે સ વા કર્મોદ્યોऽહં વાય્યસૌ મમ ।
કલત્રાદિરહં વા મે મોહોऽદશ્વિતનં કિલ ॥૫॥

શરીર હું છું; તે મારું છે, કર્મ ઉદ્ય હું, તે મારો,
સ્ત્રી આદિકમાં હું મારું, એ ચિંતન જાણો મોહ ખરો. ૫.

આર્થ :—હું શરીર છું, અથવા તે મારું છે, હું કર્મનો ઉદ્ય છું,
અથવા તે પણ મારો છે, સ્ત્રી આદિ હું છું અથવા તે મારાં છે. આવું
ચિંતન (કરવું તે) ખરેખર મોહ છે. ૫. { મેદાનં ૯ }

તજયે વ્યવહારેણ સંત્યુપાયા અનેકશઃ ।
નિશ્ચયેનેતિ મે શુદ્ધચિદ્બૂપોऽહં સ ચિંતનં ॥૬॥

તે જ્ય કરવા કાજ ઉપાયો છે બહુવિધિ વ્યવહાર કહે;
હું નિર્મલ ચિદ્બૂપ, તે મારું, ચિંતન નિશ્ચય એ જ ગ્રહે. ૬.

આર્થ :—તેના જ્યમાં વ્યવહારથી અનેક ઉપાયો છે (પણ)
નિશ્ચયથી ‘હું શુદ્ધ ચિદ્બૂપ છું’, ‘તે જ મારું છે’, એવું ચિંતન એ એક
જ ઉપાય છે. ૬.

ધર્મોદ્ધારવિનાશનાદિ કુરુતે કાલો યથા રોચતે
સ્વસ્યાન્યસ્ય સુખાસુખં વરખજં કર્મૈવ પૂર્વાર્જિતં ।

અન્યે ચેડપિ યથૈવ સંતિ હિ તથૈવાર્થાશ્ચ તિષ્ઠંતિ તે
તચ્છ્વતામિતિ મા વિધેહિ કુરુ તે શુદ્ધાત્મનશિંતન ॥૭॥

ધર્મ ઉણ્ણતિ કે નાશાદિ કાલ પ્રમાણે થયા કરે,
ઇન્દ્રિય સુખ દુઃખ સૌ નિજપરનાં પૂર્વ ઉપાર્જિત કર્મ ખરે;
અન્ય પદાર્થો પણ જે જેવા તે તેવા જ રહે ત્યારે,
ચિંતા વ્યર્થ તજુ તેની કર શુદ્ધ આત્મ-ચિંતન પ્યારે. ૭.

આર્થ :—જેમ કાળને ગમે છે તેમ ધર્મનો ઉદ્ઘાર વિનાશ આદિ (તે) કરે છે. પોતાનું અને અન્યનું ઉત્તમ ઈન્દ્રિયજ્ઞિત સુખ-દુઃખ (મળે છે તે) પૂર્વ ઉપાર્જલું કર્મ જ છે, બીજા પદાર્થો પણ જે જેમ છે તે તેમ જ રહે છે, માટે આવી (સ્વ-પર સંયોગી પદાર્થોને ફેરવવાની) ચિંતા ન કર. (ફક્ત) તારા શુદ્ધ આત્માનું ચિંતન (તું) કર. ૭.

દુર્ગંધિ મલભાજન કુવિધિના નિષ્પાદિતં ધાતુભિ-
રંગં તસ્ય જનૈર્નિજાર્થમખિલૈરાખ્યા ધૃતા સ્વેચ્છ્યા।
તસ્યા: કિ મમ વર્ણને સતત કિં નિંદનેનૈવ ચ
ચિદ્રૂપસ્ય શરીરકર્મજનિતાઽન્યસ્યાય્યહો તત્ત્વતः ॥૮॥

અશુભ કર્મકૃત સાત ધાતુમય મલભાજન દુર્ગંધિ ભર્યુ,
આ તન, તેનું વર્ણન સૌઓ સ્વાર્થ કાજ સ્વેચ્છિત કર્યુ;
તે વર્ણન સ્તુતિ કે નિંદાનું, કાંઈ પ્રયોજન શું મારે ?
શરીર કર્મકૃત સર્વવિકારો, જડ, મુજ ચિદ્રૂપ બિન્ન ખરે. ૮.

આર્થ :—શરીર દુર્ગંધવાળું, મલનું સ્થાન, સાત ધાતુ વડે અશુભ કર્મ રચેલું છે, સર્વ જનોએ તેની કથા પોત-પોતાના સ્વાર્થ માટે પોતાની કલ્પના પ્રમાણે કરી છે. પણ અહો ! નિશ્ચયથી (તત્ત્વદેખિએ) શરીર, કર્મ અને તેનાથી થતા સર્વ વિકારોથી બિન્ન ચિદ્રૂપ એવા મને તેના (તે પ્રશંસાના) સતત વર્ણનથી અને નિંદાથી શું પ્રયોજન છે? ૮.

કીર્તિं વા પરરંજનં ખવિષયં કેચિન્નિજં જીવિતં
સંતાનં ચ પરિગ્રહં ભયમાપિ જ્ઞાનં તथા દર્શનં।
અન્યસ્યાખિલવસ્તુનો રૂગ્યુતિં તદ્વેતુમુદ્દિશ્ય ચ
કર્યાઃ કર્મ વિમોહિનો હિ સુધિયશ્ચિત્પલબ્ધ્યૈ પરં ॥૬॥

વિષયો, પરરંજન, યશપ્રાપ્તિ, નિજ જીવન રક્ષા કરવા,
પુત્ર પરિગ્રહ પ્રાપ્તિ કાજે કિંવા દર્શન જ્ઞાન થવા;
ભય વ્યાધિ પરિહરવા અથવા સર્વ અન્ય વસ્તુ અર્થો,
કરે કર્મ મોહી જીવ કિન્તુ પ્રાણ કરે સૌ આત્મારો. ૯.

અર્થ :—કેટલાક મોહી જીવો કીર્તિને, પરરંજનને, ઈન્દ્રિયના
વિષયને, પોતાના જીવનને, સંતાન અને પરિગ્રહને, ભયને, જ્ઞાન તથા
દર્શનને, અન્ય વસ્તુની પ્રાપ્તિને, રોગના વિયોગને અને તેના હેતુને
ઉદ્દેશીને કાર્ય કરતા હોય છે, પરંતુ ખરેખર બુદ્ધિમાનો ચિત્રૂપની પ્રાપ્તિ
માટે કાર્ય કરે (છ). ૮.

કલ્પેશનાગેશનરેશસંભવં ચિત્તે સુખં મે સતતં તૃણાયતે ।
કુસ્ત્રીરમાસ્થાનકદેહદેહજાત્ સદેતિચિત્ત્ર મનુતેઽલ્પધીઃ સુખં ॥૧૦॥

સર્વ નરેન્દ્ર ચક્રવર્ત્યાદિક કે ધરણેન્દ્ર સુરેન્દ્રતણાં,
દિવ્ય સુખો તૃણ તુલ્ય નિરંતર, ભાસે મુજને તુલ્ય ધણાં;
કાંતા કનક ભૂમિ ગૃહ તનકે તનયાદિ દુઃખરૂપ બધાં,
છતાં અલ્પબુદ્ધિ સુખરૂપ તે માને એ આશ્ર્ય સદા. ૧૦.

અર્થ :—મારા ચિત્તમાં કલ્પવાસી દેવોના ઈન્દ્રને, નાગેન્દ્રને,
નરેન્દ્રને પ્રાપ્ત થતું સુખ નિરંતર તૃણ સમાન તુલ્ય લાગે છે, અલ્પ
બુદ્ધિમાન હંમેશાં ભૂમિ, સ્ત્રી, લક્ષ્મી, ધર, શરીર, પુત્રથી સુખ માને છે;
એ આશ્ર્યકારક છે. ૧૦.

ન બદ્ધઃ પરમાર્થેન બદ્ધો મોહવશાદ્ ગૃહી ।
શુક્રવદ् ભીમપાશેનાથવા મર્કટમુષ્ટિવત् ॥૧૧॥

પરમાર્થે નહિ બદ્ધ બેડીથી, પણ બંધાયા દટ પાશો,
શુકવત કે મર્કટમુષ્ટિવત અહો ! ગૃહસ્થો મોહવશો. ૧૧.

આર્થ :—ગૃહસ્થ મોહવશો પોપટની માફક ભયંકર પાશથી અથવા વાંદરાની મૂડીની જેમ બંધાયેલો છે, છતાં તે પરમાર્થ બંધાયેલો નથી. ૧૧.

શ્રદ્ધાનાં પુસ્તકાનાં જિનભવનમઠાંતેનિવાસ્યાદિકાનાં
કીર્તેરક્ષાર્થકાનાં ભુવિ ઝાટિતિ જનો રક્ષણે વ્યગ્રચિતઃ ।
યસ્તસ્ય ક્વાત્મચિંતા ક્વ ચ વિશદમતિઃ શુદ્ધચિદ્રૂપકાસિઃ
ક્વ સ્યાત્સૌખ્યં નિજોથં ક્વ ચ મનસિ વિચિત્ર્યેતિ કુર્વતુ યતં ॥૧૨॥

ધર્મ કાર્ય પુસ્તક જિનમંદિર આશ્રમવાસ સુકીર્તિ ચહે,
તેનાં રક્ષણમાં તત્પર જીવ જગમાં નિત્ય ઉપાધિ વહે;
એમ જનોનાં વ્યગ ચિત્ત ત્યાં આત્મચિંતના ક્યાં થાયે ?
મતિ નિર્મણતા બેદજ્ઞાન કે ચિદ્રૂપ કદી ન પ્રગટાયે,
તો તે વિણ નિજ સ્વાત્મિક સુખનો ક્યાં આસ્વાદ કદી આવે ?
એમ વિચારી જન આત્મ ચલને મનમાં ચિદ્રૂપને દ્યાયે. ૧૨.

આર્થ :—જગતમાં સંધ સમુદ્ધાયના, પુસ્તકોના, જિનમંદિર, મઠ,
અંતેવાસી શિષ્ય આદિના, કીર્તિની રક્ષણા હેતુના રક્ષણ કરવામાં જે જીવો
શીઘ્ર વ્યાકુળ મનવાળા હોય છે તેને આત્મચિંતન ક્યાંથી હોય ? નિર્મણ
મતિ ક્યાંથી હોય ? શુદ્ધ આત્માની પ્રાપ્તિ ક્યાંથી હોય ? અને આત્માથી
ઉત્પન્ન થતું સુખ પણ ક્યાંથી હોય ? એમ મનમાં વિચારીને પુરુષાર્થ
કરો. ૧૨.

અહં ગ્રાંતઃ પૂર્વ તદ્દુન ચ જગત્ મોહવશત:
પરદ્રવ્યે ચિંતાસ્તતકરણાભવમહો ।
પરદ્રવ્યં મુક્ત્વા વિહરતિ ચિદાનંદનિલયે
નિજદ્રવ્યે યો વૈ તમિહ પુરુષં ચેતસિ દધે ॥૧૩॥

પરદ્રવ્યોની સતત ચિંતના, કરી મોહવશ અહો ! અપાર !
ભ્રમ્યો પૂર્વથી આ ભવ સુધી હું, જગત જીવ પણ મુજ અનુસાર;
ચિદાનંદ મંદિર નિજદ્રવ્યે, જે વિછરે કરીને પરત્યાગ,
આતમરામી પુરુષ હવે હું, ચિત્ત ઘરં કરી પ્રેમ અથાગ. ૧૩.

અર્થ :—અહો ! મોહને વશ થઈને હું પરદ્રવ્યમાં સતત ચિંતા કરતાં પૂર્વથી માંડીને આ ભવપર્યત ભટક્યો અને મોહને વશ થઈને જગત પણ તે પ્રકારે ભટક્યું. ખરેખર જે પરદ્રવ્યથી મુક્ત થઈને ચૈતન્ય આનંદના ધામ એવા નિજ આત્મદ્રવ્યમાં વિહાર કરે છે, તે પુરુષને હવે હું ચિત્તમાં ધારણ કરું છું. ૧૩.

હિત્વા ય: શુદ્ધચિદૂપસ્મરણં હિ ચિકીર્ષતિ ।
અન્યત્કાર્યમસૌ ચિંતારલમશ્મગ્રહં કુધીઃ ॥૧૪॥
સ્વાધીનं ચ સુખં જ્ઞાનં પરં સ્યાદાત્મચિંતનાત् ।
તન્મુક્ત્વા: પ્રાસુમિચ્છંતિ મોહતસ્તદ્વિલક્ષણં ॥૧૫॥

નિર્મળ ચિદૂપ સ્મરણ તજુને, અન્ય કાર્ય કરવા મન થાય,
તજુ ચિંતામણિ તે દુર્ભુદ્ધિ, પથ્થર ગ્રહવાને લલચાય;
સુખ સ્વાધીન વર જ્ઞાન અનંતું, આત્મચિંતનાથી પ્રગાટાય,
તે છોડીને મોહવશે, જીવ તેનાથી વિપરીત દુઃખ યાણાય. ૧૪-૧૫.

અર્થ :—જે શુદ્ધ ચિદૂપનું સ્મરણ તજુને અન્ય કાર્યને કરવા ઈચ્છે છે, તે દુર્ભુદ્ધિ ચિંતામણિ રત્ન તજુને પથ્થરનું ગ્રહણ કરવા ચાહે છે. ૧૪.

આત્મચિંતનથી સ્વાધીન સુખ અને ઉત્કૃષ્ટ જ્ઞાન થાય છે. મોહથી તે તજુને તેનાથી વિપરીત મેળવવા જીવ ઈચ્છે છે. ૧૫.

યાવન્મોહો બલી પુંસિ દીર્ଘસંસારતાપિ ચ ।
ન તાવત્ શુદ્ધચિદૂપે રૂચિરત્યંતનિશ્ચલા ॥૧૬॥

મોહ હોય બલવાન જીવને ને જો દીર્ઘ છજુ સંસાર,
તો ત્યાં સુધી નિશ્ચલસ્થિ જાગે નાહિ નિર્મળ ચિદૂપ મોગાર. ૧૬.

આર્થ :—જ્યાં સુધી મનુષ્યમાં મોહ બળવાન છે અને દીર્ઘ-સંસારીપણું પણ છે, ત્યાં સુધી શુદ્ધ ચિદ્રૂપમાં અત્યંત નિશ્ચળ રૂચિ થતી નથી. ૧૬.

અંધે નૃત્ય તપોડર્જે ગદવિધિરતુલા સ્વાયુષો વાડવસાને
ગીતં બાધીર્યયુક્તે વપનમિહ ચથાડાયૂષરે વાર્યતૃણો ।
સ્નિગ્ધે ચિત્રાણ્યભવ્યે રુચિવિધિરનઘઃ કુંકુમં નીલવસ્ત્રે
નાત્મપ્રીતૌ તદાખ્યા ભવતિ કિલ વૃથા નિઃ પ્રતીતૌ સુમંત્રઃ ॥૧૭॥

નૃત્ય નકામું અંધ પાસ, તપ અજ્ઞાનીનું ગણ વિપરીત,
વ્યર્થ ઔષધિ આયુષ્ય અંતે, બહેરા આગળ સુર સંગીત;
ઉખર ભૂમિમાં બી શું વાવે ? વૃથા નહિ ત્યાં જળ શું કામ ?
કથન અભવિને ધર્મસંચિનું, ચીકણી વસ્તુ પર ચિત્રામ;
કાળા વસ્ત્રે રંગ ન બેસે, મંત્ર ફળે ના વિણ શ્રદ્ધાન,
આત્મામાં પ્રીતિ નહિ જેને, શું તેની પાસે આપ્યાન ? ૧૭.

આર્થ :—આ લોકમાં જેમ આંધળા આગળ નૃત્ય, અજ્ઞાનીમાં તપ, પોતાના આયુષ્યના અંતે અતુલ ઔષધપ્રયોગ, બહેરા મનુષ્ય પાસે ગાયેલું ગીત અને ઉખર જમીનમાં બીની વાવણી, તરસ્યો ન હોય તેની આગળ ધરેલું પાણી, ચીકણી વસ્તુ ઉપર ચિત્રો, અભવ્ય પાસે ધર્મની રૂચિનું કથન, નીલરંગના વસ્ત્રો ઉપર કંકુનો રંગ, શ્રદ્ધાહીનને (આપેલ) ઉત્તમ મંત્ર ખરેખર નકામો જાય છે, તેવી રીતે આત્મામાં જેને પ્રેમ નથી એવા મનુષ્ય પાસે તેની કથા નિષ્ફળ જાય છે. ૧૭.

સ્મરંતિ પરદ્રવ્યાણિ મોહાન્મૂઢાઃ પ્રતિક્ષણં ।

શિવાય સ્વં ચિદાનંદમયં નैવ કદાચન ॥૧૮॥

પરદ્રવ્યોને કણ કણ સમરે મોહમૂઢ થઈ જીવ સદાય,
ચિદાનંદમય નિજ ચિદ્રૂપને મોક્ષાર્થી ના સમરે કદાય. ૧૮.

અર્થ :—મૂળ જીવો, મોહને લીધે પ્રતિક્ષણ પર દ્રવ્યોને તો યાદ કરે છે, પરંતુ મોક્ષ માટે ચિદાનંદુપ પોતાને કદાપિ યાદ કરતા નથી. ૧૮.

મોહ એવ પરં વૈરી નાન્યઃ કોડપિ વિચારણાત् ।
તતઃ સ એવ જેતવ્યો બલવાન् ધીમતાઽદરાત् ॥૧૬॥

મોહ એ જ શત્રુ બલવન્તો, વિચારતાં નહિ અન્ય મહાના;
માત્ર એ જ જ્ય કરવો ચન્દે, ધીમંતે થઈ અતિ બલવાન. ૧૮.

અર્થ :—મોહ એ જ મોટો વેરી છે, વિચાર કરતાં બીજો કોઈ પણ નથી, (માટે) બુદ્ધિમાને તે જ બળવાનને પ્રયત્ન કરીને જતવા યોગ્ય છે. ૧૮.

ભવકૂપે મહામોહપંકેઽનાદિગતં જગત् ।
શુદ્ધચિદ્રૂપસદ્ગ્યાનરજવા સર્વ સમુદ્ધરે ॥૨૦॥

અનાદિથી ભવકૂપે ખૂંચ્યું જગત મોહ કાદવ મોહર;
નિર્મલ ચિદ્રૂપ ધ્યાન રજુએ એ સધળાનો કરું ઉદ્ધાર. ૨૦.

અર્થ :—સંસારરૂપ ઝૂવામાં, મહામોહરૂપ કાદવમાં અનાદિથી પડેલા સર્વ જગતને શુદ્ધ ચિદ્રૂપના સદ્ગ્યાનરૂપ દોરડા વડે સારી રીતે બહાર કાઢું. ૨૦.

શુદ્ધચિદ્રૂપસદ્ગ્યાનાદન્યત્કાર્ય હિ મોહજં ।
તસ્માદ् બંધસ્તતો દુઃખં મોહ એવ તતો રિપુઃ ॥૨૧॥

નિર્મલ ચિદ્રૂપ ધ્યાન વિના જે અવર કાર્ય તે મોહજનિત;
તેથી બંધન ને દુઃખ તેથી મોહ શત્રુ ગાણ તેથી ખચિત. ૨૧.

અર્થ :—શુદ્ધ ચિદ્રૂપના સદ્ગ્યાનથી બીજું કામ ખરેખર મોહજન્ય છે, તેથી બંધ થાય છે, તેથી દુઃખ થાય છે માટે મોહ જ શત્રુ છે. ૨૧.

મોહં તજ્જાતકાર્યાણિ સંગં હિત્વા ચ નિર્મલં।
શુદ્ધચિદ્રૂપસદ્ગ્યાનં કુરુ ત્વકત્વાચ્યસંગતિં ॥૨૨॥

(વસંતતિલકા)

રે મોહને સકલ મોહજનિત કામો !
સાથે સમસ્ત તજ્જ સંગ હવે વિરામો;
ચિદ્રૂપ નિર્મલતાણું શુદ્ધિ ધ્યાન ધારો,
સૌ અન્ય સંગતિ તજ્જ નિજ કાર્ય સારો. ૨૨.

આર્થિ :—મોહ તથા તેનાથી થતા કાર્યોને, સંગને છોડીને તેમજ બીજાની સંગતિ તજ્જને નિર્મળ, શુદ્ધચિદ્રૂપનું સદ્ગ્યાન તું ધારણ કર. ૨૨.



અધ્યાય ૧૦ મો

[શુદ્ધ ચિદ્રૂપનાં ધ્યાનાર્થે અહંકાર ભમકારના
ત્યાગનો ઉપદેશ]

નિરંતરમહંકારં મૂઢાઃ કુર્વતિ તેન તે।
સ્વકીયં શુદ્ધચિદ્રૂપં વિલોકંતે ન નિર્મલં ॥૧॥

મોહમૂઢ જન મન નિરંતર અહંકારમાં રહે સદાય,
ત્યાં નિર્મલ નિજ ચિદ્રૂપ પ્રત્યે દટ્ટિ દે નહિ અહા જરાય ! ૧.

આર્થ :—મૂઢજનો નિરંતર અહંકાર કરે છે તેથી તેઓ પોતાનાં
શુદ્ધ ચિદ્રૂપને અન્ય દ્રવ્યોથી બિના શુદ્ધ જોતા નથી. ૧.

દેહોऽહં કર્મસ્લૂપોऽહં મનુષ્યોऽહં કૃશોऽકૃશઃ ।
ગૌરોऽહં શ્યામવર્ણોऽહમદ્વિઽજોહં દ્વિજોऽથવા ॥૨॥
અવિદ્વાનષ્યહં વિદ્વાન् નિર્ધનો ધનવાનહં ।
ઇત્યાદિ ચિંતન પુંસામહંકારો નિરુચ્યતે ॥૩॥યુગ્માં।

કાયા હું આ કર્મરૂપ હું, હું માનવ હું કૃશ હું સ્થૂલ,
હું ગોરો, હું શ્યામ વર્ણ હું, દ્વિજ અદ્વિજ વિચારો ભૂલ;
અભાન આરે ! હું, પંડિત હું તો, હું નિર્ધન હું ધનિક મહાન,
ઇત્યાદિ ચિંતન માનવનું અહંકાર ભાખે વિદ્વાન. ૨-૩.

આર્થ :—હું શરીર છું, હું કર્મરૂપ છું, હું મનુષ્ય છું, હું દૂબળો
કે જાડો છું, હું ગોરો છું, શ્યામવર્ણવાળો છું, હું અદ્વિજ છું અથવા હું
દ્વિજ છું. ૨.

વળી હું વિદ્વાન्-અવિદ્વાન્, નિર્ધન-ધનવાન છું—આ પ્રકારનું
મનુષ્યનું ચિંતન અહંકાર કહેવાય છે. ૩.

યે નરા નિરહંકારં વિતન્વંતિ પ્રતિક્ષણં ।

અદ્વૈતં તે સ્વચિદ્બૂપં પ્રાપુંબંતિ ન સંશય: ॥૪॥

ક્ષણા ક્ષણા નિરહંકાર ભાવની વૃદ્ધિ કરે જે જન મતિમાન;
તે અદ્વૈત સ્વરૂપ નિઃ ચિદ્બૂપને પામે નિઃસંશય ધૂતિમાન. ૪.

આર્થ: —જે મનુષ્યો ક્ષણે ક્ષણે અહંકારરહિત ભાવ વધારે છે,
તેઓ અદ્વૈતસ્વરૂપ પોતાના ચિદ્બૂપને પામે છે, તેમાં સંશય નથી. ૪.

ન દેહોऽહં ન કર્માણિ ન મનુષ્યો દ્વિજોઽદ્વિજઃ ।

નૈવ સ્થૂળો કૃશો નાહં કિંતુ ચિદ્બૂપલક્ષણઃ ॥૫॥

ચિંતનं નિરહંકારો ભેદવિજ્ઞાનિનામિતિ ।

સ એવ શુદ્ધચિદ્બૂપલબ્ધ્યે કારણં પરં ॥૬॥ યુગ્મં ॥

શરીર નહીં હું કર્મ નહીં હું ના હું દ્વિજ અદ્વિજ મનુષ્ય,
સ્થૂળ કૃશ પણ હું નહીં કિંતુ ચિદ્બૂપ લક્ષણ હું પ્રત્યક્ષ;
ચિંતન નિરહંકાર ગણ્યું એ ભેદજ્ઞાનીનું ભૂષણ જાણ,
તે જ શુદ્ધ ચિદ્બૂપ લભિનું કારણ શ્રેષ્ઠ લણો વિદ્ધાન. ૫-૬.

આર્થ: —હું દેહ નથી, કર્મો નથી, મનુષ્ય નથી, દ્વિજ કે અદ્વિજ
નથી, સ્થૂળ, કૃશ નથી; પરંતુ હું ચિદ્બૂપ લક્ષણવાળો છું. ૬.

ભેદજ્ઞાનીઓનું આ જાતનું ચિંતન નિરહંકાર છે. શુદ્ધ ચિદ્બૂપની
પ્રાપ્તિ માટે તે જ ઉત્તમ કારણ છે. ૬.

મમત્વં યે પ્રકુર્વંતિ પરવસ્તુષુ મોહિનઃ ।

શુદ્ધચિદ્બૂપસંપ્રાસિસ્તેષાં સ્વપ્રેરપિ નો ભવેત् ॥૭॥

મોહવશે મમતા વિસ્તારે પર વસ્તુમાં જન જે કોય;
કદી શુદ્ધ ચિદ્બૂપની પ્રાપ્તિ સ્વખને પણ નહિ તેને હોય. ૭.

આર્થ: —જે મોહીજીવો પર વસ્તુઓમાં મમતા કરે છે, તેમને
શુદ્ધ ચિદ્બૂપની પ્રાપ્તિ સ્વખનમાં પડો થતી નથી. ૭.

શુભાશુભાનિ કર્માણિ મમ દેહોડપિ વા મમ।
 પિતા માતા સ્વસા ભ્રાતા મમ જાયાત્મજાત્મજઃ ॥૮॥
 ગૌરશ્વોડજો ગજો રા વિરાપણ મંદિરં મમ।
 પૂર્ણ રાજા મમ દેશશ્ર મર્મમત્વમિતિ ચિંતનમ् ॥૯॥યુગ્માં।

કર્મ શુભાશુભ તે સૌ મારાં, શરીર પણ મુજ, મારું નામ,
 માતપિતાદિ ભગ્નિની ભ્રાતા સ્ત્રી પુત્રાદિ મુજ તમામ;
 ગાય અશ્વ અજ ગજ ધન, પક્ષી દુકાન મંદિર મારાં ધામ,
 મારાં દેશ નગર નૃપ આદિ મર્મત્વ એ ચિંતનનું નામ. ૮-૯

આર્થ:—શુભાશુભ કર્મ તે મારાં છે, અથવા શરીર પણ મારું છે. માતા-પિતા, ભાઈ-બહેન મારાં છે. પુત્ર-પુત્રી-સ્ત્રી મારાં છે. ગાય, અશ્વ, બકરો, હાથી, ધન, પક્ષી, દુકાન, મકાન વગેરે મારાં છે. નગર મારું છે. રાજા, દેશ મારાં છે; એવું ચિંતવન તે મર્મત્વ છે. ૮-૯.

નિર્મમત્વેન ચિદ્રૂપપ્રાસિર્જાતા મનીષિણાં।
 તસ્માત્તર્ધિના ચિંત્યં તદેવૈકં સુહૂર્મુહ્દઃ ॥૧૦॥

નિર્મમતાથી ચિદ્રૂપ પ્રાપ્તિ પામ્યા પૂર્વે બહુ મતિમાન;
 તેથી નિર્મમતા ચિંતવવા ક્ષણક્ષણ આત્માર્થી દે ધ્યાન. ૧૦.

આર્થ:—વિદ્વાનોને નિર્મમત્વમાવ વડે ચિદ્રૂપની પ્રાપ્તિ થઈ છે,
 માટે તેના અર્થીએ તે જ એકેને વારંવાર ચિંતવવું જોઈએ. ૧૦.

શુભાશુભાનિ કર્માણિ ન મે દેહોડપિ નો મમ।
 પિતા માતા સ્વસા ભ્રાતા ન મે જાયાત્મજાત્મજઃ ॥૧૧॥

ગૌરશ્વો ગજો રા વિરાપણ મંદિરં ન મે।
 પૂર્ણ રાજા મે ન દેશો નિર્મમત્વમિતિ ચિતનં ॥૧૨॥યુગ્માં।

કર્મ શુભાશુભ તે નહિ મારાં, શરીર પણ નહિ મારું કાંઈ,
 માત પિતા કે ભગ્નિની ભ્રાતા, સ્ત્રી પુત્રાદિ મારાં નાંહિ;

ગાય અશ્વ ગજ ધન પક્ષી દુકાન મંદિર નહિ મુજ ધામ,
દેશ નગર નૃપ પણ મારાં નહિ નિર્મમત્વ ચિંતન એ પામ. ૧૧-૧૨.

આર્થ્ય :—શુભાશુભ કર્મો મારાં નથી, શરીર પણ મારું નથી.
પિતા, માતા, બહેન, ભાઈ, સ્ત્રી, પુત્ર, પુત્રી મારાં નથી. ગાય, અશ્વ,
હાથી, ધન, પક્ષી, બજાર, ધર મારાં નથી. નગર, રાજા, દેશ મારાં નથી;
એવું ચિંતવન તે નિર્મમત્વ છે. ૧૧-૧૨

મમેતિ ચિંતનાદ् બંધો મોચનં ન મમેત્યતઃ ।

બંધનં દ્વ્યક્ષરાભ્યાં ચ મોચનં ત્રિભિરક્ષરૈः ॥૧૩॥

નિર્મમત્વં પરં તત્ત્વં ધ્યાનં ચાપિ વ્રતં સુખં ।

શીલં ખરોધનં તસ્માન્નિર્મમત્વં વિચિંતયેત् ॥૧૪॥

‘મારું’ એ ચિંતનથી બંધન, મોક્ષ ‘ન મારું’ જો દટ થાય,
બંધન ને અક્ષરથી, મુક્તિ પ્રણ અક્ષરથી એમ સધાય;
નિર્મમતા એ પરમતત્વ છે, ધ્યાન વળી વ્રત એ સુખસાર,
શીલ પરમ ઈન્દ્રિયનિગ્રહ એ, તેથી ચિંતન એ ઉર ધાર. ૧૩-૧૪.

આર્થ્ય :—મારું એવા ચિંતવનથી બંધન અને મારું નહિ એવા
ચિંતવનથી મોક્ષ થાય છે, માટે બે અક્ષરો વડે બંધન અને (ન મમ)
ત્રણ અક્ષરથી મોક્ષ થાય છે. ૧૩.

નિર્મમતા તે શ્રેષ્ઠ તત્ત્વ છે, (તે જ) ધ્યાન અને વ્રત, સુખ, શીલ,
(તેમ જ) ઈન્દ્રિયનિરોધ છે, માટે નિર્મમતાનું ચિંતવન કર્તવ્ય છે. ૧૪.

યાતા યે યાંતિ યાસ્યંતિ ભદંતા મોક્ષમવ્યયં ।

નિર્મમત્વેન તે તસ્માન્નિર્મમત્વં વિચિંતયેત् ॥૧૫॥

નિર્મમત્વે તપોઽપિ સ્વાદુત્તમં પંચમં વ્રતં ।

ધર્મોઽપિ પરમસ્તસ્માન્નિર્મમત્વં વિચિંતયેત् ॥૧૬॥

પામ્યા અબ્યય મુક્તિ પામે, વળી પામશે મુનિ બ્રિકાળ:
તે સૌ નિર્મમતાથી, માટે નિર્મમતા-ચિંતન ઉર ધાર.

અધ્યાય-૧૦]

[૮૭]

નિર્મમતાથી તપ ને પંચમવત પરિગ્રહ ત્યાગ ઉદાર;
પરમ ધર્મ પણ પ્રગાટે માટે નિર્મમતા-ચિંતન ઉર ધાર. ૧૫-૧૬.

આર્થ્ય :—જે મુનિઓ અવિનાશી મોક્ષપદ પામ્યા છે, પામે છે (અને) પામશે, તેઓ નિર્મમતાથી (પામ્યા છે, પામે છે અને પામશે), માટે (મોક્ષાભિલાષીઓએ) નિર્મમતવનું જ ચિંતવન કરવું યોગ્ય છે. ૧૫.

નિર્મમતામાં ઉત્તમ તપ અને પાંચમું અપરિગ્રહ ત્રત પણ આવી જશે તેમ જ પરમધર્મ પણ આવી જશે, માટે નિર્મમતવનું જ ચિંતવન કરવું. ૧૬.

નિર્મમત્વાય ન કલેશો નાન્યયાંચા ન ચાટનં ।
ન ચિંતા ન વ્યયસ્તસ્માન્નિર્મમત્વં વિચિંતયેત् ॥૧૭॥
નાસ્ત્રવો નિર્મમત્વેન ન બંધોડશુભકર્મણાં ।
નાસંયમો ભવેત્તસ્માન્નિર્મમભત્વં વિચિંતયેત् ॥૧૮॥

કલેશ નહીં નિર્મમતા માટે, યાચન અવર ખુશામત નાંહિ;
નહિ ચિંતા નહિ ધન કંઈ બેસે નિર્મમતા ચિંતવ ઉર માંહિ.
નિર્મમતાથી આસ્ત્રવ નાંહી, અશુભ કર્મ કંઈ ના બંધાય;
નહીં અસંયમ પણ કંઈ તેથી નિર્મમતા ચિંતવ ઉરમાંય. ૧૭-૧૮

આર્થ્ય :—નિર્મમતવભાવનું ચિંતવન કરવામાં કલેશ થતો નથી, બીજાની પાસે યાચના કરવી પડતી નથી, કોઈની ખુશામદ કરવી પડતી નથી, કંઈ ચિંતા થતી નથી, કંઈ ખર્ચ થતું નથી; માટે નિર્મમતવભાવનું ચિંતવન કરવું. ૧૯.

નિર્મમતથી કર્મના આગમનરૂપ આસ્તવ થતો નથી, અશુભકર્મનો બંધ થતો નથી, અસંયમ થતો નથી, માટે નિર્મમતવભાવનું ચિંતવન કરવું. ૧૮.

સદ્ગુણજ્ઞનવાન् પ્રાણી નિર્મમત્વેન સંયમી ।
તપસ્કી ચ ભવેત् તસ્માન્નિર્મમત્વં વિચિંતયેત् ॥૧૯॥

રાગદ્વેષાદયો દોષા નશયંતિ નિર્મમત્વતः ।
શાસ્ત્ર્યાર્થી સતતં તસ્માન્નિર્મમત્વં વિચિત્યેત ॥૨૦॥

નિર્મમતાથી સમ્યગદિષ્ટ ને જ્ઞાની સંયમી જીવ થાય;
થાય તપસ્વી પણ તે તેથી, નિર્મમતા ચિંતવ સુખદાય,
સર્વ રાગ-દ્રેષાદિ દોષો, નિર્મમતાથી થાય વિનાશ;
શાસ્ત્ર્યાર્થીઓ તેથી સતત આ નિર્મમતા ચિંતવવી ખાસ. ૧૯-૨૦.

અર્થ :—નિર્મમત્વ વડે, જીવ સમ્યગદિષ્ટ, યથાર્થ જ્ઞાની, સંયમી અને તપસ્વી થાય છે, માટે નિર્મમત્વને જ ચિંતવવું. ૧૯.


નિર્મમત્વથી રાગ-દ્રેષ આદિ દોષોનો નાશ થઈ જાય છે, માટે સાભ્ય ઈશ્છનારાઓએ નિર્મમત્વનું સતત ચિંતવન કરવું. ૨૦.

વિચાર્યાસ્થમહંકારમમકારौ વિમુંચતિ ।
યો મુનિઃ શુદ્ધચિદૂપધ્યાનં સ લભતે ત્વરા ॥૨૧॥

(ત્રોટક)

મુનિ એમ વિચારી અહંકૃતિને,
મમકાર અનાદિ અજાગૃતિને;
તજુ આનિક જાગૃતિ શીદ ઘરે,
નિજ નિર્મલ ચિદૂપ ધ્યાન વરે. ૨૧.

અર્થ :—જે મુનિ આ પ્રમાણે વિચારીને અહંકાર અને મમકારનો ત્યાગ કરે છે, તે તરાથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન પામે છે. ૨૧.



અધ્યાય ૧૧ મો

[શુદ્ધ ચિદ્રૂપના ઉપાસકોની વિરલતાનું વર્ણન]

શાંતાઃ પાંડિત્યયુક્તા યમનિયમબલત્યાગરैવૃત્તવંતઃ ।
 સહ્નોશીલાસ્તપોર્ચાનુતિનતિકરણા મૌનિનઃ સંત્યસંખ્યાઃ ।
 શ્રોતારશ્શકૃતજ્ઞા વ્યસનખજયિનોઽત્રોપસર્ગોઽપિધીરા:
 નિઃસંગાઃ શિલ્પિનઃ કશ્ચન તુ વિરલઃ શુદ્ધચિદ્રૂપરક્તઃ ॥૧॥
 ઘણા જગતમાં યમ નિયમ બલ દાન વિત પ્રતવંતાજ્ઞ,
 પંડિત શાંત અસંગી તપ શીલ પૂજા નુતિ નુતિ ચુક્તાજ્ઞ,
 મૌની શ્રોતા વિષયિવિજેતા, ધીર આકૃતદન પ્રવક્તાજ્ઞ,
 કિંતુ કોઈ વિરલ જીવ જગતમાં, નિર્મલ ચિદ્રૂપ રક્તાજ્ઞ. ૧.

અર્થ :—આ સંસારમાં શાંત ચિત્તવાળા, પંડિતાઈવાળા, યમ,
 નિયમ, બળ, ત્યાગ અને ચારિત્રવાળા, ઉત્તમવાણીવાળા, શીલવાન, તપ,
 પૂજા, સ્તુતિ, પ્રશ્નામ કરનારા, મૌન પાળનારા, શ્રવણ કરનારા, ઉપકારને
 ન ભૂલનારા, વ્યસનો અને ઈન્દ્રિયોને જીતનારા, ઉપસર્ગના સમૂહને
 સહન કરવામાં ધીર, પરિશહે રહિત અને કળાકારો અગણિત છે; પરંતુ
 શુદ્ધ ચિદ્રૂપમાં અનુરક્ત કોઈક જ ભાગ્યે જ હોય છે. ૧.

યે ચैત્યાલયચैત્યદાનમહસ્દ્યાત્રા કૃતૌ કૌશલા
 નાનાશાસ્ત્રવિદઃ પરીષહસહા રક્તાઃ પરોપકૃતૌ ।
 નિઃસંગાશ્ચ તપસ્વિનોપિ બહવસ્તે સંતિ તે દુર્લભા
 રાગદ્રોષવિમોહવર્જનપરાશ્રિતત્વલીનાશ યે ॥૨॥

મંદિર પ્રતિમા સ્થાપન તીરથ ચાંદ્ર દાન પ્રવીણાજ્ઞ,
 ઘણા શાસ્ત્રના ઝાતા પરિષહજ્ય પરહિતમાં લીનાજ્ઞ;

ઘણા દીસે નિઃસંગી તપસ્વી પણ કો વિરલ વિલીનાજી,
રાગ-દ્રેષ વિમોહ વર્જને, નિજ ચિદૂપ તલીનાજી. ૨.

આર્થ :—જેઓ દેવ મંદિર, પ્રતિમા, દાન, ઉત્સવ, તીર્થયાત્રા આદિ કાર્યોમાં પ્રવીણ છે, અનેક શાખોના જાણકાર છે, પરિષહ સહન કરવામાં સમર્થ છે, પરોપકારના કામમાં રત છે, પરિશ્રહ રહિત છે અને તપસ્વીઓ પણ છે એવા ઘણા છે અને જે રાગ-દ્રેષ-મોહને તજવામાં કુશળ થયેલા તેમ જ આત્મતત્ત્વમાં લીન તે દુર્લભ છે. ૨.

ગણકચિકિત્સકતાર્કિકપૌરાણિકવાસ્તુ શબ્દશાસ્ત્રજ્ઞાઃ ।

સંગીતાદિષુ નિપુણાઃ સુલભા ન હિ તત્ત્વવેત્તારાઃ ॥૩॥

સુરૂપબલલાવણ્યધનાપત્યગુણાન્વિતાઃ ।

ગાંભીર્યધૈર્યધૌરેયાઃ સંત્યસંબ્યા ન ચિદ્રતાઃ ॥૪॥

જ્યોતિષી, વૈદ્ય, જ્યાય, પુરાણો, શબ્દશાસ્ત્ર વિષ્યાતાજી,
સંગીત કે વિજ્ઞાન નિપુણ બહુ, વિરલ તત્ત્વના જ્ઞાતાજી. ૩.

સુંદર રૂપ લાવણ્ય કનક બલ અપત્ય ગુણગણયુક્તાજી,
ધીર વીર ગાંભીર ઘણાયે, પણ નહિ ચિદૂપ રક્તાજી. ૪.

આર્થ :—ગણિતશાસ્ત્રી, જ્યોતિષી, વૈદ્ય, નૈયાયિક, પુરાણોના જ્ઞાતા, વાસ્તુશાસ્ત્રના જ્ઞાતા (ઈજનેર), વ્યાકરણ શાસ્ત્રના જાણનાર, સંગીત આદિમાં નિપુણ મળવા સહેલા છે, પરંતુ તત્ત્વને જાણનાર મળવા સહેલા નથી. ૩.

સારું રૂપ, બળ, લાવણ્ય, ધન, સંતાન, ગુણાદિથી યુક્ત, ગાંભીર્ય
અને ધૈર્યના ધારક, અસંખ્ય છે પણ આત્મસ્વરૂપમાં રક્ત ઘણા
નથી. ૪.

જલદ્વૂતવનસ્ત્રીવિયુદ્ધગોલકગીતિષુ ।

ક્રીડંતોઽત્ર વિલોક્યંતે ઘનાઃ કોઽપિ ચિદાત્મનિ ॥૫॥

સિંહસર્પગજવ્યાઘ્રાહિતાદીનાં વશીકૃતૌ ।
રતાઃ સંત્યત્ર બહવો ન ધ્યાને સ્વચિતાત્મનઃ ॥૬॥

જલ વન વનિતા ધૂત પંખી કે યુદ્ધકળા સંગીતેજુ;
દીસે ધણા રમતા પણ વિરતા ચિદ્રૂપમાં દટ પ્રીતેજુ,
સિંહ સર્પ ગજ વ્યાઘ્ર અહિતકર અરિ વશ કરવા વર્તેજુ,
બહુ અહા! અહીં પણ નિજ ચિદ્રૂપ-ધ્યાને વિરલ પ્રવર્તેજુ. ૫-૬.

આર્થ:—જળ, જુગાર, વન, સ્ત્રી, પક્ષી, યુદ્ધ, ગોળીથી નિશાન વિધવાની વિદ્યા અને સંગીતમાં ધણા આ જગતમાં રમતા દેખાય છે, પરંતુ ચૈતન્યમય આત્મામાં રમતા કોઈક જ છે. ૫.

અહીં સિંહ, સર્પ, હાથી, વાધ, શત્રુ આહિને વશ કરવામાં રક્ત ધણા છે, (પણ) ચિદાત્માના ધ્યાનમાં રક્ત નથી. ૬.

જલાગ્નિરોગરાજાહિચૌરશત્રુનભસ્વતાં ।

દૂશ્યંતે સ્તંભને શક્તાઃ નાન્યસ્ય સ્વાત્મચિંતયા ॥૭॥

પ્રતિક્ષણં પ્રકુર્વાતિ ચિંતનં પરવસ્તુનઃ ।

સર્વે વ્યામોહિતા જીવાઃ કદા કોડપિ ચિદાત્મનઃ ॥૮॥

અહિન રોગ જલ નૃપ અરિ વાયુ ચોર થંભવા શૂરાજુ;
બહુ અહા! પણ આત્મધ્યાનથી કર્મ ન કરતા ચૂરાજુ.
મોહવશે નિજ ભાન ભૂલેતા, ક્ષણકણ ચિંતન કરતાજુ;
સર્વ અન્ય વસ્તુનું, વિરલ કો, નિજ ચિંતન મન ધરતાજુ. ૭-૮.

આર્થ:—(જીવો) જળ, અહિન, રોગ, રાજા, સર્પ, ચોર, શત્રુ અને પવનને રોકવામાં સમર્થ જણાય છે, (પણ) સ્વાત્મધ્યાનથી પરને (કર્મને) રોકવામાં સમર્થ જણાતા નથી. ૭.

સર્વ વ્યામોહ પામેલા જીવો પરવસ્તુના ચિંતનને ક્ષણે ક્ષણે કરે છે,
પરંતુ ચિદાત્માનું ચિંતન કોઈ વાર કોઈક જ કરે છે. ૮.

દૃશ્યંતે બહવો લોકે નાનાગુણવિભૂષિતાઃ ।

વિરલાઃ શુદ્ધચિદૂપે સ્નેહયુક્તા વ્રતાન્વિતાઃ ॥૬॥

દીસે જગતમાં બહુજન નાના ગુણાણ ભૂષિત આજેજુ,
પરા નિર્મલ ચિદૂપમાં પ્રેમી, વ્રતયુત વિરલ વિરાજેજુ. ૮.

આર્થ :—લોકમાં અનેક પ્રકારના ગુણોથી શોભતા ઘણા દેખાય છે પણ શુદ્ધ આત્મસ્વરૂપમાં પ્રીતિવાળા, વ્રતવાળા સંયમીઓ વિરલા જ દેખાય છે. ૮.

એકેન્દ્રિયાદસંજ્ઞાખ્યાપૂર્ણપર્યતદેહિનઃ ।

અનંતાનંતમાઃ સંતિ તેષુ ન કોઈપિ તાદૂશઃ ॥૧૦॥

પંચાક્ષિસંજ્ઞિપૂર્ણેષુ કેચિદાસન્નભવ્યતાં ।

નૃત્વં ચાલભ્ય તાદૂક્ષા ભવંત્વાર્યાઃ સુબુદ્ધ્યઃ ॥૧૧॥

એકેન્દ્રિયથી માંડી અસંજી પંચેન્દ્રિય પર્યતાજુ;
જીવ અનંતાનંત છતાં ના કોઈ સ્વરૂપ રચિવંતાજુ.
પંચેન્દ્રિય મનસહિત જીવોમાં નિકટભવી નરદેહેજુ;
આર્થ કોઈ વિરલા સદબુદ્ધિ વર્તે ચિદૂપ સ્નોહેજુ. ૧૦-૧૧.

આર્થ :—એકેન્દ્રિય જીવોથી માંડીને અસંજી (મનરહિત) નામથી ઓળખાતા પર્યાપ્ત જીવો સુધી અનંતાનંત છે, તેમાં તેવો (-આત્મ-રચિવાળો) કોઈ પણ (જીવ) નથી. ૧૦.

મનવાળા પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોમાં કેટલાક આસન્નભવ્યપણું (તરત મોક્ષ પામવાની યોગ્યતા) અને નરભવ ન પામીને તેવા (અયોગ્ય) છે. આર્થ, સમ્યક્, બુદ્ધિવાળા કોઈક જ તેવી યોગ્યતાવાળા થાય છે. ૧૧.

શુદ્ધચિદૂપસંલીનાઃ સવ્રતા ન કદાચન ।

નરલોકબહિર્ભાગેઽસંખ્યાતદ્વીપવાર્ધિષુ ॥૧૨॥

અટી દીપ નર લોક મૂકીને દીપ સમુદ્ર અગાણિતાજુ;
કદી કોઈ ત્યાં નિર્મલ ચિદૂપ તલ્લીન નહિ વ્રત સહિતાજુ. ૧૨.

આર્થ :—શુદ્ધ ચિદ્બૂપમાં તત્ત્વીન પ્રતસહિત એવા જીવો મનુષ્યલોકથી બહારના ભાગમાં અસંખ્યાત દીપ સમુદ્રોમાં કદાપિ હોતા નથી. ૧૨.

અધોલોકે ન સર્વસ્મિન્નર્ધ્વલોકેઽપિ સર્વતઃ ।

તે ભર્વંતિ ન જ્યોતિષ્કે હા હા ક્ષેત્રસ્વભાવતઃ ॥૧૩॥

સર્વ ઊર્ધ્વ કે અધોલોકમાં કોઈ સ્થળે નહિ તેવાજુ; ક્ષેત્ર સ્વભાવે મળે ન હા! હા! જ્યોતિષ્કે પણ એવાજુ. ૧૩.

આર્થ :—અત્યંત ખેદની વાત છે કે ક્ષેત્રનો એવો જ સ્વભાવ હોવાથી સમસ્ત અધોલોકમાં અને સમસ્ત ઊર્ધ્વલોકમાં પણ તે (તેવી યોગ્યતાવાળા) નથી અને જ્યોતિષ લોકમાં (સૂર્ય, ચંદ્રાદિ છે તે ક્ષેત્રમાં) પણ તે હોતા નથી. ૧૩.

નરલોકેપિ યે જાતા નરાઃ કર્મવશાદ્ ઘનાઃ ।

ભોગભૂમલેચ્છખંડેષુ તે ભર્વંતિ ન તાદૃશઃ ॥૧૪॥

નરલોકે પણ મલેચ્છ ખંડ કે જન્મયા ભોગભૂમિમાંજુ; કર્મવશો હા! ઘણા જીવો પણ કોઈ ન તેવા તેમાંજુ. ૧૪.

આર્થ :—મનુષ્ય લોકમાં પણ જે ઘણા મનુષ્યો કર્મવશો ભોગભૂમિ કે અનાર્ય ખંડોમાં જન્મયા છે, તે તેવા (આત્મલીનતાને યોગ્ય) હોતા નથી. ૧૪.

આર્યખંડભવાઃ કેचિદ् વિરલાઃ સંતિ તાદૃશાઃ ।

અસ્મિન् ક્ષેત્રે ભવા દ્વિત્રાઃ સ્યુરદ્ય ન કદાપિ વા ॥૧૫॥

આર્યખંડ ઉત્પન્ન વિષે પણ તેવા વિરલ પ્રવર્તેજુ;

આ ક્ષેત્રે આજે બે ગ્રણ તો કદી કોઈના વર્તેજુ. ૧૫.

આર્થ :—આર્યખંડમાં જન્મેલા તેવા કોઈક વિરલ હોય છે. આ ભરતક્ષેત્રમાં જન્મેલા આજે બે કે ત્રણ હોય અથવા કદાચ ન પણ હોય. ૧૫.

અસ્મિન् ક્ષેત્રે ઽધુના સંતિ વિરલા જૈનપાક્ષિકા: |
સમ્યક્ત્વસહિતાસ્તત્ર તત્ત્વાણુવ્રતધારિણ: ||૧૬||

મહાવ્રતધરા ધીરા: સંતિ ચાત્યંતદુર્લભા: |
તત્ત્વાત્ત્વવિદસ્તેષુ ચિદ્રક્તો ઽત્ત્વંતદુર્લભઃ: ||૧૭||

આ ક્ષેત્રે આજે છે કોઈક પાક્ષિક જૈનો વિરલાજી;
સદ્ગુણિ ત્યાં વિરલા, તેમાં અણુવ્રતધારી વિરલાજી. ૧૬.

તેમાં અતિ દુર્લભ તો મહાવ્રતધારી ધીર વિરક્તાજી;
દુર્લભ તત્ત્વાત્ત્વ વિડાની, અતિ દુર્લભ ચિદ્રક્તાજી. ૧૭.

અર્થ :—આ ક્ષેત્રે હમણાં જૈનમાર્ગ સત્ય છે એવા નિશ્ચયપૂર્વક
પક્ષ કરનાર થોડા છે, તેમાં સમ્યક્ત્વ સહિત થોડા છે, તેમાં ગૃહસ્થના
અણુવ્રત ધારણ કરનારા થોડા છે, તેના કરતાં પણ મહાવ્રતને ધારણ
કરનારા ધીર અત્યંત દુર્લભ છે, તેઓમાં પણ તત્ત્વ અને અત્ત્વને
જાણનાર બહુશુદ્ધ જ્ઞાની દુર્લભ છે, તેઓમાં પણ ચિદ્રૂપમાં રક્ત અત્યંત
દુર્લભ છે. ૧૬-૧૭.

તપસ્વિપાત્રવિદ્રત્સુ ગુણિસદ્ગતિગામિષુ |
વંદ્યસ્તુત્યેષુ વિજ્ઞેય: સ એવોકૃષ્ટતાં ગત: ||૧૮||

સર્વ તપસ્વી પાત્ર વિબુધ કે સદ્ગુણી સદ્ગતિગામીજી;
વંદ્ય સ્તુત્ય સર્વેમાં જાણો શ્રેષ્ઠ એ જ ચિદ્રરામીજી. ૧૮.

અર્થ :—તપસ્વી, પાત્ર અને વિદ્વાનોમાં, ગુણવાન અને
સદ્ગતિગામીઓમાં, વંદનીય અને સ્તુત્ય પુરુષોમાં તે જ ઉત્કૃષ્ટતા પામેલ
જાણવા. ૧૮.

ઉત્સર્પિણ્યવસર્પણકાલે ઽનાદ્યંતવર્જિતે સ્તોકા: |
ચિદ્રક્તા વ્રતયુક્તા ભવંતિ કેચિલકદાચિચ્ચ ||૧૯||
ઉત્સર્પણી અવસર્પણી સર્વે કાળ અનાદિ અનંતાજી;
તેમાં અત્ય કોઈ કદી થાતા ચિદ્રૂપરત વ્રતવંતાજી. ૧૯.

આર્થ :—અનાદિ અનંત એવા ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં આત્મપ્રેમી અને વ્રત સહિત કોઈ જ કોઈ કાળમાં જ થોડા થાય છે. ૧૮.

મિથ્યાત્વાદિગુણસ્થાનચતુજ્કે સંભવંતિ ન।

શુદ્ધચિદ્રૂપકે રક્તા વ્રતિનોપિ કદાચન ॥૨૦॥

પંચમાદિગુણસ્થાનદશકે તાદૃશોऽગ્નિઃ ।

સ્યुરિતિ જ્ઞાનિના જ્ઞેયં સ્તોકજીવસમાશ્રિતે ॥૨૧॥

મિથ્યાત્વાદિ પ્રથમ ચાર ગુણસ્થાને જે જે વર્તેજુ; ત્યાં ન કદી તે ચિદ્રૂપ દ્યાને કે વ્રતમાંઠી પ્રવર્તેજુ. ૨૦.

પંચમથી ગુણસ્થાન ચતુર્દશમાં વ્રત દ્યાન વિરાજેજુ; જ્ઞાની જાણે અથ્વ જીવો તો તે ગુણસ્થાને રાજેજુ. ૨૧.

આર્થ :—શુદ્ધ ચિદ્રૂપમાં તલ્વીન અને વ્રત-સંયમવાળા એવા જીવો મિથ્યાત્વ આદિ ચાર ગુણસ્થાનમાં કદી પણ થવા સંભવતા નથી. ૨૦.


થોડા જીવ જેમાં વર્તે છે એવા પાંચમાથી ચૌદ્ધમા સુધીના દશ ગુણસ્થાનમાં તેવા જીવો હોય છે, એમ જ્ઞાનીઓએ જાણવા યોગ્ય છે. ૨૧.

દૃશ્યંતે ગંધનાદાવનુજસુતસુતાભીરુપિત્રંવિકાસુ
ગ્રામે ગેહે ખભોગે નગનગરખંગે વાહને રાજકાર્યે ।
આહાર્યોઽગે વનાદૌ વ્યસનકૃષિમુહેકૂપવાપીતડાગે
રક્તાશ્રપ્રેષણાદૌ યશસ્વિ પણુગણે શુદ્ધચિદ્રૂપકે ન ॥૨૨॥

દિસે રક્ત ધણા જ્યાં જગમાં વિષય વાસના ગંધેજુ,
લઘુ ભ્રાતા સુત સુતા વનિતા માતપિતા સંબંધેજુ;
ગ્રામ ધામ ને ગાગન વિછારે, પર્વ પક્ષી નગરેજુ,
રાજકાર્ય વન વાહનમાં વળી ખાનપાન કે શરીરેજુ;

વ્યસન-રંગ વાણિજ્ય કૃષિ કે કૂવા વાવ તલાવેજુ,
પશુ ચશ રક્ષામાં રારચા ત્યાં ચિદ્ગ્રાપે ચિત્ત ન લાવેજુ. ૨૨.

આર્થી :—સુગંધી પદાર્થો આદિમાં, ભાઈ, પુત્ર, પુત્રી, સ્ત્રી, પિતા તથા માતામાં, ગામમાં, ઘરમાં, ઈન્દ્રિયના વિષયભોગમાં, પર્વત, નગર, પક્ષીમાં, વાહનમાં, રાજ્યના કામમાં, ખાનપાન આદિ પદાર્થોમાં, શરીરમાં, વન આદિમાં, વ્યસન, ખેતી આદિમાં, કૂવા-વાવ-તળાવમાં, ધંધામાં, દલાલીમાં, યશમાં અને પશુના સમૂહમાં જીવો રાચી રહેલા દેખાય છે પણ શુદ્ધ આત્મસ્વરૂપમાં રક્ત દેખાતા નથી. ૨૨.



અધ્યાય ૧૨ મો

[શુદ્ધ ચિદૂપની પ્રાપ્તિનું અસાધારણ કારણ રત્તત્રય]

રત્તત્રયોપલંભેન વિના શુદ્ધચિદાત્મનઃ ।
પ્રાદુર્ભાવો ન કસ્યાપિ શ્રૂયતે હિ જિનાગમે ॥૧॥

રત્તનત્રયની પ્રાપ્તિ વિના તો કોઈને તત્ત્વ અનૂપ;
પ્રગાટ થયું સુણ્યું નહિ જિનશાસ્ત્રે શુદ્ધ ચિદાત્મસ્વરૂપ રે.
ભવિકા રત્તનત્રય આદરિયે. ૧.

અર્થ :—રત્તત્રયની પ્રાપ્તિ વિના શુદ્ધ ચૈતન્યમય આત્માની
પ્રગટતા કોઈને પણ થઈ નથી, એમ જિનશાસ્ત્રમાં સાંભળ્યું છે. ૧.

વિના રત્તત્રયં શુદ્ધચિદૂપં ન પ્રપત્તવાન् ।
કદાપિ કોડપિ કેનાપિ પ્રકારેણ નર: ક્વચિત ॥૨॥
કોઈ પ્રકારે કચાંય કદાચિત્ પાખ્યા નહિ નર કોય;
રત્તનત્રય વિણ નિર્મળ નિજ ચિદ-રૂપ પ્રગાટ નહિ હોય.
ભવિકા રત્તનત્રય આદરિયે. ૨.

અર્થ :—કોઈ પણ કાળે, કોઈ પણ મનુષ્ય, કચાંય કોઈ પણ
પ્રકારે, રત્તત્રય વગર શુદ્ધ ચિદૂપને પાખ્યો નથી. ૨.

રત્તત્રયાદ્વિના ચિદૂપોપલબ્ધિન જાયતે ।
યથર્દ્વિસ્તપસ: પુત્રી પિતુર્વસ્ત્રિબલાહકાત ॥૩॥

તાત વિના જેમ પુત્રી ન જન્મે, તપ વિણ જેમ ન અધિક;
મેઘ વિના વૃષ્ટિ ન, રત્તનત્રય,—વિણ ચિદૂપની લભિ રે.
ભવિકા રત્તનત્રય આદરિયે. ૩.

અર્થ :—જેમ તપ વિના ઋક્ષિ પ્રગટતી નથી, પિતા વિના પુત્રી પ્રગટતી નથી અને વાદળાં વિના વરસાદ થતો નથી, તેમ રત્નત્રય વિના ચિદ્રૂપની પ્રાપ્તિ થતી નથી. ૩.

दर्शनज्ञानचारित्रस्वरूपात्मप्रवर्तनं ।
युगपद् भण्यते रत्नत्रयं सर्वजिनेश्वरैः ॥૪॥

દર્શનજ્ઞાન ચારિત્રસ્વરૂપે આત્મા યુગપદ વર્તે;
આત્મપ્રવર્તન તે રત્નત્રય, જિનવર વચન પ્રવતેરે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૪.

અર્થ :—દર્શન, જ્ઞાન, ચારિત્રસ્વરૂપે આત્માનું એકસાથ જે પ્રવર્તન તેને સર્વ જિનેશ્વરો રત્નત્રય કહે છે. ૪.

निश्चयव्यवहाराभ्यां द्विधा तत्परिकीर्तिं ।
सत्यस्मिन् व्यवहारे तन्निश्चयं प्रकटीभवेत् ॥૫॥

નિશ્ચય ને વ્યવહાર રત્નત્રય, બે ભેદે એ ભાણ્યું,
એ વ્યવહાર હોય ત્યાં નિશ્ચય, પ્રગટે કારણ દાણ્યું રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૫.

અર્થ :—તે રત્નત્રય નિશ્ચય અને વ્યવહાર એમ બે ભેદે વર્ણાયું છે. જ્યાં એ વ્યવહારરૂપ રત્નત્રય હોય ત્યાં તે નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. ૫.

श્રદ્ધાનં દર્શનં સપ્તતત્ત્વાનાં વ્યવહારતः ।
अષ્ટાંગं ત્રિવિદં પ્રોક્તं તદौપશમિકાદિતः ॥૬॥

સાત તત્ત્વની શ્રદ્ધા જાણો, સદ્દર્શન વ્યવહારે;
આઠ અંગાચુત ને વળી ઉપશમ આદિ પ્રણ પ્રકારે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૬.

આર્થ :—સાત તત્ત્વોની શ્રદ્ધાને વ્યવહારથી દર્શન કર્યું છે, તે આઈ અંગયુક્ત છે. તેને ઉપશમ આદિ ભેદથી ત્રણ પ્રકારનું કર્યું છે. ૬.

સતા વસ્તુનિ સર્વાણિ સ્યાચ્છબ્દેન વચાંસિ ચ ।

ચિતા જગતિ વ્યાપ્તાનિ પશ્યન્ સદ્ગુષ્ટિરુચ્યતે ॥૭॥

સત્ રૂપે વસ્તુ સૌ શ્રદ્ધે, સ્યાદ્વાદે સૌ વાણી;
જ્ઞાનદટ્ટિથી જગ સૌ જોતાં, તે સદ્ગુષ્ટિ જ્ઞાની રે.
ભવિકા રત્નગ્રાય આદર્શિયે. ૭.

આર્થ :—સર્વ વસ્તુઓને અસ્તિત્વ સ્વરૂપે જોતાં—શ્રદ્ધતા અને (તેના વાચક) વચ્ચનોને સ્યાદ્વાદ એટલે અનેકાંતદટ્ટિએ (અને) જગતમાં વ્યાપેલ સર્વ પદાર્થોને જ્ઞાનદટ્ટિએ જોનાર સમ્યગુષ્ટિ કર્ણેવાય છે. ૭.

સ્વકીયે શુદ્ધચિદ્બૂપે રૂચિર્યા નિશ્ચયેન તત્ ।

સદ્ગુષ્ટનિં મતં તજ્જૈઃ કર્મધનહૃતાશનં ॥૮॥

સહજ આત્મ નિજ રૂપ વિષે જે, રૂચિ તે સદ્ગુષ્ટનિને;
નિશ્ચયથી જ્ઞાનીઓ માને, બાળે કર્મ ઈધનને રે.

ભવિકા રત્નગ્રાય આદર્શિયે. ૮.

આર્થ :—પોતાના શુદ્ધ ચિદ્બૂપમાં જે રૂચિ તેને તેના જાણનાર જ્ઞાનીઓ નિશ્ચયથી કર્મરૂપ ઈધનને બાળનાર અજિન સમાન સમ્યગુષ્ટન કર્ણે છે. ૮.

યદિ શુદ્ધ ચિદ્બૂપં નિં સમસ્તં ત્રિકાલગં યુગપત્ ।

જાનન્ પશ્યન્ પશ્યતિ તદા સ જીવઃ સુદૃક્ત તત્ત્વાત् ॥૯॥

પ્રણે કાલવતી નિજ ચિદ્બૂપ શુદ્ધ સર્વ એક સાથે;
જાણે દેખે જે શ્રદ્ધે તે સદ્ગુષ્ટિ પરમાર્થે રે;
ભવિકા રત્નગ્રાય આદર્શિયે. ૯.

આર્થ :—જ્યારે પોતાનાં ત્રિકાળવર્તી શુદ્ધ ચિદ્રૂપને એકસાથે જાણતાં, દેખતાં જુઓ છે—શ્રદ્ધે છે ત્યારે તે જીવ પરમાર્થે સમ્યગદષ્ટિ છે. ૮.

જ્ઞાત્વાષ્ટાંગાનિ તસ્યાપિ ભાષિતાનિ જિનાગમે ।

તैરમા ધ્યાર્યતે તદ્ધિ મુક્તિસૌખ્યાભિલાષિણા ॥૧૦॥

સદ્ગર્દનનાં આઈ અંગ કે જિન શાસ્ત્રો વિસ્તરતાં,
મુક્તિ-સુખ-વાંછક તે જાણી, દર્શન તે ચુત ધરતા રે.
ભવિકા રન્નત્રય આદરિયે. ૧૦.

આર્થ :—જિનાગમમાં કહેલાં સમ્યગદર્શનના આઈ અંગોને જાણીને મોક્ષ સુખના અભિલાષીએ તે સમ્યગદર્શનને તે અંગો સાથે ધારણ કરવું. ૧૦.

અષ્ટધાચારસંયુક્તં જ્ઞાનમુક્તં જિનેશિના ।

વ્યવહારનયાત् સર્વતત્ત્વોદ્ગાસો ભવેદ् યતઃ ॥૧૧॥

સ્વસ્વરૂપપરિજ્ઞાનં તજ્જાનં નિશ્ચયાદ् વરં ।

કમરીણૂચ્યયે વાતં હેતું વિદ્ધિ શિવશ્રિયઃ ॥૧૨॥

અષ્ટવિધ આચાર સહિત કે જ્ઞાન જિનેન્દ્ર વખાણે,
તે વ્યવહારનયે, જીવ તેથી, સર્વ તત્ત્વને જાણે રે.
ભવિકા રન્નત્રય આદરિયે. ૧૧.

સ્વસ્વરૂપનું જ્ઞાન ચયાતથ્ય, તે નિશ્ચયે વર જ્ઞાન;
પવન કર્મ-૨૪ દૂર કરવા તે, મુક્તિલક્ષ્મી નિદાન રે.

ભવિકા રન્નત્રય આદરિયે. ૧૨.

આર્થ :—જિનેન્દ્રદેવે વ્યવહારનયથી આઈ પ્રકારના આચાર સહિત જ્ઞાનનું કથન કર્યું છે, જેનાથી સર્વ તત્ત્વનું જ્ઞાન થાય છે. ૧૧.

પોતાના સ્વરૂપનું જ્ઞાન તે (જ્ઞાન) નિશ્ચયથી શ્રેષ્ઠ છે.

(તેને) તું કર્મરજને ઉડાડવા માટે પવન સમાન મોક્ષલક્ષ્મીનું કારણ જાણ. ૧૨.

યદિ ચિદ્રૂપેઽનુભવો મોહાભાવે નિજે ભવેત્તત્વાત् ।
તત્પરમજ્ઞાનं સ્યાદ् બહિરંતરસંગમુક્તસ્ય ॥૧૩॥

બહિરંતર સૌ સંગ ત્યાગીને મોહકાયે જ્યાં થાયે,
નિજ ચિદ્રૂપ અનુભવ નિશ્ચે, પરમ ઝાન કહેવાયે રે.
ભવિકા રત્નાગ્રય આદરિયે. ૧૩.

આર્થ :—બાધ અને અંતરસંગથી રહિત પુરુષને જ્યારે મોહનો ક્ષય થાય (છે) ત્યારે પોતાના ચિદ્રૂપમાં અનુભવ થાય (છે) અને નિશ્ચયથી તે પરમજ્ઞાન થાય છે. ૧૩.

નિર્વિત્તિર્યત્ર સાવદ્યાત् પ્રવૃત્તિ: શુભકર્મસુ ।
ત્રયોદશપ્રકારં તત્ત્વારિત્રં વ્યવહારતः ॥૧૪॥

અશુભ કર્મથી જ્યાં નિવૃત્તિ શુભમાં પ્રવૃત્તિ ધારે;
તે ચારિત્ર કહું વ્યવહારે, ઝાનીએ તેર પ્રકારે રે.
ભવિકા રત્નાગ્રય આદરિયે. ૧૪.

આર્થ :—જ્યાં પાપથી નિવૃત્તિ અને શુભ કર્મોમાં પ્રવૃત્તિ છે. તે તેર પ્રકારનું વ્યવહારથી ચારિત્ર છે. ૧૪.

મૂલોત્તરગુણાનાં યત્યાલનં મુક્તયે મુને: ।
દૃશા જ્ઞાનેન સંયુક્તં તત્ત્વારિત્રં ન ચાપરં ॥૧૫॥

સમ્યગ્રદર્શિન ઝાન સહિત જે, મૂલોત્તર ગુણ પાલે;
તે ચારિત્ર, અવર નહિં, મુનિને, મુક્તિશ્રી સુખ આલે રે.
ભવિકા રત્નાગ્રય આદરિયે. ૧૫.

આર્થ :—જે દર્શન અને જ્ઞાનસહિત મૂળ અને ઉત્તર ગુણોનું પાલન છે, તે ચારિત્ર મુનિની મુક્તિનું કારણ છે પણ બીજું નહિ. ૧૫.

સંગ મુક્ત્વા જિનાકારં ધૃત્વા સાથ્ય દૂશં ધિયં ।
ય: સ્પરેત્ શુદ્ધચિદૂપં વૃત્તં તસ્ય કિલોત્તમં ॥૧૬॥

સંગ તજુ જ્ઞિનમુદ્રા ધારી, સમતા દર્શન જ્ઞાને;
ચિદૂપ શુદ્ધ સ્પરે ત્યાં તેને, ચારિત્ ઉત્તમ દ્વાને રે,
ભવિકા રત્નાત્રય આદરિયે. ૧૬.

અર્થ :—જે જીવ સંગ (પરિશહે) છોડીને, વીતરાગ મુદ્રા ધારણ કરી, સમતાભાવ (ચારિત્), દર્શન, જ્ઞાન ધારણ કરીને શુદ્ધ ચિદૂપનું ચિંતવન કરે છે તેનું ચારિત્ ખરેખર ઉત્તમ છે. ૧૬.

જાસ્ત્યા દૃષ્ટ્યા યુતં સમ્યક્ ચારિત્રં તત્ત્વિરુચ્યતે ।
સતાં સેવ્ય જગત્પૂજ્યં સ્વર્ગાદિસુખસાધનં ॥૧૭॥

દર્શન જ્ઞાન સંયુત તે સમ્યક્ ચારિત્ જ્ઞાની વખાણે;
સેવ્ય સંતને જગત પૂજ્ય એ સ્વર્ગ મોક્ષ સુખ આણે રે.
ભવિકા રત્નાત્રય આદરિયે. ૧૭.

અર્થ :—જે જ્ઞાન અને દર્શન સહિત હોય તે સમ્યક્ચારિત્ કહેવાય છે. તે સંતોષે સેવવા યોગ્ય, જગતમાં પૂજ્ય અને સ્વર્ગાદિ સુખનું સાધન છે. ૧૭.

શુદ્ધ સ્વે ચિત્તવરૂપે યા સ્થિતિરત્યંતનિશ્ચલા ।
તત્ત્વારિત્રં પરં વિદ્ધિ નિશ્ચયાત્ કર્મનાશકૃત् ॥૧૮॥

નિજ સહજાત્મ સ્વરૂપે અતિ જે નિશ્ચલ સ્થિતિ પમાય,
નિશ્ચયથી ચારિત્ પરમ તે કર્મનાશ ત્યાં થાય રે.
ભવિકા રત્નાત્રય આદરિયે. ૧૮.

અર્થ :—પોતાના સહજ ચૈતન્યસ્વરૂપમાં જે અત્યંત નિશ્ચળ સ્થિતિ, તેને નિશ્ચયનયથી શ્રેષ્ઠ ચારિત્, કર્મનો નાશ કરનાર તું જાણ. ૧૮.

યજિ ચિદ્રૂપે શુદ્ધે સ્થિતિર્નિજે ભવતિ દૃષ્ટિબોધબલાત् ।
પરદ્રવ્યાસ્મરણં શુદ્ધનયાદંગિનો વૃત્તં ॥૧૬॥

તત્પ્રદિન ને બોધ બળે જો નિજ સહજાત્મસ્વરૂપે;
સ્થિતિ થાય, પરદ્રવ્ય સ્મરણ ના, નિશ્ચયે ચરણ ગાન્ધૂપ રે.
ભવિકા રત્નાત્રય આદરિયે. ૧૮.

આર્થ :—દર્શન અને જ્ઞાનના બળથી જ્યારે નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિ થાય છે, ત્યારે પરદ્રવ્યનું વિસ્મરણ તે શુદ્ધનયથી પ્રાણીને ચારિત્ર છે.

રત્નત્રયં કિલ જ્ઞેયં વ્યવહારં તુ સાધનં ।
સદ્ભિશ્ચ નિશ્ચયં સાધ્યં મુનીનાં સદ્ગ્રિભૂષણં ॥૨૦॥

એ વ્યવહાર રત્નાત્રય સાધન નિશ્ચયનું જન જાણો;
સાધ્ય સંતને નિશ્ચય તે તો મુનિનું ભૂષણ વખાણો રે.
ભવિકા રત્નાત્રય આદરિયે. ૨૦.

આર્થ :—વ્યવહાર રત્નત્રય માત્ર સાધન અને મુનિઓનું સત્ત વિભૂષણરૂપ નિશ્ચય તે સાધ્ય છે, એમ વિદ્વાનોએ જાણવું. ૨૦.

રત્નત્રયં પરં જ્ઞેયં વ્યવહારં ચ નિશ્ચયં ।
નિદાનં શુદ્ધચિદ્રૂપસ્વરૂપાત્મોપલબ્ધયે ॥૨૧॥


આ વ્યવહાર નિશ્ચય રત્નાત્રય પરમ હેતુરૂપ જાણો;
નિર્મલ ચિદ્રૂપ સ્વરૂપ પ્રગટવા, તે આત્મિક સુખ માણે રે.
ભવિકા રત્નાત્રય આદરિયે. ૨૧.

આર્થ :—શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ માટે વ્યવહાર અને નિશ્ચય રત્નત્રયને શ્રેષ્ઠ કારણ જાણવું. ૨૧.

સ્વશુદ્ધચિદ્રૂપપરોપલબ્ધિ કસ્યાપિ રત્નત્રયમંતરેણ ।
કવચિલ્કદાચિન્ન ચ નિશ્ચયો દૃઢોઽસ્તિ ચિત્તે મમ સવદૈવ ॥૨૨॥

નિજ સહજાત્મસ્વરૂપની પ્રાપ્તિ રત્નઅય વિષા કદિયે,
થાય ન ક્યાંય કોઈને દટ એ નિશ્ચય મુજ હુદ્યે રે.
ભવિકા રત્નઅય આદરિયે. ૨૨.

આર્થ :—તેથી મારા ચિત્તમાં સર્વદા દૃઢ નિશ્ચય છે કે રત્નઅય
વિના કોઈને પણ ક્યાંય કરી પણ સ્વશુદ્ધ ચિદ્રૂપની સર્વોત્કૃષ્ટ પ્રાપ્તિ થતી
નથી. ૨૨.



હુદ્દું મેદાનં.

અધ્યાય ૧૩ મો

[શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે વિશુદ્ધિની ઉપયોગિતા]

વિશુદ્ધં વસનं શ્લાઘ્યં રલં રૂપ્યં ચ કાંચનં ।
ભાજનં ભવનં સર્વેર્યથા ચિદ્રૂપકં તથા ॥૧॥

રાગાદિલક્ષણઃ પુંસિ સંકલેશોऽશુદ્ધતા મતા ।
તત્ત્વાશો યેન ચાંશેન તેનાંશેન વિશુદ્ધતા ॥૨॥

વસ્ત્ર કનકભાજન ગૃહ રૂપું રળ શુદ્ધ તો જગ વખણાય;
ચિદ્રૂપ તેમ વિશુદ્ધ હોય તો જગમાં તે ઉત્કૃષ્ટ ગણાય.
રાગાદિક સંકલેશ જીવમાં અશુદ્ધતા તે તો દેખાય;
જે અંશે તે નાશ થાય ત્યાં તે અંશે શુદ્ધ લેખાય. ૧-૨

આર્થ :—જેમ વસ્ત્ર, રત્ન, રૂપું, સોનું, વાસણ અને ધર શુદ્ધ હોય તો સર્વજનો વડે વખણાય છે, તેમ સંપૂર્ણ શુદ્ધ ચિદ્રૂપ સર્વથી પ્રશંસાપાત્ર બને છે. ૧.

આત્મામાં રાગ, દ્વેષ આદિ લક્ષણવાળો સંકલેશભાવ અશુદ્ધતા ગણાય છે. જેટલા અંશે તેનો નાશ તેટલા અંશે વિશુદ્ધતા પ્રગટે છે. ૨.

યેનોપાયેન સંકલેશશ્ચિદૂપાદ્યાતિ વેગતઃ ।
વિશુદ્ધેરેતિ ચિદૂપે સ વિધેયો મુમુક્ષુણા ॥૩॥

જે ઉપાયથી ચિદ્રૂપમાંથી સત્ત્વર એ સંકલેશ પલાય;
ચિદ્રૂપ જેમ વિશુદ્ધ પામે મુમુક્ષુ સાધે એ જ ઉપાય. ૩.

આર્થ :—જે ઉપાય વડે આત્મામાંથી સંકલેશ સત્ત્વર જતો રહે, ચિદ્રૂપમાં વિશુદ્ધ આવે તે ઉપાય મુમુક્ષુએ કર્તવ્ય છે. ૩.

સત્પૂજ્યાનાં સુતિનતિયજનં ષટ્કર્માવશ્યકાનાં
વૃત્તાદીનાં દૂઢતરધરણં સત્તપસ્તીર્થ્યાત્રા ।
સંગાદીનાં ત્યજનમજનનં ક્રોધમાનાદિકાના-
માસૈરુક્તં વરતરકૃપયા સર્વમેતદ્વિ શુદ્ધ્યૈ ॥૪॥

સુતિ પ્રણાતિ પૂજા સંતોની તપ તીરથ યાત્રા ઉલ્લાસ,
પદ આવશ્યક નિત્ય કર્મ ને વૃત્ત આદિમાં દટ અભ્યાસ;
ત્યાગ સકલ સંગાદિ તણો ને કોઘાદિક કખાય વિરામ,
પરમ કૃપા કરી આપ્તજનોએ શુદ્ધિ હેતુ એ કહ્યા તમામ. ૪.

આર્થ :—સત્તના કારણે પૂજવાયોગ્ય સત્તપુરુષોની સુતિ, પ્રણામ,
પૂજા, આવશ્યકોના પદ્ધકને (ઇ આવશ્યકને), વૃત્ત આદિને દેઢપણે ધારણ
કરવા તે સત્ત ને અર્થે તપ, તીર્થ્યાત્રા, સંગપ્રસંગ આદિ પરિશ્રહનો ત્યાગ,
કોધ, માનાદિ કખાયોનો અભાવ આ સર્વ શુદ્ધિને માટે કારણરૂપ આપ્ત
પુરુષોએ પરમ કૃપા કરીને કહ્યું છે. ૪.

રાગાદિવિક્રિયાં દૃષ્ટવાંગિનાં ક્ષોભાદિ મા બ્રજ ।
ભવે તદિતરં કિં સ્યાત્ સ્વચ્છં શિવપદં સ્મર ॥૫॥

હે! જુવ ક્ષોભ ધરીશ નહિ દેખી જુવોના રાગાદિ વિકાર;
ભવમાં એ વિણ હોય અવર શું? નિજનિર્મળ શિવપદ સંભાર. ૫.

આર્થ :—જુવોની રાગાદિ વિકિયા જોઈને ક્ષોભ (અસ્વસ્થતા)
ન કર. સંસારમાં તે સિવાય બીજું શું હોય? નિર્મળ મોક્ષપદને યાદ
કર. ૫.

વિપર્યસ્તો મોહાદહમિહ વિવેકેન રહિત:
સરોગો નિઃસ્વો વા વિમતિર્ગુણઃ શક્તિવિકલઃ ॥
સદા દોષી નિંદ્યોગુરુવિધિરકર્મા હિ વચન
વદન્નંગી સોઽયં ભવતિ ભુવિ વૈશુદ્ધ્યસુખભાગ ॥૬॥

મોહવશે વિપરીતમતિ હું, મળે ન મુજમાં કાંઈ વિવેક,
હું રોગી, નિર્ધાર, મતિહીણો, બલવિહીન, સદગુણ નહિ એક;
સદા દોષયુક્ત હીન આચારી, નિંધા, પ્રમાદી, હું દીનમાં,
એમ ભાવના ભાવે જગમાં, વિશુદ્ધિ સુખનો તે સત્ત્વાત્. ૬.

આર્થ :—હું સંસારમાં મોહથી વિપરીત મતિને પામેલો છું,
વિવેકરહિત છું, ભવરોગયુક્ત છું, ધનરહિત છું, ચિદ્રૂપની પ્રાપ્તિ વગરનો
છું અથવા વિપરીત બુદ્ધિવાળો છું, ગુણરહિત છું, શક્તિરહિત છું, સદા
દોષવાળો, નિંધા, તુચ્છ કાર્ય કરનારો, પ્રમાદી છું. આવી ભાવના કરનારો
જીવ જગતમાં વિશુદ્ધિથી પ્રગટતા સુખનો ભાગી (પાત્ર) થાય છે. ૬.

રાજો જ્ઞાતેશ્ચ દસ્યોર્જવલનજલરિપોરીતિતો મૃત્યુરોગાત्
દોષોદ્ભૂતેરકીર્તેઃ સતતમતિભયં રૈનૃગોમંદિરસ્ય ।
ચિંતા તત્ત્વાશશોકો ભવતિ ચ ગૃહીણાં તેન તેષાં વિશુદ્ધં
ચિદ્રૂપધ્યાનરલં શ્રુતિજલધિભવં પ્રાયશો દુર્લભંસ્યાત् ॥૭॥

(સવૈયા)

રાજા જ્ઞાતિ ચોર અદ્દિન જલ અરિ મૃત્યુ વ્યાધિ દુઃખદાય,
દોષજનિત અપયશ આદિથી ગૃહસ્થને ભય સતત સદાય;
જ્યાં પશુ નર ધન ધામની ચિંતા તેના નાશે શોક અપાર,
ત્યાં બોધાદ્ય જ શુદ્ધ રતન સમ ચિદ્રૂપધ્યાન સુલભ નહિ ધાર. ૭

આર્થ :—ગૃહસ્થોને રાજા તરફથી, જ્ઞાતિ તરફથી તથા ચોરથી,
અદ્દિન, પાણી અને શત્રુથી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડનો ઉપદ્રવ,
ઉંદરનો ઉપદ્રવ, પોપટ આદિ પક્ષીઓનો ઉપદ્રવ, સ્વસૈન્યનો ઉપદ્રવ,
પરસૈન્યનો ઉપદ્રવ વગેરેથી, મૃત્યુથી, રોગથી, દોષની ઉત્પત્તિથી,
અપયશથી, નિરંતર અયંત ભય, ધન, મનુષ્ય, પશુ, મકાન આદિની
ચિંતા તેના નાશમાં શોક થાય છે; તેથી તેમને શ્રુતસાગરમાંથી જન્મેલું,
નિર્મળ આત્મધ્યાનરૂપ (વિશુદ્ધ) રતન ધારું કરીને દુર્લભ હોય છે. ૭.

પઠને ગમને સંગે ચેતનેઽચેતનેઽપિ ચ ।
કિંચિત્કાર્યકૃતૌ પુંસા ચિંતા હેયા વિશુદ્ધયે ॥૮॥

હે આત્મન્! જો વિશુદ્ધિ ચાહે તો ચિંતા તજ શીધ તમામ,
કરવા પઠન, ગમન, જડચેતન, સંગ પ્રસંગ કે કંઈ પણ કામ. ૮

આર્થ :—મનુષ્યે વિશુદ્ધિની પ્રાપ્તિ માટે પઠનમાં, ગમનમાં,
ચેતન-અચેતન સંગમાં તથા કંઈ પણ કાર્ય કરવામાં ચિંતા તજ દેવી
જોઈએ. ૮.

શુદ્ધચિદ્રૂપકસ્યાંશો દ્વાદશાંગશ્રુતાર્ણવઃ ।
શુદ્ધચિદ્રૂપકે લભ્યે તેન કિ મે પ્રયોજન ॥૬॥

બાર અંગ શ્રુતસાગર તે પણ નિર્મલ ચિદ્રૂપ અંશ ગણાય,
ચિદ્રૂપ શુદ્ધ મળ્યું ત્યાં મુજને, તે શ્રુતનું શું કામ જરાય? ૬.

આર્થ :—બાર અંગરૂપ શ્રુતસમુદ્ર શુદ્ધ આત્માનો અંશ છે. જ્યાં
શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ત્યાં તેનું મારે શું કામ છે? ૬.

શુદ્ધચિદ્રૂપકે લભ્યે કર્તવ્ય કિંચિદસ્તિ ન ।
અન્યકાર્યકૃતૌ ચિંતા વૃથા મે મોહસંભવા ॥૧૦॥

વપુષાં કર્મણાં કર્મહેતૂનાં ચિંતન યદા ।
તદા કલેશો વિશુદ્ધિ: સ્યાચ્છુદ્ધચિદ્રૂપચિંતન ॥૧૧॥

ચિદ્રૂપ શુદ્ધ મળ્યું ત્યાં મુજને કંઈ નહિ મુજ કર્તવ્ય ગણાય,
અન્ય કાર્ય કરવાની ચિંતા મોહજન્ય તે વ્યર્થ મનાય;
શરીર કર્મ કે કર્મહેતૂનું ચિંતન ત્યાં છે કલેશ નિવાસ,
નિર્મલ ચિદ્રૂપનું ચિંતન ત્યાં વિશુદ્ધિ પ્રગટે આત્મિક ખાસ. ૧૦-૧૧.

આર્થ :—શુદ્ધ આત્માની પ્રાપ્તિ થતાં કંઈ કરવાનું છે નહિ.
અન્ય કાર્ય કરવાની ચિંતા મોહજન્ય છે, તેથી મારે તે કરવી નકામી
છે. ૧૦.

જ્યારે શરીરનું, કર્મના કારણોનું ચિંતન હોય છે, ત્યારે ક્રલેશ થાય છે અને જ્યારે શુદ્ધ આત્માનું ચિંતન થાય છે, ત્યારે વિશુદ્ધિ થાય છે. ૧૧.

ગૃહી ચર્તિન યો વેત્તિ શુદ્ધચિદ્રૂપ લક્ષણં ।

તસ્ય પંચનમસ્કારપ્રમુખસ્મરણ વરં ॥૧૨॥

ગૃહસ્થ કે મુનિ જો જાણે નહિ નિર્મલ ચિદ્રૂપ લક્ષણ સાર,
પંચ નમસ્કૃતિ આદિ તેને સ્મરણ શ્રેષ્ઠ તો ગણ્યું હિતકાર. ૧૨.

આર્થ :—જે ગૃહસ્થ કે મુનિ શુદ્ધ ચિદ્રૂપનું લક્ષણ જાણતા નથી,
તેને પંચનમસ્કાર આદિનું સ્મરણ શ્રેષ્ઠ છે. ૧૨.

સંકલેશસ્ય વિશુદ્ધેશ ફળં જ્ઞાત્વા પરીક્ષણં ।

તં ત્યતેતાં ભજત્યંગી યોડત્રામુત્ર સુખી સ હિ ॥૧૩॥

આ સંકલેશ અને શુદ્ધિફળ જાણે કરી પરીક્ષા સાર,
તજુ સંકલેશ વિશુદ્ધિ ભજે તે ઉભય લોકમાં સુખ અપાર. ૧૩.

આર્થ :—જે જીવ સંકલેશ અને વિશુદ્ધિનું ફળ પરીક્ષાપૂર્વક
જાણીને સંકલેશને તજે છે અને વિશુદ્ધિને ભજે છે, તે (જીવ) આ લોકમાં
તથા પરલોકમાં સુખી થાય છે. ૧૩.

સંકલેશો કર્મણાં બંધોડશુભાનાં દુઃखદાયિનાં ।

વિશુદ્ધૌ મોચનં તેષાં બંધો વા શુભકર્મણાં ॥૧૪॥

અશુભકર્મ અતિશાય દુઃખદાયી બાંધે જ્યાં સંકલેશ ભજાય;
વિશુદ્ધિ ભજતાં કર્મ છૂટે સૌ અથવા માત્ર શુભ બંધાય. ૧૪.

આર્થ :—સંકલેશમાં દુઃખદાયક અશુભકર્મનો બંધ થાય છે,
વિશુદ્ધિમાં તે કર્મનું છૂટવું થાય છે અથવા શુભકર્મનો બંધ થાય છે. ૧૪.

વિશુદ્ધે: શુદ્ધચિદ્રૂપસદ્ધ્યાનં સુખ્યકારણં ।

સંકલેશસ્તદ્વિધાતાય જિનેનેદં નિરૂપિતં ॥૧૫॥

ઉઠામ ધ્યાન વિમલ ચિદ્રૂપનું, વિશુદ્ધિનું એ કારણ મુખ્ય, તેના ઘાત બને સંકલેશો, ભાખે એમ જિનેન્દ્ર પ્રમુખ. ૧૫.

આર્થ :—શુદ્ધ ચિદ્બૂપનું ઉત્તમધ્યાન વિશુદ્ધિનું મુખ્ય કારણ છે તેના ધાત માટે સંકલેશ કારણ થાય છે, જિન ભગવાને આમ કહ્યું છે. ૧૫.

अमृतं च विशुद्धिः स्यान्नान्यल्लोकप्रभाषितं ।

अत्यंतसेवने कष्टमन्यस्यास्य परं सुखं ॥१६॥

લોક કહે અમૃત તે તો નહિં, વિશુદ્ધિ એ અમૃત પ્રધાન,
વૌંચિક અતિ સેવન દુઃખદાયી, વિશુદ્ધિ અમૃત સુખદ મહાન. ૧૬.

આર્થ :—લોકમાં જે અમૃત કહેવાય છે તે કોઈ અમૃત નથી, આત્મવિશુદ્ધિ જ અમૃત છે. અન્ય (અમૃત)ના અત્યંત સેવનમાં કષ થાય છે, જ્યારે આ વિશુદ્ધિના સેવનથી પરમ સુખ થાય છે. ૧૬.

विशुद्धिसेवनासक्ता वसंति गिरिगङ्गारे ।

विमुच्यानुपमं राज्यं खसुखानि धनानि च ॥१७॥

અનુપમ રાજ્ય વિષય સુખ વૈભવ ધન આઈ તણુ થયા વિરક્તા, ગિરિ ગુહામાં જઈ તે વસતા, વિશલ્લિ સેવનમાં આસક્ત. ૧૭.

આર્થ :—વિશુદ્ધિના સેવનમાં આસકત થયેલા જીવો અનુપમ રાજ્ય, ઈન્ડિય સુખ તથા ધન તજ્જ્ઞને પર્વતની ગુફાઓમાં વસે છે. ૧૭.

विशद्वेश्चित्स्वरूपे स्यात् स्थितिस्तस्या विशद्वता ।

तयोरन्योन्यहेतत्वमनुभ्य प्रतीयतां ॥१८॥

विशद्धिः परमो धर्मः पंसि सैव सुखाकरः ।

परमाचरण सैव मक्तेः पंथाश्च सैव हि ॥१६॥

વિશુદ્ધિથી ચિદ્દૂપમાં સ્થિરતા સ્થિરતાથી વળી શુદ્ધ સધાય,
એમ પરસ્પર કારણતાનો અનુભવ કરી ઘર શ્રદ્ધામાંય. ૧૮.

અહો! વિશુદ્ધિ પરમધર્મ છે, એ જ જીવોને સૌખ્ય-નિધાન, પરમ આચરણ પણ એ જાણો, મુક્તિમાર્ગ પણ એ જ પ્રધાન. ૧૮.

આર્થ :—વિશુદ્ધિથી આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે અને તેનાથી (આત્મસ્થિરતાથી) વિશુદ્ધતા થાય છે. આમ તે બને એક બીજાનું કારણપણું અનુભવ કરીને શ્રદ્ધો. ૧૮.

વિશુદ્ધિ પરમધર્મ છે, તે જ મનુષ્યને સુખની ખાણ છે, તે જ સર્વોત્તમ આચરણ છે અને તે જ મોક્ષનો માર્ગ છે. ૧૯.

તસ્માત् સૈવ વિધાતવ્યા પ્રયત્ને મનીષિણા ।

પ્રતિક્ષણં મુનીશેન શુદ્ધચિદ્રૂપચિંતનાત् ॥૨૦॥

તેથી મુનિવર અતિ મતિવંતા, સેવો એ જ કરી પુરુષાર્થ, ક્ષાણ ક્ષાણ ચિંતન નિર્મિત ચિદ્રૂપનું કરીને સાધો પરમાર્થ. ૨૦.

આર્થ :—તેથી વિદ્ધાન મુનિવરે દરેક ક્ષણે શુદ્ધ આત્માના ચિંતનથી પ્રયત્નપૂર્વક તે વિશુદ્ધતા જ કરવાયોગ્ય છે. ૨૦.

યાવદ્બાળ્યાંતરાન् સંગાન् ન મુંચંતિ મુનીશ્વરાઃ ।

તાવદાયાતિ નો તેષાં ચિત્તસ્વરૂપે વિશુદ્ધતા ॥૨૧॥

મુનીશ્વરો ત્યાગે નહિ જ્યાં સુધી બાલ અને અંતર સૌ સંગ, ત્યાં સુધી પામે નહિ તેઓ, ચિદ્રૂપમાં વિશુદ્ધિ પ્રસંગ. ૨૧.

આર્થ :—જ્યાં સુધી મુનીશ્વરો બાલ અને અંતર સંગ (પરિગ્રહ)નો ત્યાગ કરતા નથી, ત્યાં સુધી તેમને આત્મસ્વરૂપમાં વિશુદ્ધતા આવતી નથી. ૨૧.

વિશુદ્ધિનાવમેવાત્ર શ્રયંતુ ભવસાગરે ।

મજંતો નિખિલા ભવ્યા બહુના ભાષિતેન કિં ॥૨૨॥


ભવસાગરમાં દૂબકાં ખાતા સર્વ ભવ્ય, આ બયવા દાવ, ઘણું કહ્યું શું? ભજો નિરંતર સત્ત્વર આ વિશુદ્ધિ નાવ. ૨૨.

આર્થ :—ભવસાગરમાં ઝૂભતા સર્વ ભવ્યજીવો વિશુદ્ધતારૂપ નૌકાનો જ અહીં આશ્રય લ્યો; અધિક કહેવાથી શું (લાભ)? ૨૨.

આદેશોऽયং সদ্গুরুণাং রহস্যং সিদ্ধাংতানামেতদেবাখিলানাং।
কর্তব্যানাং মুখ্যকর্তব্যমেতলকার্যা যত্স্বে চিত্তবরূপে বিশুদ্ধিঃ ॥২৩॥

નિજ ચિદ્રૂપ વિશુદ્ધિ સાધો, સર્વ કાર્યમાં એ જ પ્રશસ્ય,
સદ્ગુરુનો આદેશ એ જ ને, એ જ સર્વ સિદ્ધાંત રહસ્ય. ૨૩.

આર્થ :—આ સદ્ગુરુઓની આજા છે, સમસ્ત સિદ્ધાંતોનો આ જ સાર છે, કર્તવ્યોમાં મુખ્ય કર્તવ્ય આ છે કે પોતાના ચિદ્રૂપ આત્મામાં વિશુદ્ધિ કરવી. ૨૪.



અધ્યાય ૧૪ મો

[અન્ય કાર્યો કરવા છતાં પણ
શુદ્ધ ચિદૂપના સ્મરણનો ઉપદેશ]

નીહારાહારપાનં ખમદનવિજયં સ્વાપમૌનાસનં ચ
યાનં શીલં તપાંસિ વ્રતમપિ કલયત્રાગમં સંયમં ચ।
દાનં ગાનં જિનાનાં નુતિનતિજપનં મંદિરં ચાભિષેકં
યાત્રાર્ચે મૂર્તિમેવં કલયતિ સુમતિઃ શુદ્ધચિદૂપકોऽહં ॥૧॥

(જ્ઞાનાશા)

જ્યાં મતિમાન આહાર નીહારમાં,
વિષય-કામાદિ-જ્યામાં પ્રવતે,
શયન આસન ગમન મૌન તપ શીલ જાપ,
શુત વ્રત સંયમે સ્થિર વતે;
દાન જિન-સ્તવન વંદન અભિષેક કે,
મૂર્તિ મંદિર, પૂજા વગેરે,
જે કરે તે સદા પ્રેમથી પ્રથમ ત્યાં,
શુદ્ધ ચિદૂપ હું સતત સમરે. ૧.

અર્થ :—સમ્યજ્ઞાની આહાર, નીહાર, પાન, ઈન્દ્રિય અને
કામનો વિજય તથા નિદ્રા, મૌન, આસન વગેરે કરતાં, વાહન, શીલ, વ્રત,
શાસ્ત્રસ્વાધ્યાય, સંયમ વગેરે કરતાં, દાન, ગાન, જિન ભગવાનની સ્તુતિ,
નમસ્કાર, જાપ કરતાં, મંદિર-મૂર્તિની સ્થાપના, અભિષેક, યાત્રા, પૂજા
કરતાં, પ્રતિષ્ઠા આદિ કરતાં—(દરેક કાર્ય કરતાં) હું શુદ્ધ ચિદૂપ છું;
એમ ભાવે છે. ૧.

કુર્વન् યાત્રાર્ચનાદ્યં ખજયજપતપોऽધ્યાપનં સાધુસેવાં
દાનौધાન્યોપકારં યમનિયમધરં સ્વાપશીલં દધાનઃ ।
ઉદ્ધ્વીભાવં ચ મૌનं વ્રતસમિતિતતિં પાલયન् સંયમૌદ્યં
ચિદ્ભૂપદ્ધાનરક્તો ભવતિ ચ શિવભાગ્ન નાપરઃ સ્વર્ગભાક્ત ચ ॥૨॥

સાધુસેવા કરે વિષયજ્ય મન ધરે,
પૂજના પઠન પાઠન કરે ત્યાં,
દાન જ્ય શીલ તપ મૌન યાઆ કરે,
ભય તજે વ્રત સમિતિ ધરે ત્યાં;
પરહિતે રક્ત યમ નિયમ સંયમ ધરે,
ત્યાં બધાં કાર્ય કરતાં યાદિ તે,
રક્ત ચિદ્ભૂપ દ્યાને રહે તો વરે,
મુક્તિ, નહિ તો સુરાદિ ગતિ તે. ૨.

અર્થ :—યાત્રા પૂજા આદિ કરતાં, ઈન્દ્રિયજ્ય, તપ અને પાઠન
કરતાં, સાધુસેવા, દાન અને અન્ય ઉપકાર કરતાં, યમ નિયમ ધરતાં,
શીલ ધારણ કરતાં, નિર્ભયપણું, મૌન કે વ્રતસમિતિપણું ધારણ કરતાં,
સંયમસમૂહનું પાલન કરતાં (આ બધા કાર્યો વખતે પણ) જે જીવ
આત્મધ્યાનમાં રક્ત રહે છે તે મોક્ષનું પાત્ર બને છે, બીજો નહિ.
(બીજો) સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. ૨.

ચિત્તં નિધાય ચિદ્ભૂપે કુર્યાદ् વાગંગચેષ્ટિતં ।
સુધીર્નિરંતરં કુંભે યથા પાનીયહારિણી ॥૩॥

ચિત્ત ચિદ્ભૂપમાં સ્થાપી નિશાદિન બધાં,
કાર્ય તાન વચનથી સુજા કરતા;
શીર્ષ પર કુંભમાં ચિત્ત પનિહારીનું
જેમ હસતાં, જતાં, વાત કરતાં. ૩.

અર્થ :—જેમ પનિહારી ધડામાં ચિત્ત રાખીને ગમન, વચનોચ્ચાર
આદિ કિયા કરે છે, તેમ સુજાજન નિરંતર આત્મામાં ચિત્ત સ્થાપીને વાણી
અને શરીરની કિયા કરે છે. ૩.

વૈરાગ્યં ત્રિવિધં પ્રાપ્ય સંગं હિત્વા દ્વિધા તતઃ ।
 તત્ત્વવિદ્ગુરૂપાશ્રિત્ય તતઃ સ્વીકૃત્ય સંયમં ॥૪॥
 અધીત્ય સર્વશાસ્ત્રાણિ નિર્જને નિરૂપદ્રવે ।
 સ્થાને સ્થિત્વા વિમુચ્યાન્યચિત્તાં ધૃત્વા શુભાસનં ॥૫॥
 પદસ્થાદિકમભ્યસ્ય કૃત્વા સામ્યાવલંબનં ।
 માનસં નિશ્ચલીકૃત્ય સ્વં ચિત્રૂપં સ્મરંતિ યે ॥૬॥ત્રિકલં ॥
 પાપાનિ પ્રલયં યાંતિ તેષામભ્યુદયપ્રદઃ ।
 ધર્મો વિવર્દ્ધતે મુક્તિપ્રદો ધર્મશ્ચ જાયતે ॥૭॥

પામી વૈરાગ્ય મન વચનને કાયથી,
 બાધ્ય અંતર તજ્જ સંગ જ્યારે,
 તત્ત્વજ્ઞાની ગુરુના શરણમાં જઈ,
 સંયમાદિ સ્વહિતને સ્વીકારે. ૪.

સર્વ શાસ્ત્રો ભણી, નિરૂપદ્રવ નિર્જને,
 સ્થાનમાં સ્થિરતાને કરીને,
 અન્ય ચિંતા તજ્જ દેઠ શુભાસન ધરી,
 ધ્યાન ઉત્તમ પદસ્થાદિ ધરીને; ૫.

સામ્ય અવલંબને અચલ મનને કરી,
 જે સ્મરે નિજ ચિત્રૂપ તેને,
 પાપક્ષય થાય ને અભ્યુદય ધર્મની
 વૃદ્ધિ, વળી મુક્તિપ્રદ ધર્મ જન્મે. ૬-૭.

આર્થિ :—જે પુરુષો મન, વચન, કાયથી ત્રણ પ્રકારે વૈરાગ્ય પામીને પછી બાધ્ય અને અંતર એમ બે પ્રકારના સંગને તજ્જને, તત્ત્વજ્ઞાનનું શરણ ગ્રહણ કરીને પછી સંયમ અંગીકાર કરી, સર્વ શાસ્ત્રોનું અધ્યયન કરીને, નિર્જન ઉપદ્રવરહિત સ્થાનમાં રહીને, ચિંતા ત્યજ્ઞને શુભ દેઠ આસન ધારણ કરી, પદસ્થ, પિંડસ્થ આદિ ધ્યાનનો અભ્યાસ કરીને, સમતાનું અવલંબન લઈને, મનને નિશ્ચળ કરીને પોતાના શુદ્ધ

૧૧૬]

[તત્ત્વજ્ઞાન-તરંગિએ

આત્મ-સ્વરૂપને સ્મરે છે તેમનાં પાપનો નાશ થાય છે, સ્વર્ગ આદિ સંપત્તિ આપનાર ધર્મ વધે છે અને મુક્તિ આપનાર ધર્મ પ્રગટ થાય છે. ૪-૫-૬-૭.

વાર્વાતાગ્ન્યમૃતોષવજ્રગરુડજ્ઞાનૌષધેભારિણ
સૂર્યેણ પ્રિયભાષિતેન ચ યથા યાંતિ ક્ષણેન ક્ષયં ।
અગ્ન્યબ્દાગવિષં મલાગફળિણોડજ્ઞાનં ગદેભવ્રજાઃ
રાત્રિવર્રોમિહાવનાવધચયશ્રિદૂપસંચિંતયા ॥૮॥

નાટ ક્ષણમાં કરે જેમ જલ અનલને,
મેઘને પવન, અજિન તરને,
વેરને પ્રિયભાષણ, સુધા વિષને,
સર્પને ગરુડ કે વજા ગિરિને;
જ્ઞાન અડ્ઝાનને, ઔષધ રોગને,
રાત્રિને રવિ હણે, સિંહ ગજને,
તેમ ચિદૂપ-ચિંતન અહા વિશ્વમાં!
ક્ષય કરે શીદ સો અધસમૂહને. ૮.

અર્થ :—જેમ આ પૃથ્વી ઉપર પાણી અજિનને, પવન મેઘને, અજિન વૃક્ષને, અમૃત વિષને, સાખુ (ક્ષાર) મેલને, વજ પર્વતને, ગરુડ સર્પને, જ્ઞાન અઢાનને, ઔષધ રોગને, સિંહ હાથીઓને, સૂર્ય રાત્રિને અને પ્રિયભાષણ વેરને એક ક્ષણમાં નષ્ટ કરી નાંખે છે તે પ્રમાણે આત્માના શાંત ચિંતવનથી પાપનો સંચય ક્ષણમાત્રમાં ક્ષય પામે છે.

વર્દ્ધતે ચ યથા મેઘાત્યુર્વ જાતા મહીરુહાઃ ।
તથા ચિદૂપસદ્ગ્યાનાત् ધર્મશાભ્યુદયપ્રદઃ ॥૬॥

તરુવરો પ્રથમથી હોય ઉગેલ તે
મેઘવૃદ્ધિ થતાં વૃદ્ધિ પામે,
તેમ ચિદૂપ સદ્ગ્યાનથી ધર્મ લે
અભ્યુદયદાચી તે વૃદ્ધિ પામે. ૬.

અધ્યાય-૧૪]

[૧૧૭]

આર્થ :—જેમ પહેલાં ઉગેલાં વૃક્ષો મેઘવૃષ્ટિથી વધી જાય છે, તેમ શુદ્ધ આત્માના ધ્યાનથી કલ્યાણ આપનાર ધર્મ વૃદ્ધિ પામે છે. ૮.

યથા બલાહકવૃષ્ટેર્જયિંતે હરિતાંકુરા: ।

તથા મુક્તિપ્રદો ધર્મઃ શુદ્ધચિદ્રૂપવિનાતુ ॥૧૦॥

મેઘવૃષ્ટિ થતાં ભૂમિમાંથી યથા,
નીલીન અંકુર બહુ ઉગી નીકળે,
શુદ્ધ ચિદ્રૂપ ચિંતન થકી ઉપજે,
મુક્તિપ્રદ ધર્મ ત્યમ ચિત વિમલે. ૧૦.

આર્થ :—જેમ મેઘ વૃષ્ટિ થતાં (ભૂમિમાંથી) લીલા અંકુરો ઉગી નીકળે છે, તેમ શુદ્ધ આત્માના ચિંતવનથી મુક્તિ આપનાર ધર્મ પ્રગટ થાય છે. ૧૦.

વ્રતાનિ શાસ્ત્રાણિ તપાંસિ નિર્જને નિવાસમંતર્બહિઃ સંગમોચનં ।

મૌનં ક્ષમાતાપનયોગધારણં ચિંશ્ચિત્યામા કલયન् શિવં શ્રયેતુ ॥૧૧॥

શાસ્ત્રો વ્રત તપ ક્ષમા, વાસ નિર્જન સ્થળે,
બાહ્ય અંતર તજુ સંગને જો;
મૌન આતાપના યોગ ધરતાં ચ જો,
ચિંતવે સ્વરૂપમુક્તિ વરે તો. ૧૧.

આર્થ :—વ્રતો પાળતાં, શાસ્ત્રો વાંચતાં, તપ કરતાં, નિર્જન સ્થાનમાં વસતાં, અંતરંગ અને બાધ્ય સંગનો ત્યાગ કરતાં, મૌન પામતાં, ક્ષમા આતાપન યોગ ધારણ કરતાં, આત્મચિંતન સાથે આ બધાં કાર્યો કરવામાં આવતાં (જીવ) મોક્ષ પામે છે. ૧૧.

શુદ્ધચિદ્રૂપકે રક્તઃ શરીરાદિપરાડ્મુખઃ ।

રાજ્ય કુર્વન્ન બંધેત કર્મણ ભરતો યથા ॥૧૨॥

દેહ ગેહાદિથી થઈ ઉદાસીન જે
શુદ્ધ ચિદ્રૂપમાં રક્ત નિત્યે,

તે ન કર્મથી બંધાય ભરતાદિવત्
રાજ્ય કરતાંચ નહિ લિપ્ત ખિતે. ૧૨.

આર્થ :—શરીરાદિથી ઉદાસીન, શુદ્ધાત્મામાં પ્રેમ કરનાર રાજ્ય
કરતાં (છતાં) ભરત (ચક્રવર્તી)ની જેમ કર્મથી બંધાતો નથી. ૧૨.

સ્મરન્ સ્વશુદ્ધચિદ્બૂપં કુર્યાત્કાર્યશતાન્યપિ।
તथાપિ ન હિ બધ્યતે ધીમાનશુભકર્મણા ॥૧૩॥

શુદ્ધ ચિદ્બૂપ નિજ સ્મરણ કરતાં જતાં,
કાર્ય ચાદિ સેંકડો પણ કરાયે,
તોય નહિ અશુભ કર્મો તણો લેશ પણ,
સન્મતિમાનને બંધ થાયે. ૧૩.

આર્થ :—સમ્યગ્જ્ઞાની પોતાના શુદ્ધ આત્માને યાદ કરતાં સેંકડો
કાર્યો કરે, તોપણ તે અશુભ કર્મથી બંધાય નહિ. ૧૩.

રોગેણ પીડિતો દેહી ચષ્ટિમુષ્ટ્યાદિતાડિતઃ ।
બબ્દો ર્ઘ્વાદિભિર્દુઃખી ન ચિદ્બૂપં નિજં સ્મરન્ ॥૧૪॥
બુભુક્ષયા ચ શીતેન વાતેન ચ પિપાસયા ।
આતપેન ભવેન્નારો નિજચિદ્બૂપચિંતનાત્ ॥૧૫॥

હોય કદી રોગ પીડિત જીવ કે કદી,
ચષ્ટિ મુષ્ટિ વડે કોઈ મારે,
બદ્ધ કદી રજ્જુ આદિથી પણ દુઃખી ન તે,
ભિન્ન ચિદ્બૂપ જે સ્મરણ ધારે. ૧૪.

તે ક્ષુદ્રા કે તૃપાથી દુઃખી ના બને,
પવન કે શીત પીડે નહીં ત્યાં,
કદી આતપ વડે આર્ત પણ ના બને,
શુદ્ધ ચિદ્બૂપ નિજ ચિંતના જ્યાં. ૧૫.

આર્થ :—રોગથી પીડાયેલો, લાકડી મુષ્ટિ આદિ વડે પ્રહાર

અધ્યાય-૧૪]

[૧૧૮]

કરાયેલો, દોરડા આદિથી બંધાયેલો (જીવ પણ) પોતાના આત્માનું સ્મરણ કરતાં દુઃખી થતો નથી. પોતાના આત્માના ચિંતનથી કુધા વડે, ઠંડીથી, તૃપાથી, તાપથી વ્યાકુળ ચિત્તવાળો જીવ પણ દુઃખી થતો નથી. ૧૪-૧૫.

હર્ષો ન જાયતે સુત્યા વિષાદો ન સ્વનિંદ્યા ।

સ્વકીયં શુદ્ધચિદ્રૂપમન્વહં સ્મરતોऽગિનઃ ॥૧૬॥

લોક નિજ સ્તુતિ કરે, હર્ષ ના થાય ત્યાં,
ખેદ નહિ કોઈ નિંદા કરે ત્યાં,
શુદ્ધ ચિદ્રૂપ નિજ ભિન્ન એ સર્વથી,
એમ મતિમાન નિશાદિન સ્મરે જ્યાં. ૧૬.

અર્થ :—પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રતિદિન સ્મરતા જીવને પોતાની પ્રશંસાથી હર્ષ થતો નથી, પોતાની નિંદાથી ખેદ થતો નથી. ૧૬.

રાગદ્રોષો ન જાયેતે પરદ્રવ્યે ગતાગતે ।

શુભાશુભેઽગિનઃ શુદ્ધચિદ્રૂપાસક્તચેતસ: ॥૧૭॥

ન સંપદિ પ્રમોદ: સ્યાત् શોકો નાપદિ ધીમતાં ।

અહો સ્વિત્સર્વદાત્મીયશુદ્ધચિદ્રૂપચેતસાં ॥૧૮॥

સર્વ પરદ્રવ્ય જે શુભ અશુભ કાંઈ પણ,
પ્રાપ્તિ અપ્રાપ્તિ તેની થતાં તો;
શુદ્ધ ચિદ્રૂપમાં ચિત્ત આસક્તાને,
રાગ કે દ્રેષ નહિ જન્મતા જો. ૧૭.

અહો! સંપત્તિમાં હર્ષ જેને નહિ,

તેમ નહિ શોક આપત્તિમાંછી;

નિત્ય નિજ વિમલ ચિદ્રૂપમાં ચિત્ત તે,

સર્વ ધીમત કૃતકૃત્ય ત્યાંછી. ૧૮.

અર્થ :—શુદ્ધ ચિદ્રૂપમાં જોમનું ચિત્ત આસક્ત છે એવા જીવને

[૧૨૦]

[તત્ત્વજ્ઞાન-તરંગિએટી]

સારા કે ખરાબ પર દ્રવ્યના જવા-આવવાથી (સંયોગ કે વિયોગ થવાથી) રાગ-દ્રેષ થતા નથી. ૧૭.

પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં ચિત્તને સર્વદા એકાગ્ર કરનાર બુદ્ધિમાનોને અહો આશ્ર્યની વાત છે, કે સંપત્તિમાં હર્ષ થતો નથી (કે) આપત્તિમાં શોક થતો નથી. ૧૮.

સ્વકીયં શુદ્ધચિદ્રૂપં યે ન મુંચંતિ સર્વદા।
ગચ્છંતોऽપ્યન્યલોકં તે સમ્યગભ્યાસતો ન હિ॥૧૬॥

તથા કુરુ સદાભ્યાસં શુદ્ધચિદ્રૂપચિંતને।
સંકલેશો મરણે ચાપિ તદ્વિનાશં યથૈતિ ન ॥૨૦॥

જે જનો સ્વકીય ચિદ્રૂપ નિર્મલ કદી,
ના તજે પણ ભજે સર્વદા તે,
અચાલ અભ્યાસ સમ્યક્ થકી ના છૂટે,
જાય પરલોકમાં પણ યદા તે.

શુદ્ધ ચિદ્રૂપ-ચિંતન વિષે સર્વદા,
તેથી અભ્યાસ એવો કરો કે;
દુઃખ સંકલેશ કે મરણ પણ આવતાં,
તે ચાલે ના અચળતા ધરો એ. ૧૮-૨૦.

અર્થ :—જે જીવો પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને હુંમેશાં છોડતાં નથી, તેઓ સારી રીતે કરેલા અભ્યાસના બળથી પરલોકમાં જતાં પણ ખરેખર છોડતા નથી. ૧૮.

શુદ્ધ ચિદ્રૂપના ચિંતનમાં સદા એવો અભ્યાસ કરો કે સંકલેશમાં તથા મરણમાં પણ તે વિનાશ પામે નહિ. ૨૦.

વદન્નયૈર્હસન् ગચ્છન् પાઠ્યન્નાગમં પઠન्।
આસનં શયનં કુર્વન् શોચનં રોદનં ભયં ॥૨૧॥

ભોજનં ક્રોધલોભાદિ કુર્વન् કર્મવશાત् સુધીઃ ।
ન મુંચતિ ક્ષણાર્દ્ધ સ શુદ્ધચિદ્રૂપચિતનં ॥૨૨॥

અન્યાની સાથે કંઈ વાત કરતાં જતાં,
પઠન પાઠન તથા હાસ્ય કરતાં;
કમને વશ વળી ખાનપાનાદિ કે,
કોધ લોભાદિ પરભાવ ભજતાં;
શુદ્ધ ચિદ્રૂપ-ચિંતન કદી પણ નાહીં,
અર્ધ ક્ષણ માત્ર ધીમત તજતા. ૨૧-૨૨.

અર્થ :—સમ્યક્કષાની બીજાઓ સાથે બોલતાં, હસતાં, જતાં, (બીજાઓને) શાખ ભણાવતાં કે ભણતાં, આસન શયન કરતાં, કર્મવશે શોક, રૂદ્ધન, ભય, ભોજન કે કોધ લોભાદિ કરતાં (છતાં પણ) શુદ્ધ ચિદ્રૂપનાં ચિંતનને તે અર્ધી ક્ષણ માટે પણ છોડતો નથી. ૨૧-૨૨.



અધ્યાય ૧૫ મો

[શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે
પર દ્રવ્યોનાં ત્યાગનો ઉપદેશ]

ગૃહં રાજ્યं મિત્રં જનકઅનનીં ભ્રાતૃપુત્રં કલત્રં
સુવર્ણં રત્નं વા પુરજનપદં વાહનં ભૂષણં વૈ।
ખસૌખ્યં ક્રોધાદ્યં વસનમશનં ચિત્તવાક્ષાયકર્મ-
ત્રિધા મુંચેત્ પ્રાજ્ઞઃ શુભમયિ નિજં શુદ્ધચિદ્રૂપલબ્ધૈ ॥૧॥
(હરિગીત છંદ)

ગૃહ રાજ્ય પુત્ર કલત્ર મિત્રો ભાત માત પિતા ભલાં,
આહાર વાહન વસ્ત્રભૂષણ રત્ન પુરજન નિજ મળ્યાં;
ઇન્દ્રિય સુખ કોધાદિ ભાવો વચ્ચન તન મનથી ત્રિધા,
તે સર્વ ચિદ્રૂપ પ્રાપ્તિ માટે પ્રાજ્ઞ ત્યાગો સર્વથા. ૧.

અર્થ :—જ્ઞાની અનુકૂળ છતાં પોતાનાં ઘર, રાજ્ય, મિત્ર, પિતા
માતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, સુવર્ણ, રત્ન તથા નગર, દેશ, વાહન, ભૂષણ,
ઇન્દ્રિયસુખ, કોધાદિ કષાય ભાવ, વચ્ચ, ભોજનનો મન, વચ્ચન, કાયાએ
કરી (ત્રણ પ્રકારે) શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે ત્યાગ કરે છે. ૧.

સુતાદૌ ભાર્યાદૌ વપુષિ સદને પુસ્તક ધને
પુરાદૌ મંત્રાદૌ યશસ્યિ પઠને રાજ્યકદને ।
ગવાદૌ ભક્તાદૌ સુહૃદિ દિવિ વાહે ખવિષયે
કુદ્રમે વાંછા સ્યાત્ સુરતરુમુખે મોહવશતઃ ॥૨॥

સ્ત્રી, પુત્ર પુત્રી શરીર પુસ્તક ધામ ધન આદિ વિષે,
પુર મંત્ર ચંદ્ર પાઠન પઠન કે રાજ્ય વિગ્રહમાં દીસે;

આહાર વાહન મિત્ર સુર કે વિષયસુખ સુરદુમ્ભમાં,
વાંછા થતી તે મોહવશાયી, તેમ વળી કુધર્મમાં. ૨.

આર્થ :—મોહને વશ થવાથી પુત્ર-પુત્રી આદિમાં, ખી આદિમાં,
શરીરમાં, મકાનમાં, પુસ્તકોના સમૂહમાં, નગર આદિમાં, મંત્ર આદિમાં,
યશમાં, ભણવામાં, રાજ્યમાં, યુદ્ધમાં, ગાય-બળદ આદિ પશુમાં, ભોજન
આદિમાં, મિત્રમાં, સ્વર્ગમાં, વાહનમાં, ઈન્દ્રિયના વિષયોમાં,
મિથ્યાત્વયુક્ત કુધર્મમાં, કલ્પવૃક્ષ આદિમાં વાંછા થાય (છે). ૨.

કિં પર્યાયૈવિભાવૈસ્તવ હિ ચિદચિત્તાં વ્યંજનાર્થાભિધાનૈ:
રાગદ્વેષાસિકીજૈર્જગતિ પરિચિતૈ: કારણૈ: સંસ્તેશ્ચ ।
મત્વૈવં ત્વં ચિદાત્મન્ પરિહર સતતં ચિંતનં મંશુ તેષાં
શુદ્ધે દ્રવ્યે ચિતિ સ્વે સ્થિતિમચલતયાંતર્દૂશા સંવિધેહિ ॥૩॥

સૌ દ્રવ્ય ગુણ પર્યાય ૪૫ ચૈતનતણા વિભાવ જે,
રાગાદિને ભવહેતુનું શું કામ? જગ પરિચિત એ;
એ માન્ય કરી તજ શીધ ચિંતન રે! ચિદાત્મન્ ચિતથી!
નિજ શુદ્ધ ચિદદ્રવ્યે સ્થિતિ કર અચળ અંતરદિષ્ટિથી. ૩.

આર્થ :—ચૈતન્ય અને જડના વ્યંજન અને અર્થ (પર્યાય) નામના
અવસ્થાઓથી—(કે જે) રાગ-દ્વેષ થવાનાં મૂળ કારણો છે, એમનાથી
જગતમાં ચિર પરિચિત અને સંસારના કારણરૂપ એવા વિભાવ પર્યાયોથી
તારે શું પ્રયોજન છે? આમ જાણીને હે ચિદાત્મન્! તું તેમનું નિરંતર
ચિંતન શીધ તજી હે. (અને) પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં અંતર્દિષ્ટિથી
અચળપણે સ્થિરતા ધારણ કર. ૩.

સ્વર્ણોરલૈગૃહૈ: સ્ત્રીસુતરથશિવિકાશવેભમૃતૈરસંખ્યૈ—
ભૂષાવસ્ત્રૈ: સ્વગાદ્યેર્જનપદનગરૈશ્વાભરૈ: સિંહપીઠૈ: ।
છત્રૈરસ્ત્રૈવિચિત્રત્રૈરતરશયનૈર્માજનૈર્ભોજનૈશ્વ
લખ્યૈ: પાંડિત્યમુખ્યૈર્ન ભવતિ પુરુષો વ્યાકુલસ્તીત્રમોહાત્ ॥૪॥

રથ અશ્વ ગજ કિંકર કનક, રહ રત્ન સ્ત્રી સુત શિબિકા,
ચામર સિંહાસન છા ભૂષણ-વસ્ત્ર જનપદ નગરી વા;
લ્રગ અસ્ત્ર સુંદર શરીર ભોજન, વિદ્વતા, ફાંસી મહા,
ત્વાં પુરુષ વ્યાકુલ ના બને, શું તીવ્ર મોહ મહાત્મ્ય હા! ૪.

અર્થ :—પુરુષ (જીવ) તીવ્ર મોહને કારણે સુવર્ણ, રત્નો, મકાનો,
સ્ત્રી, પુત્ર, રથ, પાલખી, અશ્વ, ગજ, નોકરો, અસંખ્ય વખાભૂષણો,
માળા આદિ દેશ, નગર આદિ, ચામરો, સિંહાસનો, છત્રો, વિધવિધ
અસ્ત્રો, ઉત્તમ શરીરનો, ભોજનો, વાસણો તથા પાંડિત્ય વગેરેની પ્રાપ્તિ
કરવામાં વ્યાકુળ થતો નથી. ૪.

રૈગોભાર્યા: સુતાશ્વા ગૃહવસનરથા: ક્ષેત્રદાસીભશિષ્યા:
કર્પૂરાભૂષણાદ્યાપણવનશિબિકા બંધુમિત્રાયુધાદ્યા: ।
મંચા વાપ્યાદિ ભૃત્યાતપહરણખગા: સૂર્યપાત્રાસનાદ્યા:
દુઃખાનાં હેતવોડી કલયતિ વિમતિ: સૌખ્યહેતૂનું કિલૈતાનું ॥૫॥

ધન ધેનુ સ્ત્રીસુત અશ્વ ગૃહ રથ વસ્ત્ર દાસી શિષ્ય વા,
કર્પૂર ભૂષણ શિબિકા ઉધાન આસન વ વાપિકા;
આયુધ છા પલંગ ભાજન ભૃત્ય મિત્ર દુકાનને,
સુખહેતુ મૂઢ મતિ ગણે હા! સર્વ દુઃખ-નિદાનને. ૫.

અર્થ :—ધન, સુવર્ણ, ગાય અને સ્ત્રી, પુત્ર, પુત્રી તથા અશ્વો,
ગૃહ, વસ્ત્ર અને રથ, જમીન, દાસી, હાથી, શિષ્યો, કર્પૂર, ભૂષણ, દુકાન,
વન, ઉપવન, પાલખી, ભાઈ, મિત્ર, આયુધાદિ, મંડપ-પલંગ, વાવ આદિ
નોકર, છત્રી, છત્ર, પક્ષી, સૂર્ય, પાત્ર, આસન આદિ; આ (બધા)
દુઃખોનાં કારણ છે (તોપણ) વિપરીત બુદ્ધિવાળો (અજ્ઞાની) એ સઘળાને
ખરેખર સુખનાં કારણ માને છે. ૫.

હંસ! સ્મરસિ દ્રવ્યાણિ પરાણિ પ્રત્યહં યથા।
તથા ચેત્ શુદ્ધચિદૂપં મુક્તિ: કિં તે ન હસ્તગા ॥૬॥

લોકસ્ય ચાત્મનો યત્ન રંજનાય કરોતિ યત્ત।
તચ્છેન્નિરાકુલત્વાય તર્હ દૂરે ન તત્પદં ॥૭॥

હે હંસ! પરદ્રવ્યો સ્મરે તું જેમ નિશાદિન ચાત્મનીથી,
જો તેમ ચિદ્રૂપ શુદ્ધ સ્મર તો મુક્તિ દૂર શું હસ્તાથી?
જે ચાત્મન નિજ પર રંજને કરતા સદા સર્વે જના,
તેવો નિરાકુલત્વ માટે જો કરે, પદ દૂર ના. ૬-૭.

અર્થ :—હે આત્મન! જેમ તું પરદ્રવ્યોનું પ્રતિદિન સ્મરણ કરે છે, તેમ જો શુદ્ધ આત્મસ્વરૂપનું સ્મરણ કરે તો શું મોક્ષ તને હસ્તગત ન થાય? (અવશ્ય થાય.) ૬.

લોકના અને પોતાના રંજન માટે જે યત્ન કરે છે તેવો પ્રયત્ન જો નિરાકુળતા માટે કરે, તો તે મુક્તિ પદ દૂર રહે નહિ. ૭.

રંજને પરિણામ: સ્યાદ् વિભાવો હિ ચિદાત્મનિ ।
નિરાકુલે સ્વભાવ: સ્યાત् તં બિના નાસ્તિ સત્સુખં ॥૮॥
સંયોગવિપ્રયોગૌ ચ રાગદ્રોષૌ સુખામુખે ।
તદ્ભવેઽત્રભવે નિત્યં દૃશ્યેતે તદ્ભવં ત્યજ ॥૯॥

રંજન કરે ત્યાં, ચિદ્રૂપે પરિણામ થાય વિભાવનાં,
હોયે સ્વભાવ નિરાકુલત્વે નહીં સત્સુખ તે વિના,
સંયોગ ને વિયોગ સુખ દુઃખ, રાગદ્રોષ ભળાય જ્યાં,
નિશાદિન આ ભવ પરભવે હા! ભવ હવે તું ત્યાગ ત્યાં. ૮-૯.

અર્થ :—રંજન કરવામાં આત્માના ભાવ થાય તે ચિદ્રૂપ આત્મામાં વિભાવ જ છે. નિરાકુળતામાં સ્વભાવ હોય (છે). તેના (સ્વભાવ) વિના સાચું સુખ નથી. ૮.

સંયોગ અને વિયોગ, રાગ અને દ્રોષ, સુખ તથા દુઃખ (ના દ્વંદ્વો) પરભવમાં અને આ ભવમાં સદા દેખવામાં આવે છે, માટે તું સંસારને તજી દે. ૯.

[૧૨૬]

[તત્ત્વજ્ઞાન-તરંગિએટી]

શાસ્ત્રાદ् ગુરો: સધમદિર્જાનિમુત્પાદ્ય ચાત્મનઃ ।
તત્ત્વાવલંબનં કૃત્વા તિષ્ઠ મુંચાચ્યસંગતિં ॥૧૦॥
અવશ્યં ચ પરદ્વય્ નશયત્યેવ ન સંશયઃ ।
તદ્વિનાશે વિધાતવ્યો ન શોકો ધીમતા ક્વચિત् ॥૧૧॥

પ્રગટાવ આત્મજ્ઞાન સદ્ગુરુ, શાસ્ત્ર ધર્મી સુસંગથી,
તેનું જ અવલંબન કરી સ્થિર થા છૂટી પરસંગથી;
પરદ્વય નાશ અવશ્ય પામે ત્યાં શું સંશય છે ખરો?
તેના વિનાશે શોક તેથી સુજા કદીયે ના ધરો. ૧૦-૧૧.

અર્થ :—શાસ્ત્રથી, ગુરુથી, સાધર્મીજનો આદિથી આત્મજ્ઞાન પ્રગટ કરીને તેનો આશ્રય લઈને તું સ્થિર થા, બીજો સંગ છોડી દે. ૧૦.

તથા પરદ્વય અવશ્ય નાશ પામે છે જ, એમાં સંશય નથી,
તેના વિનાશમાં જ્ઞાનીજને કયાંય શોક કર્તવ્ય નથી. ૧૧.

ત્યક્ત્વા માં ચિદચિત્સંગ યાસ્યંત્યેવ ન સંશયઃ ।
તાનહં વા ચ યાસ્મામિ તત્ત્વીતિરિતિ મે વૃથા ॥૧૨॥
પુસ્તકૈર્યત્પરિજ્ઞાનં પરદ્વયસ્ય મેભેની ભવેત् ।
તદ્ધેયં કિં ન હેયાનિ તાનિ તત્ત્વાવલંબિનઃ ॥૧૩॥

નક્કી જ્શે મુજને તજુ સૌ સંગ જડ યેતન કદી,
કે સર્વ તજુ મારે જવું ત્યાં પ્રીતિ મુજ શી દુઃખદા?
જે જ્ઞાન પુસ્તકથી થતું પરદ્વયનું તે ત્યાજ્ય જ્યાં,
તો ત્યાજ્ય શું પરદ્વય નહિ, તત્ત્વાવલંબી હું થતાં. ૧૨-૧૩.

અર્થ :—યેતન અને જડ સંગ મને તજુને જ્શે જ, એમાં સંશય નથી અથવા હું તે સંગોને તજુને જઈશ, તેથી મારે (માટે) તેમની પ્રીતિ (કરવી) નકામી છે. જોશે તત્ત્વનું અવલંબન લીધું છે, એવા મને જે પરદ્વયનું પરિજ્ઞાન પુસ્તકોથી થાય (છે) તે (પણ) ત્યાજ્ય છે, તો પછી શું તે પરદ્વયો હેય ન હોય? (હોય જ). ૧૨-૧૩.

અધ્યાય-૧૫]

[૧૨૭]

સ્વર્ણેરલૈ: કલતૈ: સુતગૃહવસનૈભૂષણે રાજ્યખાર્થે—
ગોહસ્ત્યશ્વૈશ્વ પદ્ગૈ: સ્થવરશિવકામિત્રમિષ્ટાન્પાનૈ: |
ચિંતારલૈનિધાનૈ: સુરતસુનિવહૈ: કામધેન્વા હિ શુદ્ધ-
ચિદ્ગૂપાસિં વિનાંગી ન ભવતિ કૃતકૃત્ય: કદા કવાપિ કાડપિ ||૧૪||

સુત મિત્ર વસ્ત્ર કલતૈ કંચન રતન ભૂષણ સંગ્રહીં,
રથ ગાથ ગાજ ગૃહ રાજ્ય સુખ મિષ્ટાન પાન ધારીં લદ્ધીં;
ચિંતામણિ નિધાન સુરતસુ કામધેનુ મજ્યા છતાં,
નહિ કોઈ જીવ કૃતકૃત્ય ચિદ્ગૂપ પ્રાપ્તિ વિણ કદી થતા. ૧૪.

આર્થ:—શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના કોઈ પણ જીવ ક્યાંય
પણ, ક્યારેય, સુવર્ણ અને રત્નો (ની પ્રાપ્તિ)થી, સ્ત્રીથી, પુત્ર, ગૃહ,
વસ્ત્રોથી, આભૂષણોથી, રાજ્ય અને ઈન્દ્રિયના વિષયોથી તથા ગાય,
હાથી, ઘોડાથી, પદાતિઓથી, રથ, ઉત્તમ પાલખી, મિત્રો કે મિષ્ટાન
ભોજનોથી, ચિંતામણિ રત્નોથી, ધનના ભંડારોથી, કદ્વવૃક્ષના સમૂહોથી,
કામધેનુથી, ખરેખર કૃતકૃત્ય થતો નથી. ૧૪.

પરદ્વયાસનાભ્યાસં કુર્વન् યોગી નિરંતરં।
કર્માંગાદિપરદ્વયં મુક્ત્વા ક્ષિપ્રં શિવી ભવેત् ॥૧૫॥

કારણ કર્મબન્ધસ્ય પરદ્વયસ્ય ચિંતનં ।
સ્વદ્વયસ્ય વિશુદ્ધસ્ય તન્મોક્ષસ્યૈવ કેવલં ॥૧૬॥

પરદ્વયાને તજવા કરે અભ્યાસ સતત સ્વચિંતને,
તે યોગી કર્મ શરીર આદિ ત્યાગી સત્ત્વર શિવ બને;
પરદ્વયાનું ચિંતન ખરેખર કર્મ-બંધ-નિદાન છે,
ચિંતન વિમલ નિજ દ્વયાનું, શિવ હેતુ એ જ પ્રધાન છે. ૧૫-૧૬.

આર્થ :—યોગી નિરંતર પરદ્વયના ત્યાગનો અભ્યાસ કરતો થકો
કર્મ શરીર આદિ પરદ્વયાને છોડીને શીધ શિવપદ પામે છે. ૧૫.

પરદ્રવ્યનું ચિંતન કર્મબંધનું કારણ છે. વિશુદ્ધ આત્મદ્રવ્યનું ચિંતન તે કેવળ મોક્ષનું જ કારણ છે. ૧૬.

પ્રાદુર્ભવંતિ નિઃશોષા ગુણાઃ સ્વાભાવિકાશ્ચિતઃ ।

દોષા નશયંત્વહો સર્વે પરદ્રવ્યવિયોજનાત् ॥૧૭॥

સમસ્તકર્મદેહાદિપરદ્રવ્યવિમોચનાત् ।

શુદ્ધસ્વાત્મોપલબ્ધિર્યા સા મુક્તિરિતિ કથ્યતે ॥૧૮॥

શિક્ષુપના નિઃશોષ સ્વાભાવિક ગુણો પ્રગટે બધા,
તે દોષ ક્ષય થાયે સકલ પરદ્રવ્યે ત્યાગયે સર્વથા;
નિઃશોષ કર્મ શરીર આદિ અન્ય દ્રવ્યો ત્યાગાતાં,
નિજ સહજ આત્મસ્વરૂપ પ્રાપ્તિ તે જ મુક્તિ કથાય ત્યાં. ૧૭-૧૮.

આર્થ:—આશ્રયની વાત છે કે પરદ્રવ્યના ત્યાગથી આત્માના સમસ્ત સ્વાભાવિકગુણો પ્રગટ થાય છે (અને) સર્વ દોષો નાશ પામી જાય છે. ૧૭.

સર્વ કર્મ દેહ આદિ પરદ્રવ્યના ત્યાગથી જે શુદ્ધ સ્વ આત્માની પ્રાપ્તિ તે જ મોક્ષ કહેવાય છે. ૧૮.

અતઃ સ્વશુદ્ધચિક્ષુપલબ્ધયે તત્ત્વવિન્મુનિઃ ।

વપુષા મનસા વાચા પરદ્રવ્યં પરિત્યજેત् ॥૧૯॥

(વસંતતિલકા છંદ)


તેથી સ્વ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પ્રાપ્તિ,
જે તત્ત્વજ્ઞાની મુનિવર્ય રહે સદાપિ;
તે તો શરીર મનને વચને બ્રિયોગે,
દ્રવ્યો અનાત્મ સધળાં અતિ શીଘ્ર ત્યાગે. ૧૯.

આર્થ:—તેથી આત્મજ્ઞાની મુનિ નિજ શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે શરીરથી, મનથી અને વચનથી પરદ્રવ્યને તજી હે છે. ૧૯.

દિક્ચેલનૈકો હસ્તપાત્રો નિરીહઃ
 સામ્યારૂદ્ધરુત્ત્વવેદી તપસ્વી ।
 મૌની કર્માધેભસિંહો વિવેકી
 સિદ્ધ્યૈ સ્યાત્સ્વે ચિત્ત્વરૂપેજભિરક્તઃ ॥૨૦॥

દિગ્ વસ્ત્ર માત્ર કરપાત્ર, તપસ્વી, મૌની,
 નિસ્પૃહ, સામ્યપદ રાઢઠ, તત્ત્વજ્ઞાની;
 તે કર્મહસ્તી પ્રતિ સિંહ, વિવેકબુદ્ધિ,
 આત્મીય ચિદ્દસ્વરૂપ રક્તા, વરે સ્વસિદ્ધિ. ૨૦.

આર્થિક :—દિશાઓ જેમનું વખ છે, જેમને હાથ એ જ (ભોજન પાન માટેનું એક) પાત્ર છે, જે નિસ્પૃહ છે, સમતાશ્રેષ્ઠી ઉપર ચઢેલા છે, આત્મજ્ઞાની, તપસ્વી, મૌની, કર્માના સમૂહરૂપ હાથીઓને હણવાને સિંહ સમાન છે, ભેદજ્ઞાની અને પોતાના આત્મસ્વરૂપમાં તલ્લીન છે, તે જ મોક્ષ મેળવવાને યોગ્ય થાય છે.



ાધ્યાય ૧૬ મો

[શુદ્ધ ચિદૂપની પ્રાપ્તિ માટે નિર્જન સ્થાનની આવશ્યકતા]

સદ્બુદ્ધૈः પરરંજનાકુલવિધિત્યાગસ્ય સામ્યસ્ય ચ
ગ્રંથાર્થગ્રહણસ્ય માનસવચોરોધસ્ય બાધાહતેઃ ।
રાગાદિત્યજનસ્ય કાવ્યજમતેશ્વેતોવિશુદ્ધેરપિ
હેતુ સ્વોત્થસુખસ્ય નિર્જનમહો ધ્યાનસ્ય વા સ્થાનકં ॥૧॥

(સવૈયા)

સદ્બુદ્ધિ, સમતા, રાગાદિ-ત્યાગ, શાસ્ત્રના અર્થ ગ્રહાય,
પરરંજન-આકૃષણા જાયે, મન વાણીનો રોધ કાય;
બુદ્ધિ કાવ્ય વિષે જોડાયે, ચિત્તવિશુદ્ધિ વળી પમાય,
આત્મિક સુખ ને ધ્યાન પ્રાપ્તિનો, નિર્જન સ્થાનક હેતુ મનાય. ૧.

અર્થ :—અહો! એકત સ્થાન સમ્ભક્ષિદ્ધિરૂપ વિવેકજ્ઞાનનું
અન્યને રંજન કરવામાં થતી આકૃષણાના ત્યાગનું તથા સમતાનું, શાસ્ત્રના
અર્થના ગ્રહણનું, મન, વચ્ચનના નિરોધનું, બાધાને હણવાનું, રાગાદિના
ત્યાગનું, કાવ્યમાં ભતિ એકાગ્ર થવાનું, ચિત્તવિશુદ્ધિનું પણ, આત્મામાંથી
ઉત્પન્ન થતા સુખનું અથવા ધ્યાનનું કારણ થાય છે. ૧.

પાર્શ્વવર્ત્યાગિના નાસ્તિ કેનચિન્મે પ્રયોજનં ।

મિત્રેણ શત્રુણા મધ્યવર્ત્તિના તા શિવાર્થિનઃ ॥૨॥

સમીપવતી શાશ્વત મિત્ર કે મધ્યવતી પ્રાણી સંભ્રાન્ત,
કોઈ અન્યનું કામ ન મારે, શિવ અથી હું ચહું એકાન્ત. ૨.

અર્થ :—મોહના અર્થી એવા મને કોઈનું પણ મિત્ર, શત્રુ કે
મધ્યસ્થનું, નજીકમાં વર્તતા પ્રાણીનું પ્રયોજન (કામ) નથી. ૨.

ઇંદોર્વૃદ્ધૌ સમુદ્રઃ સરિદમૃતબલં વર્દ્ધતે મેઘવૃષે-
ર્મોહાનાં કર્મબંધો ગદ ઇવ પુરુષસ્યાભુક્તેરવશયં ।
નાનાવૃત્તાક્ષરાણામવનિવરતલે છંદસાં પ્રસ્તરશ્ચ
દુઃખોદ્યાગો વિકલ્પાસ્ત્રવવચનકુલં પાર્શ્વવર્યગિનાં હિ ॥૩॥

ચન્દ્ર વધે ત્યાં જલધિ વધતો, વૃદ્ધિ વધે નદી નીર અથાગા,
મોહવૃદ્ધિથી કર્મ વધે, વળી અપકવ અન્ને વ્યાધિ-વિપાક,
વિવિધ છંદ અક્ષર વૃદ્ધિથી વધે છંદ પ્રસ્તાર વિશેષ,
તેમ સમીપવાસી સંગે બહુ વચ્ચન વિકલ્પ વધે દુઃખ દોષ. ૩.

આર્થ: —જેવી રીતે ચંદ્રની વૃદ્ધિ થતાં સમુદ્ર વધે છે (ભરતી આવે છે), મેઘવૃદ્ધિની વૃદ્ધિથી નદીનાં પાણીનું બળ વધે છે, મોહની વૃદ્ધિમાં કર્મબંધ વધે છે, મનુષ્યને કાચા ભોજનથી અવશ્ય રોગની માફક, પૃથ્વીના સુંદર તળમાં જુદા જુદા છંદમાં અક્ષરોની વૃદ્ધિ થતાં છંદોનો પ્રસ્તાર વધે છે, તેમ નજીકમાં રહેલા પ્રાણીઓની સંગતિ વધવાથી નિશ્ચયથી દુઃખોનો સમૂહ અને દોષ, વિકલ્પના આગમનના કારણરૂપ વચ્ચનોનો સમૂહ વધે છે. ૩.

વૃદ્ધિ યાત્યેધસો વહિર્વૃદ્ધૌ ધર્મસ્ય વા તૃષા ।

ચિન્તા સંગસ્ય રોગસ્ય પીડા દુઃખાદિ સંગતે: ॥૪॥

અભિન જેમ વધે ઇન્ધનથી, તૃષા તાપથી વધતી જાય,
ચિંતા સંગથી, વ્યથા વ્યાધિથી, દુઃખાદિ સંગતિથી થાય. ૪.

આર્થ: —ઇન્ધનની વૃદ્ધિથી જેમ અભિન વૃદ્ધિ પામે છે અને ઉકળાટની વૃદ્ધિથી તરસ વધે છે, સંગની વૃદ્ધિથી ચિંતા વધે છે, રોગની વૃદ્ધિથી પીડા વધે છે, તેમ ચેતન-અચેતન પદાર્�ોની સંગતિની વૃદ્ધિથી દુઃખાદિ વધે છે. ૪.

વિકલ્પ: સ્યાજીવે નિગડનગજંબાલજલધિ-

પ્રદાવાગ્ન્યાતાપપ્રગદહિમતાજાલસદૂશ: ।

[૧૩૨]

[તત્ત્વજ્ઞાન-તરંગિણી]

વરં સ્થાનં છેત્રીપવિરવિકરાગस્તિ જલદા-
ગદજ્વાલાશસ્ત્રીસમપતિભિદે તસ્ય વિજન ॥૫॥

વિકલ્પ તો જનને ગિરિ કર્દમ જલધિ દાવાનાલ આત્માપ,
બેડી, જાલ, શીતલતા વ્યાધિ સંદર્શ કરે સદા સંતાપ;
તે છેદવા વજ રવિકર, અગસ્ત્ય, જલધર, છીણી સાર,
છરી, અનિન, ઔષધ સમ જાણો નિર્જન સ્થાન પરમહિતકાર. ૫.

આર્થ :—જીવમાં વિકલ્પ (થાય) છે તે બેડી, પર્વત, કાદવ,
સમુદ્ર, પ્રબળ દાવાનાનો તાપ, વ્યાધિ, શીતલતા, અને જાળ જેવા છે
તેને અત્યંત ભેદવામાં ઉત્તમ એકાંતસ્થાન છે તે છીણી, વજ, સૂર્યકિરણ,
સમુદ્રને શોષી જનાર અગસ્ત્ય ઋષિ, મેઘ, ઔષધ, અનિન અને છરી
સમાન થાય છે. ૫.

તપસાં બાહ્ય ભૂતાનાં વિવિક્તશયનાસનં ।
મહત્ત્પો ગુણોદ્ભૂતેરાગત્યાગસ્ય હેતુતः ॥૬॥

રાગત્યાગરૂપ ગુણ પ્રગાટાવા, કારણ એ જાણો મતિમાન;
બાહ્ય તપોમાં વિવિક્ત શયા, સન તપ તેથી કહું મહાન. ૬.

આર્થ :—ગુણની ઉત્પત્તિનું અને રાગના ત્યાગનું કારણ હોવાથી
એકાંત શયન, આસન આદિ, બાહ્યભૂત તપમાં મહાન તપ છે. ૬.

કાચિચ્છિતા સંગતિ: કેનચિચ્છ રોગાદિષ્યો વેદના તીવ્રનિદ્રા ।
પ્રાદુર્ભૂતિ: ક્રોધમાનાદિકાનાં મૂર્છા જ્ઞેયા ધ્યાનવિધ્વંસિની ચ ॥૭॥

કંઈ પણ ચિંતા, સંગ કોઈના, વ્યાધિ-વેદના નિદ્રા તીવ્ર,
કોઘાદિ ઉદ્ભબ, મૂર્છા, એ ધ્યાન વિનાશક જાણો જીવ. ૭.

આર્થ :—કંઈ પણ ચિંતા તથા કોઈની સાથે પરિચયરૂપ સંગતિ,
રોગાદિથી થતી પીડા, તીવ્ર નિદ્રા, ક્રોપ, માન, માયા આદિનું પ્રગટ થવું
અને મોહની આસક્તિ; અભેને ધ્યાનના નાશ કરનાર જાણવા. ૭.

સંગત્યાગો નિર્જનસ્થાનકં ચ તત્ત્વજ્ઞાનં સર્વચિંતાવિમુક્તિઃ ।
નિર્બાધત્વં યોગરોધો મુનીનાં મુક્ત્યૈ ધ્યાને હેતોડમી નિરુક્તાઃ ॥૮॥

સંગ ત્યાગ નિર્જન સ્થળ તત્ત્વજ્ઞાન સર્વ ચિંતા દૂર થાય;
નિર્બાધત્વ યોગરોધ એ ધ્યાન હેતુથી મુનિ શિવ જાય. ૮.

આર્થ :—સંગનો ત્યાગ, એકાંતસ્થાન, તત્ત્વજ્ઞાન, સર્વ (પ્રકારની) ચિંતાનો ત્યાગ, ઉપદ્રવનો અભાવ, મન, વચન, કાયારૂપ યોગનો સંયમ મુનિઓને માટે ધ્યાનમાં આ હેતુઓ કહ્યા છે. ૮.

વિકલ્પપરિહારાય સંગ મુંચંતિ ધીઘનાઃ ।

સંગતિં ચ જનૈઃ સાર્વદ્વ કાર્ય કિંचિત્ સ્મરંતિ ન ॥૯॥

વિકલ્પને તજવાને માટે સંગ તજે સૌ મતિ-સમૃદ્ધ,
જન સંગતિ કે કાર્ય કાંઈ પણ તેનાં સ્મરે નહીં તે બુદ્ધ. ૯.

આર્થ :—જ્ઞાન જેમનું ધન છે એવા જ્ઞાનીઓ વિકલ્પના ત્યાગ માટે સંગને છોડે છે, માણસોની સાથે તેમના માર્ગોને તથા કોઈ પણ કાર્યને યાદ કરતા નથી. ૯.

વૃદ્ધિકા યુગપત્સ્પૃષ્ટાઃ પીડયંતિ યથાંગિનાઃ ।

વિકલ્પાશ્ તથાત્માનં તેષુ સત્ય કથં સુખં ॥૧૦॥

બાહ્યસંગતિસંગસ્ય ત્યાગે ચેન્મે પરં સુખં ।

અંતઃ સંગતિસંગસ્ય ભવેત् કિં ન તતોડધિકં ॥૧૧॥

એક સાથ વીંઠી બહુ ડંખે પ્રાણી પીડા લહે આપાર,
તેમ વિકલ્પો પીડે પ્રાણીને તે હોતાં સુખ કચાંથી લગાર?

બાહ્યસંગતિ સંગ ત્યાગથી મુજને ચદિ પરમ સુખ થાય,
અંતરસંગતિ સંગ ત્યાગથી તેથી અધિક સુખ શું ન પમાય? ૧૦-૧૧.

આર્થ :—જેમ એક સાથે ડંખ મારતા વીંઠીઓ પ્રાણીઓને પીડા આપે છે, તેમ વિકલ્પો આત્માને પીડે છે તથા તે વિઘ્નમાન હોતાં સુખ કેવી રીતે થાય? ૧૦.

બાધ્ય એવા લોકમાર્ગો તથા સંગપ્રસંગના ત્યાગમાં જો મને પરમ સુખ થાય છે, તો અંતરસંગતિ સંગના ત્યાગમાં તેનાથી અધિક સુખ કેમ ન થાય? ૧૧.

ब्रह्मसंगतिसंगेन सुखं मन्यते मूढधीः ।
तत्त्यागेन सुधीः शुद्धचिद्रूपध्यानहेतुना ॥१२॥
अवमौदर्यात्साध्यं विविक्तशश्यासनाद्विशेषेण ।
अध्ययनं साध्यानं मुमुक्षुमुख्याः परं तपः कुर्याः ॥१३॥

મૂઢ માતિ તો બાધ્ય સંગતિ સંગ વડે સુખ ગણે પ્રધાન; તેનો ત્યાગ વિમલ ચિદ્રૂપનો ધ્યાન હેતુ સુખ ગણે ધીમાન. ૧૨.

શ્રેષ્ઠ મુમુક્ષુ ઉંઘોદરીને વિવિક્ત શશ્યાસનથી સાધ્ય;
ધ્યાન સહિત સ્વાધ્યાય આદરે ઉત્તમ તપ એ તો આરાધ્ય. ૧૩.

આર્થિ :—અજ્ઞાની જીવ બાધ્ય સંગતિના સંગથી સુખ માને છે, (જ્યારે) સમ્યક્ભુદ્ધિવાળા-જ્ઞાની શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનનો હેતુ (હોવાથી) તે સંગના ત્યાગથી સુખ માને છે. ૧૨.

મુમુક્ષુઓમાં મુખ્યજ્ઞનો ઊંઘોદરી તપથી સાધવા યોગ્ય, વિશેષે કરીને નિર્જન સ્થાનમાં (શુદ્ધાત્માના) ધ્યાન સહિત સ્વાધ્યાયરૂપ પરમ તપ કરે છે. ૧૩.

ते वंद्याः गुणिनस्ते च ते धन्यास्ते विदांवराः ।
वसंति निजने स्थाने ये सदा शुद्धचिद्रताः ॥१४॥
निर्जनं सुखदं स्थानं ध्यानाध्ययनसाधनं ।
रागद્રेषविमोहानां शातनं सेवते सुधीः ॥१५॥

તે ગુણવંતા વંદ્ય ગણાતા ધન્ય જ્ઞાનીમાં પ્રવર મળાય,
નિર્જન સ્થાને ને જઈ વસતા ચિદ્રૂપમાં અતિ રક્ત સદાય;
નિર્જનસ્થાન અતિ સુખદાયી ધ્યાન તથા સ્વાધ્યાય નિદાન,
રાગ દ્રેષ વિમોહ વિનાશક સેવે તેને અતિ મતિમાન. ૧૪-૧૫.

આર્થ :—જેઓ હંમેશાં શુદ્ધ ચિદ્રૂપમાં રક્ત નિર્જન સ્થાનમાં વસે છે તે વંદવાયોગ્ય છે, તે ગુણવાન છે, તે ધન્ય છે અને તે તત્ત્વોમાં શ્રેષ્ઠ છે. ૧૪.

જ્ઞાની મનુષ્ય ધ્યાન અને સ્વાધ્યાયના કારણરૂપ રાગ-દ્રેષ્મોહનો નાશ કરનાર સુખદાયક નિર્જન સ્થાનનું સેવન કરે છે. ૧૫.

સુધાયા લક્ષણં લોકા વર્દંતિ બહુધા સુધા ।
બાધાજંતુજનૈર્મુક્તં સ્થાનમેવ સતાં સુધા ॥૧૬॥

ભૂમિગૃહે સમુદ્રાદિતટે પિતૃવને વને ।
ગુહાદૌ વસતિ પ્રાજ્ઞઃ શુદ્ધચિદ્રૂપસિદ્ધયે ॥૧૭॥

લોક સુધાનું લક્ષણ બહુધા ભાખે તે તો વ્યર્થ તમામ, સંતા-સુધા તો બાધા જંતુ જન વિણ નિર્જન સ્થાનનું નામ. ભૂમિગૃહ વર સિંહુ તટ પર, સ્મશાન વન ગિરિ-ગાહ્યરમાંચ, ચિદ્રૂપ ધ્યાનની સિદ્ધિ કાજે પ્રાજ્ઞ વસે નિર્જન સ્થળમાંચ. ૧૬-૧૭.

આર્થ :—લોકો સુધાનું લક્ષણ અનેક પ્રકારે કહે છે, પરંતુ તે વૃથા છે. સત્પુરુષોને તો બાધારહિત, જંતુરહિત અને મનુષ્ય રહિત એવું સ્થાન તે જ અમૃત છે. ૧૬.

તત્ત્વશાની શુદ્ધ આત્માના ધ્યાનની સિદ્ધિ કરવા માટે ભોયરામાં સમુદ્ર આદિના કંઠે, સ્મશાનમાં; અરણ્યમાં કે ગુફા આદિમાં વસે છે. ૧૭.

વિવિક્તસ્થાનકાભાવાત् યોગિનાં જનસંગમः ।
તેષામાલોકનેનૈવ વચ્ચસા સ્મરણેન ચ ॥૧૮॥

જાયતે મનસઃ સ્પંદસ્તતો રાગાદયોડખિલાઃ ।
તેભ્યઃ કલેશો ભવેત્તસ્માન્નાશં યાતિ વિશુદ્ધતા ॥૧૯॥

તથા વિના ન જાયેત શુદ્ધચિદ્રૂપચિંતનં ।
વિના તેન ન સુક્તિઃ સ્યાત् પરમાખિલકર્મણાં ॥૨૦॥

[૧૩૬]

[તત્ત્વજ્ઞાન-તરંગિએટી]

તસ્માદ્વિવક્તસુસ્થાનं જ્ઞેયં કલેશનાશનં ।
મુપુષ્કુયોગિનાં મુક્તઃ કારણં ભવવારણં ॥૨૧॥

આર્થી :—એકાંત સ્થાનકના અભાવથી યોગીઓને મનુષ્યોનો સંગ થાય, (તેથી) તેમને જોવાથી, (તેમનાં) વચ્ચેનોથી તથા સ્મરણથી તથા મનની ચંચળતાથી થાય છે, તે (ના)થી રાગાદિ સમસ્ત દોષો થાય છે, તેનાથી સંકલેશ થાય છે, તેનાથી વિશુદ્ધતા નાશ પામે છે, વિશુદ્ધતા વિના આત્મસ્વરૂપનું ચિંતન થાય નહિ અને આત્મચિંતન વિના પરમ અખિલ કર્મથી છૂટવારૂપ મુક્તિ થતી નથી. ૧૮-૧૯-૨૦.

માટે મોક્ષાર્થી યોગીઓએ એકાંત નિર્વિકાર સ્થાનને સંકલેશનો નાશ કરનારી સંસારી ભમણને અટકાવનાર મોક્ષનું કારણ જાણવું.



અધ્યાય ૧૭ મો

[શુદ્ધ ચિદ્રૂપમાં પ્રેમ વધે તે માટે વાસ્તવિક
સુખનું પ્રતિપાદન]

મુક્તાવિદુમરલધાતુરસભૂવસ્ત્રાન્નરભૂરુહાં
સ્ત્રીભાશ્વાહિગવાં નૃદેવવિદુષાં પક્ષાંબુગાનામપિ ।
પ્રાય: સંતિપરીક્ષકા: ભુવિ સુખસ્યાત્વલ્પકા હા યતો
દૃશ્યંતે ખભવે રતાશ્ચ બહુવઃ સૌખ્યે ચ નારીદ્રિયે ॥૧॥

મોતી પ્રવાલ રનિ ધાતુ રસ ભૂમિ વસ્ત્ર સુરનર વ્યાધિ,
અન્ન વૃક્ષ સ્ત્રી નાગ આશ કે પશુ પક્ષી વિદ્વાનાદિ;
બહુ પરીક્ષક એના જગમાં ઈન્દ્રિય સુખ આસક્ત દિસે,
વિરલા માત્ર પરીક્ષક જગમાં રક્ત અતીન્દ્રિય સૌખ્ય વિષે. ૧.

આર્થ :—મોતી, પરવાળાં, રન, ધાતુ, રસ, પૃથ્વી, વસ્ત્ર, અન્ન,
રોગ અને વૃક્ષોના સ્ત્રી, હાથી, ઘોડા, સર્પ, ગાય, બળદના, મનુષ્ય, દેવ
અને વિદ્વાનો, પક્ષીઓ તથા જળચર જીવોના જગતમાં પ્રાયે ધાણા
પરીક્ષકો છે પણ ખેદની વાત છે, કે સત્સુખના અતિ અભ્ય પરીક્ષકો છે,
કારણ કે ઈન્દ્રિયજન્ય સુખમાં મુખ્યત્વે સધણા રક્ત છે, અતીન્દ્રિયસુખમાં
રક્ત હેખાતા નથી. ૧.

નિર્દ્રવ્યં સ્વવશં નિજસ્થમભયં નિત્યં નિરીહં શુભં
નિર્દ્રદં નિરુપદ્રવં નિરુપમં નિર્બધમૂહાતિગં ।
ઉત્કૃષ્ટં શિવહેત્વદોષમમલં યદ્દુર્લભં કેવલં
સ્વાત્મોત્થં સુખમીદૂશં ચ સ્વભવં તસ્માદ્વિરુદ્ધં ભવેત् ॥૨॥

આત્મિક સુખ તો નિજવશ નિરૂપમ નિઃસ્પૃહ નિત્ય નિજસ્થ અહો! નિરૂપદ્રવ નિર્દ્રવ્ય અબંધક વિણ ભય શુભ આતકર્ય લઈછો; શ્રેષ્ઠ અદોષ અમલ શિવહેતુ દુર્લભ કંદ્બાતીત ગ્રહો, આવું સુખ સ્વાત્મોત્થ લઈછો, તે વિરુદ્ધ ઇન્દ્રિય સુખ ન ચહો. ૨.

અર્થ :—ધન (ની અપેક્ષા) રહિત, સ્વાધીન, આત્મામાં રહેલું, ભયરહિત, નિત્ય, નિસ્પૃહ, શુભ, દુંદુરહિત, ઉપદ્રવરહિત, ઉપમા રહિત, બંધરહિત તર્કથી પર સર્વોત્તમ, મોક્ષનું કારણ, દોષ રહિત, મળ રહિત જે કેવળ દુર્લભ છે; એવું સ્વ આત્મામાંથી ઉત્પન્ન થતું સુખ છે અને ઈન્દ્રિયજ્ઞન્ય સુખ તેનાથી વિરુદ્ધ છે. ૨.

વૈરાગ્યં ત્રિવિધં નિધાય હૃદયે હિત્વા ચ સંગે ત્રિધા
શ્રિત્વા સદ્ગુરુમાગમં ચ વિમલં ધૃત્વા ચ રત્નત્રયં।
ત્યક્ત્વાન્યૈ: સહ સંગતિં ચ સકળં રાગાદિકં સ્થાનકે
સ્થાતવ્યં નિરૂપદ્રવેઽપિ વિજને સ્વાત્મોત્થસૌખ્યાસ્પયે ॥૩॥

ભવ તન ભોગ પ્રતિ છુદ્યે વૈરાગ્ય ધરી તજુ સંગ ત્રિધા,
સદ્ગુરુ તે નિર્મલ શ્રુત ભજતાં, રત્નત્રયને ધારી મુદા;
અન્ય જીવોની સંગતિ તેમજ રાગાદિ તજુ સધાનને,
સુખ સ્વાત્મોત્થ ચાહે તે વસતા નિર્જન નિરૂપદ્રવ સ્થાને. ૩.

અર્થ :—પોતાના આત્મામાંથી ઉત્પન્ન થતું સુખ મેળવવા માટે હૃદયમાં (સંસાર, શરીર અને ભોગ પ્રયે તેમજ મન વચ્ચન કાયાથી) ત્રિવિધ વૈરાગ્ય ધારણ કરીને ચેતન, અચેતન, મિશ્ર એમ ત્રણ પ્રકારનો પરિગ્રહ છોડીને સદ્ગુરુનો અને નિર્દોષ સત્થાખનો આશ્રય કરીને, રત્નત્રય ધારણ કરીને, અન્ય સાથેનો સંગ તથા સમસ્ત રાગાદિ ભાવો તજુને ઉપદ્રવરહિત નિર્જન સ્થાનમાં રહેવું જોઈએ. ૩.

ખસુખં ન સુખં નૃણાં કિંત્વભિલાષાગ્નિવેદનાપ્રતીકારઃ ।
સુખમેવ સ્થિતિરાત્મનિ નિરાકુલત્વાદ્વિશુદ્ધપરિણામાત् ॥૪॥

ઇન્દ્રિયસુખ સુખ નહિ પણ ઇચ્છા-અભિન-વ્યથા એ શાંત કરે,
શુદ્ધ પરિણાતિ નિરાકૃત જે આત્મસ્થિતિ સુખ તે જ ખરે. ૪.

આર્થ :—ઇન્દ્રિયસુખ એ મનુષ્યોનું સુખ નથી, પરંતુ ઈચ્છારૂપ
અભિનની વેદનાને શમાવવાનો ઉપાય છે. આત્મામાં (જે) સ્થિતિ છે તે,
નિરાકૃતા હોવાથી તથા વિશુદ્ધ પરિણામ હોવાથી સુખ જ છે. ૪.

નો દ્વાતાલીર્તિતः સ્યાચ્છુભખવિષયતः સૌધતૂર્યત્રિકાદ્વા
રૂપાદિષ્ટાગમાદ્વા તદિતરવિગમાત् ક્રીડનાદ્યાદૃતુભ્યઃ ।
રાજ્યાત્સરાજમાનાત् વલવસનસુતાત્સત્કલત્રાત્સુગીતાત्
ભૂષાદ् ભૂજાગયાનાદિહ જગતિ સુખં તાત્ત્વિકં વ્યાકુલત્વાત् ॥૫॥

નહીં દ્રવ્યથી તે સત્સુખ કાંઈ, કે નહિ તે કીર્તિથી મળે,
ઇન્દ્રિયરમ્ય વિષયથી નહિં, કે જલસાથી મહેલ તળે;
મનોદ્દી છાટ પ્રાપ્તિથી તે નહિં, તેમ અનિષ્ટ વિયોગે નહીં;
સુંદર રૂપ કીડા રમણીય અથુ રાજ્ય રાજ સન્માને નહીં
વસ્ત્ર પુત્ર સ્ત્રી ભૂષણ ગીતો તરણિરિ વાહન સેવામાં,
નહીં જગતમાં તાત્ત્વિક સુખ તો મળે માત્ર આકૃતા ત્વાં. ૫.

આર્થ :—દ્રવ્યથી, કીર્તિથી, મનોદ્દી ઇન્દ્રિયના વિષયોથી અથવા
રાજમહેલ, જલસા, નૃત્ય, ગીત, વાર્ણિન એ ત્રણેથી અથવા સુંદર રૂપથી,
ઇધની પ્રાપ્તિથી અને અનિષ્ટના ત્યાગથી, કીડા આછિ કરવાથી, અનુકૂળ
અથુઓથી, રાજ્યથી, રાજ્યસન્માનથી, સેના, વસ્ત્ર કે પુત્ર-પુત્રીથી, અનુકૂળ
શીથી, મધુર ગીતથી, ભૂષણોથી, વૃક્ષ, પર્વત કે વાહનથી આ જગતમાં
તાત્ત્વિક સુખ થતું નથી. કેમ? (કારણ કે) તે સર્વમાં વ્યાકૃતા રહેલી
છે તેથી. ૫.

પૂરે ગ્રામેઝટવ્યાં નગરશિરસિ નદીશાદિસુત્રે
મઠે દર્યા ચૈત્યોકસિ સદસિ રથાદૌ ચ ભવને ।
મહાદુર્ગ સ્વર્ગે પથનમસિ લતાવસ્ત્રભવને
સ્થિતો મોહી ન સ્યાત् પરસમયરતઃ સૌખ્યલવભાક् ॥૬॥

અટવી ગ્રામ નગર નગરિખરે જલધિ તરંગિણી તટ વસતા,
આશ્રમ ઘેત્ય ગુફા રથ મંદિર સભા આદિમાં સ્થિતિ કરતા;
મહાદુર્જ નભ માર્ગ તંબૂ કે લતા મંડપે જઈ વસતા,
છતાં મોહી પરસમય રક્ત તે સત્સુખ લવ નહિ પાત્ર થતા. ૬.

અર્થ :—મોહને વશ થયેલા જીવ નગરમાં, ગામમાં, જંગલમાં,
પર્વતની ટોચ ઉપર, સમુદ્રના કાંઠે, મઠમાં, ગુફામાં, દેવાલયના
નિવાસમાં, સભામાં, રથ આદિમાં, મકાનમાં, મહાન કિલ્લામાં, સર્વામાં,
માર્ગમાં કે, આકાશમાં, લતામંડપમાં કે તંબૂમાં નિવાસ કરીને રહે; તોપણ
પરપદાર્થમાં રસ (હોવાથી) અલ્પાંશો પણ સુખનો ભોક્તા થઈ શકતો
નથી. ૬.

નિગોતે ગૂથકીટે પશુનૃપતિગણે ભારવાહે કિરાતે
સરોગે મુક્તરોગે ધનવતિ વિધને બાહનસ્થે ચ પદ્ધે।
યુવાદૌ બારવૃદ્ધે ભવતિ હિ ખસુખ તેન કિં યત્કદાચિત्
સદા વા સર્વદૈવતદપિ કિલ યતસ્તત્ત્ર ચાપ્રાસ્પૂર્વ ॥૭॥

જીવ નિગોદે કે વિષાધમાં, પશુ નૃપ, ભીલ કો ભાર વહે,
રોગી નિરોગી ધનિક દરિદ્રી પગ કે વાહનથી વિછારે;
બાલ યુવાન વૃદ્ધ એ સૌનાં છન્દ્રિય સુખ કદી હોય સદા,
તોપણ તેનું કામ શું મરે અપૂર્વ નહિ તે સુલભ બધાં. ૭.

અર્થ :—જે ઈન્દ્રિયજન્ય સુખ નિગોદમાં, વિષાધાના કીડામાં, પશુ
કે નૃપતિના સમૂહમાં, ભાર વહેનાર મજૂરમાં, ભીલમાં, રોગમાં,
નીરોગીમાં, ધનવાનમાં, ધનહીનમાં, વાહનમાં ફરનારમાં, પગે
ચાલનારમાં, યુવાન આદિમાં, બાળક કે વૃદ્ધમાં કોઈ વાર હોય છે; કદાચ
એ સદા સર્વદા હોય તો ય તેથી શું? (તેનાથી મારે શું પ્રયોજન છે?)
કારણ કે તે કદી મને મળ્યું ન હોય એવું અપૂર્વ નથી. ૭.

જ્ઞાયાવલોકનં જ્ઞાનં સિદ્ધાનાં ભવિનાં ભવેત् ।
આદ્યાનાં નિર્વિકલ્પં તુ પરેષાં સવિકલ્પકં ॥૮॥

જોય પદાર્�ો જાણે દેખે સિદ્ધ તથા સંસારી છતાં,
સંસારીનું જ્ઞાન વિકલ્પક, સિદ્ધતણું અવિકલ્પક ત્યાં. ૮.

આર્થ :—સિદ્ધ આત્માઓને, સંસારી જીવોને, જોય પદાર્થનું દર્શન જ્ઞાન થાય છે, પણ સિદ્ધોને તે જ્ઞાન દર્શન વિકલ્પરહિત હોય છે અને સંસારીઓને (તે) વિકલ્પ સહિત હોય છે. ૮.

વ્યાકુલः સવિકલ્પः સ્યાત્રિવિકલ્પો નિરાકુલः।

કર્મબંધોऽસુખં ચાદ્રે કર્મભાવः સુખं પરે॥૬॥

નિર્વિકલ્પ તો નિરાકુલ ને વ્યાકુલ વિકલ્પવંત સદા,
કર્મનાશ સત્સૌખ્ય પ્રથમને, કર્મ-દુઃખયુત અન્ય બધા. ૯.

આર્થ :—વિકલ્પ સહિત જીવ દુઃખી હોય છે અને નિર્વિકલ્પ
જીવ સુખી હોય છે. પ્રથમ (સવિકલ્પ)ને કર્મનો બંધ થાય છે અને
દુઃખ થાય છે. બીજાને (-નિર્વિકલ્પને) કર્મનો અભાવ અને સુખ થાય
છે. ૯.

બહૂન् વારાન् મયા ભુક્તં સવિકલ્પં સુખં તતઃ।

તત્ત્રાપૂર્વં નિર્વિકલ્પે સુખે�સ્તીહા તતો મમ॥૧૦॥

પૂર્વે એ સવિકલ્પ સૌખ્ય મેં અનુભવ્યું બહુ વાર આહા!

તેથી તે ન અપૂર્વ મને તો નિર્વિકલ્પ સુખ વિષે સૃષ્ટા. ૧૦.

આર્થ :—સવિકલ્પ સુખ મેં ઘણીવાર ભોગવ્યું છે, તેથી તે (મારા
માટે) અપૂર્વ નથી, તેથી મને નિર્વિકલ્પ સુખ પ્રત્યે સૃષ્ટા છે. ૧૦.

જ્ઞેયજ્ઞાનं સરાગેણ ચેતસા દુઃખમંગિનઃ।

નિશ્ચયશ્ચ વિરાગેણ ચેતસા સુખમેવ તત्॥૧૧॥

રાગાદિયુત ચિત સહિત જો જાણે જોય વરસુ દુઃખ તો;
પણ જો જાણે ચિત-વિરાગે નિશ્ચયથી જીવને સુખ તો. ૧૧,

આર્થ :—રાગયુક્ત ચિતથી જોય પદાર્થનું જ્ઞાન પ્રાણીને દુઃખ

[૧૪૨]

[તત્ત્વજ્ઞાન-તરંગિણી]

આપે છે અને રાગરહિત મનથી તે શાન સુખ જ છે, એ નિશ્ચય છે. ૧૧.

રૂપે: સુધાયા: સુરપાદપસ્ય ચિંતામણોરુત્તમકામધેનો: ।
દિવો ષિદગધસ્ય હરેરહ્રવ્વ ગર્વ હરન્ ભો વિજયી ચિદાત્મા ॥૧૨॥

સૂર્ય સુધા સુરતસુ સુરમણિ કે સુરધેનુ સુરસદન મહા,
વિષણુ આદિના ગર્વ છે એ પ્રબળ ચિદાત્મા વિજયી આહા! ૧૨.

અર્થ:—હે આત્મન! ચૈતન્યસ્વરૂપ શુદ્ધ આત્મા સૂર્યના,
અમૃતના, કલ્યાણના, ચિંતામણિ રત્નના, ઉત્તમ કામધેનુના, દેવલોકના,
પંડિતના, વિષણુના અખંડિત ગર્વને ચક્યૂર કરીને અખંડ પ્રતાપવાન વર્તે
છે. ૧૨.

ચિંતા દુઃખં સુખં શાંતિસ્તસ્યા એતત્ત્રતીયતે ।
તચ્છાંતિર્જાયતે શુદ્ધચિદ્રૂપે લયતોઽચલા ॥૧૩॥

ચિંતા એ દુઃખ સુખ શાંતિ છે એ શાંતિથી પ્રતીત બને;
નિર્મલ ચિદ્રૂપમાં લય લાગ્યે અચલ શાંતિ પ્રગટે જીવને. ૧૩.

અર્થ:—ચિંતા એ દુઃખ છે, શાંતિ એ સુખ છે, આ વાત
શાંતિથી વિચારતાં પ્રતીતિમાં આવે છે. તે અચલ શાંતિ શુદ્ધ ચિદ્રૂપમાં
લય લાગવાથી પ્રગટ થાય છે. ૧૩.

મુંચ સર્વાણિ કાર્યાણિ સંગં ચાન્યૈશ્ચ સંગતિં ।
ભો ભવ્ય! શુદ્ધચિદ્રૂપલયે વાંછાસ્તિ તે યદિ ॥૧૪॥

નિર્મલ ચિદ્રૂપમાં લયની જો વાંછા છે હે ભવ્ય! તને,
તો તજ સર્વ કાર્ય, બહિરંતર સંગ સંગતિ અન્યજને. ૧૪.

અર્થ:—હે ભવ્ય! જો શુદ્ધ ચિદ્રૂપના લયની તને ઈચ્છા હોય,
તો સર્વ (બાધ) કાર્યો તથા પરપદાર્થોનો બાધ અને અંતર સંગ તું છોડી
દે. ૧૪.

મુક્તે બાહો પરદવ્યે સ્યાત્સુખં ચેચ્છિતો મહત્તુ।
સાંપ્રતં કિં તદાદોડતઃ કર્મદૌ ન મહત્તરં ॥૧૬॥

મુક્ત થતાં પરદવ્યે બાહ્યથી જો જીવને સુખ આતીવ દીસે,
તો પછી કર્માદિથી મુક્તાને શ્રેષ્ઠ સૌખ્ય શું ના ઉલ્લસે? ૧૫.

આર્થ :—બાહ્ય પરદવ્યનો ત્યાગ કરતાં જો આત્માને મહાન સુખ
થાય છે, તો હવે કર્માદિને છોડતાં આનાથી વિશેષ સુખ આત્માને કેમ
થાય? ૧૫.

ઇન્દ્રિયૈશ્ચ પદાર્થાનાં સ્વરૂપં જાનતોઽગિનઃ ।
યો રાગસ્તત્તુખં દ્વેષસ્તદ્દુઃખં ભ્રાંતિજં ભવેત् ॥૧૬॥
યો રાગાદિવિનિર્મુક્તઃ પદાર્થાનખિલાનપિ ।
જાનન્નિરાકુલત્વં યત્તાત્ત્વિકં તસ્ય તત્તુખં ॥૧૭॥

પ્રાણી વસ્તુસ્વરૂપ જાણતાં, માત્ર બાહ્ય ઇન્દ્રિય જ્ઞાને,
ત્યાં જે રાગ, ગાણે સુખ તેને, દ્વેષ દુઃખ બ્રમથી માને;
રાગાદિથી મુક્તા સંત જે સર્વ વસ્તુ જાણે તોયે,
નિરાકુલતા ત્યાં તેઓને, તે જ સૌખ્ય તાત્ત્વિક હો યે. ૧૬-૧૭.

આર્થ :—પદાર્થાનાં સ્વરૂપને ઇન્દ્રિયો વડે જાણતાં જીવને તેમાં જે
રાગ છે, તે ભ્રાંતિથી થતું સુખ છે અને જે દ્વેષ છે, તે ભ્રાંતિજન્ય દુઃખ
છે. ૧૬.

સર્વ પદાર્થાને જાણવા છતાં પણ જે જીવ રાગાદિથી અત્યંત મુક્ત
છે તેને જે નિરાકુળતા છે, તે તાત્ત્વિક (સાચું) સુખ છે. ૧૭.

ઇંદ્રાણાં સાર્વભौમાનાં સર્વેષાં ભાવનેશિનાં ।
વિકલ્પસાધનै: સાર્થૈવ્રાકુલત્વાત્સુખં કુત: ॥૧૮॥
તાત્ત્વિકં ચ સુખં તેષાં યે મન્યંતે બ્રુવંતિ ચ ।
એવં તેષામહં મન્યે મહતી ભ્રાંતિરૂપ્તા ॥૧૯॥

[૧૪૪]

[તત્ત્વજ્ઞાન-તરંગિએટી]

શક ચકી કે ભવનવાસીના ઇન્દ્ર તથા ઇન્દ્રિય વિષયો,
વિકલ્પકારક હોવાથી ત્યાં આકુળતા, સુખ કર્યાંથી કહો?
તે સુખને તાત્ત્વિક જે માને તથા વર્ણવી તે રૂપે,
અહા! ભ્રાન્તિ મોટી તેઓને માનું ભમાવે ભવકૂપે. ૧૮-૧૯.

અર્થ :—ઇન્દ્રોના, ચક્રવર્તીઓના, સર્વ ભવનવાસી દેવોના,
ઇન્દ્રોના વિકલ્પના (રાગાદિનાં) સાધન એવા ઇન્દ્રિયવિષયોથી સુખ
કર્યાંથી હોય? કેમ કે ત્યાં વ્યાકુળતા છે. ૧૮.

તેઓના સુખને જે તાત્ત્વિક (સાચું) ગણે છે અને કહે છે, તેમને
મહાન ભ્રાન્તિ ઉપજુ છે, એમ હું માનું છું. ૧૯.

વિમુચ્ય રાગાદિ નિજં તુ નિર્જને
પદે સ્થિરતાનાં સુખમત્ર યોગિનાં।
વિવેકિનાં શુદ્ધચિદાત્મચેતસાં
વિદાં યદા સ્યાન્ન હિ કસ્યચિત્તથા ॥૨૦॥

(શિખરણી)

તજુ રાગાદિને વિજન પદમાં સ્થિતિ ઘરતા,
અહા! ઝાની નિત્યે સ્વકીય પરનો બેદ કરતા;
વિવેકા એ ચિત્રે સહજ નિજરૂપે રત રહે,
વરે યોગી તેવું નિજ સુખ કદી અન્ય ન લાદે. ૨૦.

અર્થ :—રાગાદિનો ત્યાગ કરી, નિર્જનસ્થળમાં સ્થિતિ કરનારને,
યોગીઓને, જડ ચેતનના બેદજ્ઞાનરૂપ વિવેકવાળાઓને, શુદ્ધ
આત્મસહરૂપમાં જેમનું ચિત્ર લીન છે એવાઓને, આત્મજ્ઞાનીઓને અહીં
જેવું આભિક સુખ પ્રગટ થાય છે, તેવું (બીજા) કોઈને પ્રગટવું સંભવતું
નથી. ૨૦.



ાધ્યાય ૧૮ મો

[શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનો કમ]

શ્રુત્વા શ્રદ્ધાય વાચા ગ્રહણમમપિ દૃઢં ચેતસા યો વિધાય
કૃત્વાંતઃ સ્થૈર્યબુદ્ધ્યા પરમનુભવનં તલ્લયં યાતિ યોગી।
તસ્ય સ્યાત્કર્મનાશસ્તદનું શિવપદં ચ ક્રમેણેતિ શુદ્ધ-
ચિદ્રૂપોऽહં હિ સૌખ્યં સ્વભવમિહ સદાસત્ત્ર ભવ્યસ્ય નૂં ॥૧॥

(મંદાકાંતા છંદ)

‘શુદ્ધાત્મા હું, મુજ સ્વરૂપ એ,’ સુણી શ્રદ્ધા કરીને,
ધારે તેને મન વચનથી એક નિષ્ઠા ધરીને;
બુદ્ધિ ઉરે સ્થિર ધરી અતિ અન્યને બિન્ન જાણે,
યોગી તે તો અનુભવ લહે લીનતા તત્ત્વતાને.
નિશ્ચે એવા નિકટભવિનાં કર્મ તો નાશ પામે,
પ્રાપ્તિ તેને શિવપદતણી, સિદ્ધિમાં તે વિરામે;
આવે એના ભવભ્રમણનાં દુઃખનો અંત પૂર્ણ,
ને એ સ્વાત્મોત્ત્યિત સુખ સદાસ્વાદ પામે પ્રપૂર્ણ. ૧.

અર્થ :—‘હું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મા છું’ એમ સાંભળીને,
નિઃશંકપણે તે સત્ય છે એમ શ્રદ્ધા કરીને વાણીથી અને અંતર્વૃત્તિથી પણ
દેખતાથી ગ્રહણ કરીને, અંતરમાં મનની સ્થિરતા કરી, સર્વોત્તમ એવો
શુદ્ધાત્માનો અનુભવ કરીને, જે યોગી તે સ્વાનુભવમાં લય પામે છે, તે
આસન્નભવ્યના કર્મનો કર્મે કરીને અવશ્ય નાશ થાય છે અને ત્યાર પછી
(તેને) મોક્ષપદની પ્રાપ્તિ અને સદાકાળ રહેતું આત્મિક સુખ અહીં જ
પ્રાપ્ત થાય છે. ૧.

૧૪૬]

[તત્ત્વજ્ઞાન-તરંગિણી

ગૃહિભ્યો દીયતે શિક્ષા પૂર્વ ષટ્કર્મપાલને ।
ક્રતાંગીકરણે પશ્ચાત્સંયમગ્રહણે તત: ॥૨॥
યતિભ્યો દીયતે શિક્ષા પૂર્વ સંયમપાલને ।
ચિદ્રૂપચિંતને પશ્ચાદ્યમુક્તો બુધૈ: ક્રમ: ॥૩॥

શિક્ષા દેવી પ્રથમગૃહીને કર્મ ષટ્ પાલવાની,
લેવાં લેણે વ્રત પછી સ્થિતિ સંયમે ધારવાની;
શિક્ષા દેવી પ્રથમ યતિને સંયમો પાલવાની,
ચિદ્રૂપે ચિંતન પછી કરે એ કર્મ જ્ઞાની-વાણી. ૨-૩.

અર્થ :—ગૃહસ્થોને પહેલાં છે. નિત્યકર્મના પાલનનો બોધ
આપવામાં આવે છે, પછી વ્રતો અંગીકાર કરવાની અને ત્યાર પછી સંયમ
ગ્રહણ કરવાની શિક્ષા અપાય છે. ૨.

મુનિઓને પ્રથમ સંયમ પાળવાની શિક્ષા અપાય છે અને પછી
ચિદ્રૂપનું ધ્યાન કરવાની શિક્ષા આપવામાં આવે છે; આ કર્મ જ્ઞાનીઓએ
કહ્યો છે. ૩.

સંસારભીતિત: પૂર્વ રુચિર્મુક્તિસુખે દૃઢા ।
જાયતે યદિ તત્ત્વાસેરૂપાય: સુગમોસ્તિ તત् ॥૪॥
યુગપજાયતે કર્મમોચનં તાત્ત્વિકં સુખં ।
લયાચ્ચ શુદ્ધચિદ્રૂપે નિર્વિકલ્પસ્ય યોગિન: ॥૫॥

લાગ્યે ભીતિ ભવતાણી, ઉગે, મુક્તિસૌખ્યે સુખિ,
મુક્તિહેતુ સુગમ અતિ તો આધ તે તીવ્ર રહિયિ,
પામે યોગી સત્ત સુખ અને કર્મ મુક્તિય સાથે,
નિર્વિકલ્પી યાદિ લય લહે શુદ્ધ ચિદ્રૂપમાં તે. ૪-૫.

અર્થ :—જો સૌથી પ્રથમ સંસારના ભયથી મોક્ષસુખમાં દેછ રહિયિ
ઉત્પન્ન થાય, તો તે મોક્ષસુખની પ્રાપ્તિનો સહેલો ઉપાય છે. ૪.

શુદ્ધ ચિદ્રૂપમાં તલ્લીન થવાથી નિર્વિકલ્પ યોગીને કર્મથી મુક્તિ અને તાત્ત્વિક સુખ એકસાથે પ્રગટે છે. ૫.

અષ્ટાવંગાનિ યોગસ્ય યમો નિયમ આસનં ।
પ્રાણાયામસ્તથા પ્રત્યાહારો મનસિ ધારणા ॥૬॥
ધ્યાનશૈવ સમાધિશ્વ વિજ્ઞાયैતાનિ શાસ્ત્રતઃ ।
સદૈવાભ્યસનીયાનિ ભદ્રંતેન શિવાર્થિના ॥૭॥

(હરિગીત)

યમ નિયમ આસન તેમ પ્રાણાયામ પ્રત્યાહારને,
મનધારણા સદ્ધ્યાને પ્રાંતે સમાધિ સાર જે;
સત્તાસ્ત્રથી જાણી યથારથ યોગનાં અષ્ટાંગ એ,
અભ્યાસ તેનો નિત્ય કરવો, સર્વ ભવ્ય શિવાર્થીએ. ૬-૭.

અર્થ :—યમ (આખા જીવન માટે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મયર્થ અને અપરિગ્રહ એ પાંચ વ્રત અંશે કે પૂર્ણપણે પાળવા તે), નિયમ (શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ધ્યાન અથવા ત્યાગ, મૌન, ઉપવાસ વગેરે થોડા સમય માટે લેવામાં આવે તે નિયમ છે), આસન (યોગનાં અનેક આસનોમાંથી એક આસને બેસવાનો દ્દઠ અભ્યાસ), પ્રાણાયામ (શાસજ્ય), વિષયોથી ઈન્દ્રિયને પાછી વાળવી તે, તત્ત્વસ્વરૂપ ધ્યેયને મનમાં ધારણ કરવું તે; ધ્યાન (ધ્યેયમાં વિશેષ એકાગ્રતા), તથા સ્વરૂપમાં નિરંતર સ્થિતિ તે સમાધિ, આ યોગના આઠ અંગ યોગશાસ્ત્રથી જાણીને મોક્ષાર્થી ભવ્ય જીવે (તેમનો) નિત્ય અભ્યાસ કરવા યોગ્ય છે. ૬-૭.

ભાવાનુક્તો ભવેચુદ્ધચિદૂપોહમીતિસૃતે: ।
યદ્યાત્મા ક્રમતો દ્રવ્યાત્મ કથં ન વિધીયતે ॥૮॥
ક્ષણે ક્ષણે વિમુચ્યેત શુદ્ધચિદૂપચિંતયા ।
તદન્યચિંતયા નૂં બધ્યેતૈવ ન સંશય: ॥૯॥

હું શુદ્ધ ચિદ્રૂપ એમ સ્મરતાં ભાવમુકૃત થવાચ જ્યાં,
આત્મા ક્રમે કરી તો પછી શું દ્રવ્ય મુક્તા ન થાય ત્વાં;
ક્ષણ ક્ષણ મુકાયે કર્મથી જીવ શુદ્ધ ચિદ્રૂપ-ચિંતને,
બંધાચ તે પરદ્રવ્ય-ચિંતનથી ન સંશાચ સુજાને. ૮-૯.

અર્થ :—જો આત્મા હું શુદ્ધ ચિદ્રૂપ છું એમ સ્મરણ કરીને
ભાવથી મુક્ત થાય, તો ક્રમે ક્રમે તે દ્રવ્યથી મુક્ત કેમ ન થાય? ૮.

શુદ્ધ ચિદ્રૂપના ચિંતનથી (જીવ) ક્ષણે-ક્ષણે મુક્ત થાય (છે) અને
તેનાથી બીજી ચિંતા કરવાથી ખરેખર તે બંધાય જ (છે); એમાં સંશય
નથી. ૯.

સયોગક્ષીણમિશ્રેષુ ગુણસ્થાનેષુ નો મૃતિ: ।
અન્યત્ર મરણ પ્રોક્તં શેષત્રિક્ષપકૈર્વિના ॥૧૦॥
મિથ્યાત્વેડવિરતે મૃત્યા જીવા યાંતિ ચર્તુર્ગતીઃ ।
સાસાદને વિના શ્વર્ભં તિર્યગાદિગતિત્રયં ॥૧૧॥

ગુણસ્થાન ત્રીજે બારમે ને તેરમે મૃત્યુ નહીં,
ના ક્ષપક શ્રેણીમાં મરણ કહ્યું અન્ય ગુણસ્થાનો મહીં;
મિથ્યાત્વ અવિરતિમાં મરણ થાતાં ચર્તુર્ગતિ જીવ જતા,
સાસાદને મૃત્યુ થતાં વિણ નરક પ્રણ ગતિ પામતા. ૧૦-૧૧.

અર્થ :—તેરમા સયોગ કેવળી, બારમા ક્ષીણમોહ અને ત્રીજા
મિશ્ર ગુણસ્થાનોમાં મરણ થતું નથી. બીજાં ત્રણ ક્ષપક શ્રેણીના ૮-૯-
૧૦ ગુણસ્થાન વિના બાકીના બીજા ગુણસ્થાનોમાં મરણ થાય છે, એમ
કહ્યું છે. ૧૦.

પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં, ચોથા અવિરત સમ્યકૃત
ગુણસ્થાનમાં, મરણ પામેલા જીવો ચાર ગતિમાંની કોઈ એક ગતિમાં જાય
છે, બીજા સાસાદન ગુણસ્થાનમાં મરણ પામેલા જીવ નરક સિવાય,
તિર્યચ, મનુષ્ય ને દેવ એ ત્રણ ગતિમાંની કોઈ એક ગતિમાં જાય છે. ૧૧.

અયોગે મરણ કૃત્વા ભવ્યા યાંતિ શિવાલયં ।

મૃત્વા દેવગતિં યાંતિ શેષેષુ સપ્તસુ ધ્રુવં ॥૧૨॥

ભવ્યો અયોગી ગુણસ્થાને મરણથી શિવ પહોંચતા,
ગુણસ્થાન બાકી સાત તેમાં મરણ કરી સુરગતિ જતા. ૧૨.

આર્થ :—ભવ્ય જીવો અયોગી (ચૌદમા) ગુણસ્થાનકે મરણ કરીને
મોક્ષસ્થાનમાં જાય છે અને બાકીના સાતમાં મરીને નિશ્ચયથી દેવગતિમાં
જાય છે. ૧૨.

શુદ્ધચિદ્રૂપસદ્ગ્રયાનં કૃત્વા યાંત્વધુના દિવં ।

તર્ત્રેદિયસુખં ભુક્ત્વા શ્રુત્વા વાર્ણિં જિનાગતાં ॥૧૩॥

જિનાલયેષુ સર્વેષુ ગત્વા કૃત્વાર્ચનાદિકં ।

તતો લબ્ધ્વા નરરત્વં ચ રત્નત્રય વિભૂષણં ॥૧૪॥

શુદ્ધચિદ્રૂપસદ્ગ્રયાનબલાત્કૃત્વા વિધિક્ષયં ।

સિદ્ધસ્થાનં પરિપ્રાપ્ય ત્રૈલોક્યશિખરે ક્ષણાત् ॥૧૫॥

સાક્ષાત્ચ શુદ્ધચિદ્રૂપા ભૂત્વાત્યંતનિરાકુલાઃ ।

તિષ્ઠંત્વનંતકાલં તે ગુણાષ્ટક સમન્વિતાઃ ॥૧૬॥

જન શુદ્ધ ચિદ્રૂપનું કરી સદ્ગ્રયાન સુર અધુના થતા;
ઇન્દ્રિય સુખ ત્યાં બોગાવી, જિનવાણી સુણવા પામતા. ૧૩.

ત્યાં સર્વ જિનમંદિર વિષે, વિચારે પૂજાદિ આયરે,
ત્યાંથી ફરી નરભવ અને વળી રત્નત્રય ભૂષણ ધરે;
ત્યાં શુદ્ધ ચિદ્રૂપ ધ્યાનના બળથી કરમનો કથ્ય કરે,
કથાં એકમાં અણ લોક શિખરે સિદ્ધસ્થાને જઈ છરે. ૧૪-૧૫.

અત્યંત નિરાકુળ બની સાક્ષાત્ ચિદ્રૂપ શુદ્ધ તે,
રાજે અનંતા કાળ સુખમાં આટ ગુણ સમૃદ્ધ તે. ૧૬.

આર્થ :—આ વર્તમાન કાળમાં શુદ્ધ ચિદ્રૂપનું સત્રધ્યાન કરીને

૧૫૦]

[તત્ત્વજ્ઞાન-તરંગિણી

જીવ દેવલોકમાં જાય છે, ત્યાં ઈન્દ્રિય સુખ ભોગવીને જિનભગવાનની વાણી સાંભળીને, સર્વ જિનમંદિરોમાં જઈને પૂજા આદિ કરીને, ત્યાર પછી મનુષ્યભવ અને રત્નત્રયરૂપ ભૂષણ પ્રાપ્ત કરીને, શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનના બણથી, કર્મનો નાશ કરીને, ક્ષણમાં ત્રણ લોકના શિખર ઉપર સિદ્ધસ્થાન પામીને તથા સાક્ષાત્ શુદ્ધ ચિદ્રૂપ બનીને આઠ ગુણથી યુક્ત તેઓ અત્યંત નિરાકૃણ (સુખમય બનીને) અંતકાળ સુધી વિરાજે છે. ૧૩-૧૪-૧૫-૧૬.

ક્રમતः ક્રમતો યાતિ કીટિકા શુકવત્ફલં ।

નગસ્થं સ્વસ્થિતં ના ચ શુદ્ધચિદ્રૂપચિંતનं ॥૧૭॥

ક્રમથી ચઢી કીડી તસુ પર સ્વાદુ ફલ શુકવત્ ગ્રહે,
ક્રમથી જનો ચિદ્રૂપ ચિંતન શુદ્ધ સ્વસ્થિત ત્વય લણે. ૧૭.

આર્થ:—ક્રમે ક્રમે ચઢીને કીડી વૃક્ષ ઉપર રહેલા ફળ પાસે પોપટની માફક પહોંચે છે અને મનુષ્ય પોતામાં રહેલા શુદ્ધ ચિદ્રૂપના ચિંતનને તે જ પ્રમાણે ક્રમે કરીને પામે છે. ૧૭.

ગુર્વાદીનાં ચ વાક્યાનિ શ્રુત્વા શાસ્ત્રાણ્યનેકશः ।

કૃત્વાભ્યાસં યદા યાતિ તદ્વિ ધ્યાનં ક્રમાગતં ॥૧૮॥

જિનેશાગમનિર્યાસમાત્રં શ્રુત્વા ગુરોર્વચઃ ।

વિનાભ્યાસં યદા યાતિ તદ્ધ્યાનં ચાક્રમાગતં ॥૧૯॥

ગુરુ આદિનાં બહુ વચન સુણી, વળી ભણી શાસ્ત્ર અનેક જે;
અભ્યાસ કરીને ધ્યાન લઈએ, ક્રમાગત કહું ધ્યાન તે. ૧૮.

જિન શાસ્ત્ર કેવળ સાર જે ગુરુ-વચન એક સુણી યદા,
અભ્યાસવિષા તદ્ધ્યાન પ્રાપ્તિ, અક્રમાગત તે તદા. ૧૯.

આર્થ:—ગુરુ આદિનાં વચનો તથા અનેક પ્રકારના શાસ્ત્રો સાંભળીને, (તેમનો) અભ્યાસ કરીને જ્યારે ધ્યાન પમાય છે, ત્યારે તે ખરેખર ક્રમથી પ્રાપ્ત થયેલું ધ્યાન ગણ્ણાય છે. ૧૯.

અને જિનેન્દ્રભગવાનનાં શાસ્ત્રોના સંપૂર્ણ એક સારરૂપ માત્ર સદ્ગુરુનું વચ્ચે સાંભળીને (અનેક) શાસ્ત્રોના અભ્યાસ વિના જ્યારે જીવ ધ્યાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે અક્ષમાગત ધ્યાન કહેવાય છે. ૧૮.

ન લાભમાનકીર્તિશ્રદ્ધા કૃતા કૃતિરિયં મયા।

કિંતુ મે શુદ્ધચિદ્દૂપે પ્રીતિઃ સેવાત્રકારણં ॥૨૦॥

(ઉપજાતિ)

ન લાભ માટે, નહિ માન અર્થે,
કૃતિ રચી આ નહિ કીર્તિ અર્થે;
જે શુદ્ધ ચિદ્દૂપમાં પ્રીતિ મારી,
તે માત્ર અને કૃતિ હેતુ ભારી. ૨૦.

અર્થ :—આ (ગ્રંથ રચના રૂપ) કૃતિ મેં કાંઈ પણ મેળવવા માનાર્થે કે કીર્તિ પ્રાપ્ત કરવા માટે કરી નથી, પરંતુ મારી શુદ્ધ ચિદ્દૂપમાં જે પ્રીતિ છે તે માત્ર આ રચનામાં કારણ છે. ૨૦.

જાતઃ શ્રીસકલાદિકીર્તિમુનિપ: શ્રીમૂલસંઘેગણી—
સત્ત્વદ્વોદ્યપર્વતે રવિરભૂદ્વિંબુજાનંદકૃત् ।
વિખ્યાતો ભુવનાદિકીર્તિરથ યસ્તત્પાદપંકજે રતઃ:
તત્વજ્ઞાનતરંગિણીં સ કૃતવાનેતાં હિ ચિદ્ભૂષણ: ॥૨૧॥

શ્રી મૂલ સંઘે અગ્રેણી, શ્રી સકલકીર્તિ મુનિવરા,
તે પણુંપ ઉદ્યાયણે, ભવિજન-કમલ-ઇર્ષિત કરા;
રવિ સમ ભુવનકીર્તિ થયા, તેનાં ચરણમાં રતિ ઘણી,
તે જ્ઞાનભૂષણની કૃતિ આ, તત્વજ્ઞાન તરંગિણી. ૨૧.

અર્થ :—શ્રી મૂળસંઘમાં અગ્રેસર સકલકીર્તિ નામે આચાર્ય થયા.
તેમના પણુંપ ઉદ્યાયણ પર ભવ્યજીવોરૂપ કમળોને વિકસાવી આનંદ
આપનાર પ્રભ્યાત ભુવનકીર્તિ સૂર્યસમાન થયા, ત્યાર પછી જે તેમના
ચરણકમળમાં રત જ્ઞાનભૂષણ થયા, તેમણે આ તત્વજ્ઞાન તરંગિણી
નામનો ગ્રંથ રચ્યો છે. ૨૧.

ક્રીડંતિ યે પ્રવિશ્યેનાં તત્ત્વજ્ઞાનતરંગિણોં ।

તે સ્વર્ગાદિસુખં પ્રાપ્ય સિદ્ધયંતિ તદનન્તરં ॥૨૨॥

આ તત્ત્વજ્ઞાન તરંગિણીમાં કે પ્રવેશી ત્યાં રહે,
સ્વર્ગાદિ સુખને પામીને સિદ્ધ વરે તે અનુકરે. ૨૨.

અર્થ :—જેઓ આ તત્ત્વજ્ઞાનરૂપ નદીમાં પ્રવેશીને કીડા કરે છે,
તેઓ સ્વર્ગાદિ સુખ પામીને પછી સિદ્ધ થાય છે. ૨૨.

યદૈવ વિક્રમાતીતા: શતપંચદશાધિકા: ।

બણ્ઠિ: સંવત્સરા જાતાસ્તદેયં નિર્મિતા કૃતિ: ॥૨૩॥

જ્યાં વર્ષ પંદરસો અને વળી સાઠ વિક્રમનાં વિત્યાં,
શ્રી જ્ઞાનભૂપણ કવિવરે રચી આ કૃતિ આતિ સુખદ ત્યાં. ૨૩.


અર્થ :—જ્યારે વિક્રમ સંવત્સરનાં પંદરસો સાઠ વર્ષો વીતી ગયાં,
ત્યારે આ કૃતિ રચાઈ છે. ૨૩.

ગ્રંથસંખ્યાત્ર વિજ્ઞેયા લેખકૈ: પાઠકૈ: કિલ ।

પટ્રિંશદધિકા પંચશતી શ્રોતૃજનૈરપિ ॥૨૪॥

લેખક પાઠક શ્રોતૃજન, લહે સ્વરૂપ સંભાળ;
જાણી સંખ્યા પાંચસો, છત્રીસ શ્લોક રસાળ. ૨૪.

અર્થ :—આ ગ્રંથના લેખક, પાઠકોએ અને શ્રોતાઓએ આ
ગ્રંથની શ્લોક સંખ્યા પાંચસો છત્રીસ જાણવી.



अनुभूति तीर्थ महान्, स्वार्धपुरी सोहे
यह इष्टानगुरु वरदान, मंगल मुक्ति भिते.

